

સુવિષ્ણુ

ANCIENT INDIA

(B. C. 900 to A. D. 100=1000 years)

Unparalleled and unprecedented

Because

- It has a continuous chronology.
- It is full of bomb-shell-like and astounding theories, either quite newly proposed or presented with new garments.
- All statements are based on inscriptions, coins, evidences of recognized authors and government reports.
- Hence it is *sanctioned* by the Director of Public Instruction
- And *approved* by the University of Bombay
- And recommended by many personages of note and scholarship.

Price : First Vol. Rs. 7/-, Second Rs. 10/-, Third Rs. 9/-,
Fourth Rs. 9/- Total Rs. 35/-

To subscribers for the whole set Rs. 30/-.

Please send your orders to:—

SHASHIKANT & Co.

ORIENTAL PUBLISHERS

Raopura, opp. Tower, Baroda

Sole Distributors:—

THE NEW BOOK Co.

Hornby Road, Fort, Bombay

સુવા

THE SURATI BAKERY

RAOPURA ROAD, BARODA
IS THE BEST HOUSE FOR DELICIOUS SWEETS

A visit to our show-room will convince you of our quality biscuits and a taste of our samples will delight you with the delightful sweetness of our biscuits.

Place with us your order for Christmas Cake and other like preparations.

Our Speciality—Sweet, invigorating, harmless biscuits for children of one year to five years old. Special biscuits and khari paff best. We also stock English Toffi and chocolates to suit all tastes.

Come ! and taste our delicious delicacies.

Proprietor:—G. R. & SONS

Please mention "Suvas" when visiting the advertised shops.

MODERN PHOTOZINCO

BLOCK MAKERS

LINE, HALFTONE

&

TRICOLOURS
HIGH CLASS
SPECIAL SCREEN
ARRANGEMENTS

FOR
FINE WORK

Prop: M. S. PUNEKAR

RAOPURA, BARODA

સુવાસ કાર્યાલયના નિયમો

‘સુવાસ’ દરેક અંગ્રેજ મહિનાની પાંચમી તારીખ સુધીમાં નિયમિતપણે પ્રગટ થશે. નમુનાનો અંક મંગાવનારે પાંચ આનાની રિક્રિટો બીડવી.

‘સુવાસ’મા પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. ૦૩ થી ૧ સુધી આપવામાં આવશે. આવો મુરસ્કાર સ્વીકારણ સામે જેમને વાંધો ન હોય તેમણે ચોતાનો લેખ મોકલતી વખતે તે લેખના હાંસીયામાં ‘પુરસ્કાર’ શાખદ લખનો. લેખકને તેમનો લેખ પ્રગટ થયા પછી સાત દિવસની અંદર પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને ‘સુવાસ’ના આહક ગણી તેમને ભજતાં મુરસ્કારમાંથી તેમનું આહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણુશે. દરેક લેખકને તેના લેખની પાંચ આઉટ પીનાસ’ મોકલાશે.

તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયલા લેખો માટે ‘સુવાસ’માં ઉચ્ચિત સ્થાન છે. જોડખી સંખ્યામાં લેખકોએ ગુજરાત વિદ્યારીડાના ડેઝને અતુસરાં. અશુદ્ધ લેખો માટે અસ્વીકારનો લય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખાની એક અઠવાડિયાની અંદર પછેાંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય ને અમપૂર્વક આલેખાયલા હશે તો તે ઉચ્ચિત નોંધ સાચે તે જ સુદૃતમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખો ને લેખકા ટપ્પાન અર્થ મોકલા એક રહિણાની અંદર પાછા નહિ મંગાવી લે તો તે રૂ. ૨૫ કરવામાં આવશે.

તુરતમાં પ્રગટ થયેલ અન્યોને અમે ‘અન્ય પરિચય’માં સ્થાન આપીશું. તે સિવાયના અન્યોની ડેવળ નોંધ જ લેવાશે.

ભારતવર્ષની પ્રાચીન ગૌરવતા તથા મહારવતા જાણું હોય—

• અનુભવવી હોય તો

ડૉ. ન્રિલુલનદાસ લહેરચંદ શાહ

અલ. ઓમ. ઓન્ડ એસ. કૃત

ઇ. સ. પૂર્વે ૮૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીનો

૧૦૦૦ વર્ષનો

પ્રાચીન ભારતવર્ષ ખરીદો

તમે સ્વદેશમેમી છો ?

ત્યારે તો તમે ભારતવર્ષનો ધતિહાસ જાણતા જ હોવા જોડાએ
ન જાણતા હો તો

કિપલા મુસ્તક આટે આજે જ ઓર્ડર લેખો

અગ્રાહિકી આહક થનારને પાંચ લાગના આભા સેટના રૂ. ૨૨૦

તારપદી અને છુટક આખા સેટના રૂ. ૩૦)

હેઠી હવાએ માટે

ઉંમા આયુર્વેદિક ફાર્મસી

૪૪ વર્ષોથી સુપ્રસિદ્ધ છે

— સ્લીચોના —

મહેર, કોઈઓ, જાહેર, બંધત્વ,
અભિશયના રોગો તથા સુવારોજ માટે

સુંદરી સંજીવની

અમૃત તુલ્ય છે.

કિમત બા. ૧ નો ર. ૧) બા. ઉના ર. ૨॥

— નખળાઈ માટે —

ધાતુની, મગજની તથા શરીરની
નખળાઈ માટે

અમીરી જીવન

અક્ષીર છે.

કિ. તોલા ૧૦ નો ર. ૧). રતલાના ર. ૪)

ઉંમા ફાર્મસી —

વડોદરાના એજન્ટ : — અમીર પરિયુમરી વકર્સ, રાવપુર રોડ

એ ઇપિયાની કિંમતનું વિવિધ હુન્દોથી કારપુર

પુસ્તક મઝ્જીત બેટ મેળવો ?

“નાંકારક હુન્દોરો” ભાગ બીજામાં છાપવા માટે દેખો અને પ્રયોગો લખી મોકલો.
વેપાર, રોજગાર, કારીગરી અને સ્વાશ્યના પૈસા કમાવાની નજરે વ્યવહાર દેખો.
હુન્દુર, ઉદ્ઘોગ, વેપાર, વૈદક અને ધરગથ્યુ ઉપયોગની વસ્તુઓ અનાવવાની સાચી
માહિતીના પ્રમાણુસર પ્રયોગો.

ઇણાડો, કિમતી જાડો અને પાકાનાં વાવેતરા વિષે ઉપજ. ખર્ચના આંકડાઓ સાથે
અતુલવસિદ્ધ દેખો.

કિમતી, ઉપયોગી અને ગુણકારી વનસ્પતિઓનાં તેલ, અતર, અર્દ્ધ, સતત, સરકા,
સુકવણી, શરાષ્ટ્ર, મુરઘ્યા, ચટણી, અચાણું કિંઓર ઉપયોગી વસ્તુઓ અનાવવાની સાચી
માહિતીના પ્રમાણુસર વિગતવાર દેખો.

થાડી કિમતનાં નાનાં હાથયંત્રોથી ચાલતા ઉદ્ઘોગાની જાણવાનેગ સંપૂર્ણ માહિતી.

તમોએ લખી મોકલેલ એક પણ લેખ કે પ્રયોગ આ પુસ્તકમાં : છપારો તો તેની
નકલ તમે ધેર એંધારે મઝ્જીત લેય મળશો. વધુ નકલો જોઈતી હશે તો પોણી કિમતે
વેચાતી મળશો. રૂપાલ અચ્છે જુદુ.

તે ઉપરાંત તે લેખકને આ પુસ્તકમાં ટૂંકી જાહેર ખખર છપાવવી હશે તો મઝ્જીત છપાશો!

આ પુસ્તકમાં તમારી જાહેર ખખર મઝ્જીત છિપાવી વેપાર વધ્યારો.

વ્યવસ્થાપક : શ્રી લક્ષ્મી પુસ્તકમાળા, પોસ્ટ, સીતુગારા, (અંજાર-૪૨૭)

સુરાજ
દાનગુન 'સ્પ



સેનાભાસખેલ, સમશોર બહાદુર, સ્વ. શ્રીમંત ગાયકવાડ નરેશ
સયાજરાવ ત્રીજા



अह्नानतिमिरान्धानां ज्ञानांजनशलाकया ।
नेत्रमुन्मोलितं येन तस्मै श्रीगुरवे नमः ॥

પુસ્તક ૧ લું]

વિ. સં ૧૯૬૫ : શાલયુન

[અંક ૧૧

જીવન સત્ય

દૂર દૂર ક્ષિતિજ પર્યંત અનંત, અગાધ સાગર પથરાયેલો પડ્યો હતો.

જીચે નીલ આકાશમાં સૂર્યહેવ વિરાજતા.

કિનારા પ્રતિ અસ્થિલિત વલ્લાં કરતી શાન્ત, મનોરમ્ય તરંગમાલાના મન્દ ધુધરવ
સિવાય જ્વલનિધિના વિશાળ પટ પર અંદ શાંતિ બાપી હતી.

તટ સન્મુખ થોડેક દૂર સમુદ્રપટ પર ખાણી જીચે ચઢું દ્રષ્ટિગોચર થતું.....
ભીજુ જ જ્ઞાને જાચાઈના એ ભાર્ઘ શિખરેથી નીચે પડું, સડસડાટ આગે સરતું તે
જ્વલધિમાં વિલુપ્ત થતું.

એક જ ક્ષણ.....

ન જ્યાં પ્રથમ જ્વલતરંગ વિલય પામ્યો હતો તે જ સ્થળેથી તેની સ્પર્ધા કરતું ભીજું
મોણું જીચે ચઢું અને ભીજુ જ પણ નિજ પુરોગામીની પુનરાવૃત્તિ કરતું સમુદ્રમાં ગરકાવ થતું.

ત્યાં ત્રીજું મોણું જન્મતું.....ને નિજ પૂર્વજનની જીવનચર્ચાને અનુસરતું અનન્ત
જળમાં સમાઈ જતું.

અને જ્વલતરંગની પરંપરા આમ આગળને આગળ સંચરતી.

અન્તે વીચિમાલાનો છેલ્દો વિશ્રાટ તરંગ, દર્શયુઓથી ધેરાયલા, સમરાંગણુમાં ઝૂભતા,
ક્રા મહારથીની પેડે, નિઃશેષ ધસારા સાથે અંતિમ નીરલેખા પર ફીરી વળતો.

(૨)

સહસ્રકષિમ ભાસ્કરહેન, લક્ષ્મીહેનીની અવકૃપાએ નિરતેજ અનેલા કો ગર્ભશીભેતશા,
અરત પામતા સાંયેપ્રકાશમાં ઝડપથી ક્ષિતિજ પર હોણી રહ્યા હતા.

મહાસાગર પર લટકતો ક્ષિતિજ-વ્યોમપટ સોનેરી સાન્ધ્યલેને ઝળળણ રહ્યો હતો.

સમર્સત વાતાવરણું ડોઈક છુદુલ કનકવર્ણી દિપિએ લયું વિલસી રહ્યું હતું.

ઓકાએક સંઘાં પ્રગટી અને તેનાં કરુણી ચીરથી વર્ષાના મેદાકાશને છાયી દીધું.

સંઘાની એ મેનોદર રક્તિમાથી ઓપતુ જગ્યાલ્યમાન વ્યોમ—

પ્રસરતી કનકનોતિનો પ્રકાશ જીવી પ્રકૃત્યાલું, જીવન્ત નિરૂત્તિના પ્રતિકસમ
બાસતું વિશ—

અલંગ શાંતિમાં દિવ્ય, સુમધુર સંગીત શું મળજુ ગુજરાન જગતની અવિચલ ધારાએ
વહી એ સૌભ્ય તરંગમાલા—

—એ સર્વના ભિન્ન સોદર્ય-દર્શને, મારા હૃદયમાં સહસા જીવન તરત્વાનના પ્રતિ
દર્શનનો ઉત્કૃષ્ટ થયો.

એ સમયે સમુદ્રતટનાં નીર પર ધર્યાં આવતાં મોણે દૂર દૂર સુધી ફરી વળતાં હતાં.

(૩)

તાંડવલીલામાં ચક્કયૂર અનેલા કોઈ ઉન્મતા દૈત્યસમ પૂરવેણે ધર્યા આવતા પ્રયંડ
મોણન સામે રક્કર જીવા અરક્ષિત તઠતું અદ્યપશક્તિ, નિઃસહાય નીર તૈયાર ગોળાં હતું.

જીવનસમુદ્રને આરે નિરન્તર ચાલ્યા કરતા સત—અસતના શાશ્વત મુઢતું જાણે
આન્ધોહૂં પ્રતીક !

મહેદધિસ્વરૂપ મહાસત્ય પ્રત્યે આવિર્ભૂત સત્યસ્વરૂપ તઠજલના નિગૃહ હૃદયમાં
એક જ પરમ, અચલ શ્રદ્ધા રમી રહી છે—મહા સત્યતું વિરાટ વીર્ય પોતામાં અસત્ય
નોમ પ્રગટાનશે.

પણ એટલામાં પેલું મોણું ઝડપને ધસમસતું આવી એકદમ તટવારિ પર ફરી વળે છે.

એક વિપલ.....

ન.....

અહો ! આ શું ?

અત્યેત વેગપૂર્ણ ધસારા પછી હતાશ અનેલા રણધીર પેઠે પેદો ક્ષણવિજયી દૈત્યતરંગ
પાણી હઠે છે, અને સહસા હર્ષના ડિલિક્લાટ સહ, અંતિમ વિજયમાં વિરાજતું પુલકિત
તીરોદાક, સરોવરમાંથી પ્રગટના પદ્મમસું અક્ષત પ્રગટ થાય છે.

સત્ય પર ફળી વળેલાં અસતનાં પૂરને ચિર પરાજ્યની ઓટ વળે છે અને નીચેથી
પરમ પ્રસાદમાં હસતું સત્ય શાશ્વત વિનેતાઇપે પ્રગટ થાય છે.

સરસ્વતીને

વિવિદસુ

[પૃથ્વી]

પધાર ઊરમંહિરે અમલ પુષ્યભાવે ભર્યો
પરાગ લઈ નંદને સુહત પારિજાતો તણો;
અને શિકર લાવ તું વિશાદ ઓચોમગંગા તણું
કરાવ ઊર શાન્ત જે ભવરણે તર્યું બાપડું.

સુદીંદ્ર ગુજને હૃદયની વીણાને ભરે
ચહું મધુર ભાવના સ્વર વિશુદ્ધ ત્યાંથી સરે;
કરે વહન મંગલા ઋતભરેલ વાણી તણું
મધૂર સમ તાહરા સુજ કવિતનું મોરણું.

સમુજ્જવલ પ્રકાશ એહ સુરતાતણા લાવ તું
સુદીંદ્ર મતિમોક્ષ રંક શિશુનો ત્વરાથી કરે;
ચહું અજખ કદ્વપના લહર સ્વર્ગની વિસ્તરે.

ભરે સકલ વિશ્વને તુજ પ્રલાવને આશ્રે
મનોહર સુરમ્ય કો સુખદ પુષ્ય લાવો વડે
હરે ગલીર આર્તિ જે મનુજનાં ઊરે પ્રજ્વલે.



મનનું માનવી

મોહન

મહેરામણુ ડહેણતાં છીપતું રે લાધ્યું
છીપલામાં મોતી અમૂલ:
મોતીડે હૈયું મોણું !

સરવરિયે રહેલતાં પોયણું રે લાધ્યું,
પોયણામાં સૌરભ અમૂલ:
સૌરભે હૈયું સોણું !

જીવન—તલ હૂંદતાં માનવી રે લાધ્યું,
માનવીમાં હૈયું અમૂલ:
હૈયામાં હૈયું એયું !



સાહિત્યમાં વાસ્તવવાદ

રમણુલાલ વસેનલાલ હેસાઈ

૨

આમ જેતાં સામાન્ય વાતચીત, શાચિય ગ્રંથો, ધતિહાસ, વિજ્ઞાન એ સર્વ સાહિત્ય કહી શકાય નહોં, કારણું તેમને કાર્યપ્રદેશ અને સાહિત્યને કાર્યપ્રદેશ બુદ્ધે છે. સાદિત્ય સરખી જ વિશુદ્ધ, સાહિત્ય સરખું જ એ એ લભાણું કે વાતચીતમાં હોય તો પણ એ લભાણો મર્યાદા સ્વીકારી જ લે છે અને સાહિત્યના પ્રદેશમાંથી ચોતાને અભગ રાણે છે.

* * *

ત્યારે સાહિત્ય એ શું છે ?

સાહિત્યની ધરણી જાતની અને ધરણી રીતની વ્યાખ્યાઓ થઈ છે. સાહિત્યનાં વર્ણનો પણ ધરણાં થયાં છે. એ સર્વ સમયાતુભાર અંદરાયે જાય છે. એકાદ તરત્ત ગળાતું જાય, નવું તરત્ત ઉમેરાતું જાય, અગર જુનું તરત્ત નવાં સરદૈએ હાખું થાય. આમ સાહિત્યની વ્યાખ્યાઓ ધરાય છે અને વર્ણનો લભાય છે. પૂરી અણીશુદ્ધ સર્વસ્વીકાર્ય વ્યાખ્યા કે કે વર્ણન હજુદૂધી રચાયાં નથી. છતાં ધરણાં તત્ત્વો મળતાં આવે છે, અને સહજ મતલેદ હોવા છતાં સાહિત્ય શું એ સંખ્યામાં સામાન્ય માન્યતાઓ સમનાંદર જાય એવી જ હોય છે.

આપણે નહાનાલાલની કવિતાને સાહિત્ય કહીએ છીએ. ‘સરસ્વતીચંદ્ર’ કે ‘ગુજરાતનો નાથ’ને સાહિત્ય કહીએ છીએ. ‘વડલો’ કે ‘આગગાડી’ જેવાં નાટકોને સાહિત્યમાં ગણ્યીએ છીએ. ‘મુકુદરાય’ કે ‘ઘેમી’ જેવી દ્વાંઝી વાર્તાઓને સાહિત્ય કહીએ છીએ. ગાંધીજી કે કાલેક્ટરના તેજસ્વી લેખાને સાહિત્ય કહીએ છીએ.

શા માટે ? - કયાં તત્ત્વને અનુલક્ષીને આપણે ઉપલાં દઈએને સાહિત્યમાં ગણ્યાવીએ છીએ ?

* * *

સાહિત્ય વાણીનો તો આશ્રય લે છેજ. વાણી વગર સાહિત્ય રચાય જ નહોં. એ વાણી લિખિત હોય કે અલિખિત પણ હોય. પરંતુ સર્વ પ્રકારની વાણી-ભાષા-શબ્દરચના જ્યારે સાહિત્ય નથી ત્યારે સાહિત્ય માટેની વાણી વિશિષ્ટ પ્રકારની તો હોયી જ જોઈએ.

એ વિશિષ્ટતા શામાં રહેલી છે ? નહાનાલાલનો ‘તાજમહેલ’, ખળવતરાય ડાકોરની ‘રેવા’, મેધાણીનો ‘ડાઢનો લાડકનાયો’ અગર ત્રિભુવન વ્યાસની ‘કાશ્મીરા’ વાંચતાં આપણું આખી શબ્દરચના શુદ્ધ, સુંદર, મોહક, અસરકારક અને લાંબા સમય સુધી સાંભરી રહે એવી, વારેવાર સંભારવી અને હૃદ્યચારવી ગમે એવી લાગે છે.

ધતિહાસમાં એવી ભાષા ન હોય તો ચાલે. વિજ્ઞાનમાં એવી ભાષા ન હોય તો ચાલે. માત્ર સામાન્ય ભાષાણુદ્ધ જ એવાં લભાણો માટે આવશ્યક છે; જે કે ખીં ચુણો હોય તો ધતિહાસ અને વિજ્ઞાન વધારે વાંચવા લાયક બને એ ખરું, પરંતુ ઉપર કહેલા સર્વ ભાષાણુણો ન હોય તો ધતિહાસ ભરતે. નથી, વિજ્ઞાન અવિજ્ઞાન જીનું નથી. ધરણી વખત ઉપર કહેલા ચુણો ધતિહાસ કે વિજ્ઞાનને કર્તવ્યમણ્ય પણ અનાવી હે.

પરંતુ સાહિત્યને તો માત્ર શુદ્ધ ચાલે નહોં. શુદ્ધ આવશ્યક છે, પરંતુ સાથેસાથે શબ્દરચનામાં સૌન્દર્ય, મોહકપણું, અસર ઉપજવે એવું સામર્થ્ય, મનમાં રહે એવું



લાલિત્ય, અને ભાગ્ય પડ્યો પારી રણકારને વિસ્તુત અનાવે એવો શખ્ષિક તેમાં હોવાં જોઈએ. તે સિવાયની ભાપાવાળાં લખાણું આપણે સાહિત્ય કહેતા નથી.

આમ સાહિત્ય એ પ્રથમ પગથીએ જ શખ્ષિકલા અની જય છે—વાણીકલા અની જય છે.

* * *

અને કલા બનતા બરોઅર તે વાસ્તવતાથી સહજ દૂર ખરી જય છે, નહીં ? વાસ્તવતાનો અર્થ સધળી વાણી એમ કરવામાં આવે તો જરૂર સાહિત્ય વાસ્તવતાથી દૂર છે. કલા પસંદગી માગે છે, ગુંથણી માગે છે, ગોઠવણી માગે છે, તારવણી માગે છે, ચાળવણી માગે છે.

‘તાજમહેલ’ના કાવ્યમાં સાલ, સંવત કે તેના શિલ્પીનું નામ નથી. ‘કાશ્મીરા નાચી રહી’ એ કાશ્મીર પ્રદેશના વર્ણનમાં ત્યાંનો રાજ ડોષ છે, અને કાશ્મીરની વરતી ડેટલી છે એ હક્કીકત આપી નથી. ‘કાઠના લાહુકવાયા’ને થયેલા જખમમાં ડેટલા શેર લોહી વધ્યું અગર જખમ ડેટલો લાંબો પહોળો હતો તેનાં વજન માપ આપેલાં નથી. વાસ્તવિકતા કદાચ આ અધી વિગતો માગે. પરંતુ સાહિત્ય આવી વિગતો આપી વાસ્તવિકતાને પોષે એમ આપણે કદી કહેતા નથી.

‘તાજમહેલ’ વાંચી તાજમહેલનું ચિત્ર ખંડું થાય એ તો જરૂર સાહિત્ય માગે. તાજમહેલનું સૌનદર્ય અને સુપ્રમાણ પ્રત્યક્ષ થાય એ પણ સાહિત્ય માગે. પરંતુ તાજમહેલના બુઝુટની રથું ઊચામના ગજ—તસુ લરવા કરતાં જુદી જ ટેચે સાહિત્ય તેની ઊચાઈ માપે છે:

‘પ્રેમની ભરમ ધારીને દિગંતે માંડી આંખી,

પ્રેમની જોગણું ડો આ જુઓ હાલાની વારી.’

તાજમહેલની ધરલતા ભરમથી ઓળખાઈ; દિગંતમાં મળેલી આંખી ઊચાઈ પરખાઈ; અને હાલાની વાર જોતી જોગણું શાહજહાનની આપી ભાગ્ય પ્રેમકથાની પ્રાણી સમજાઈ.

વાસ્તવિકતા એમાં નથી, છતાં શખ્ષ અને શખ્ષથી રચાતા એ ભાવચિત્રમાં પાર્થિવ વાસ્તવિકતા કરતાં પણ વધારે સત્ય એવી ઐતિહાસિક અને મોગલ સંસ્કૃતિની રસમય અતરંગ વાસ્તવિકતા જોપસી રહી છે.

અહીં સાહિત્યે ધાણું છેારી દીધું. નથી સાલ, નથી માપ, નથી પદ્ધરની જત, નથી ધડનાર શિલ્પીનાં નામ કે નથી એણે બનાવેલા નકશા. સાહિત્યે કલા બની એવી શખ્ષદરચના કરી કે જેમાંથી એ વાસ્તવિક તત્ત્વો ગાળી કઢાડ્યાં. તેણે જુદાજ શખ્ષદો વાપર્યા અને તાજમહેલની જુદી જ ટેચે ગોઠવણું કરી.

છતાં આપણું તેની શખ્ષદરચના ગમે છે, અને શખ્ષદરચનાએ જલું કરેલું ચિત્ર પણ આપણું ગમે છે.

કારણ ?

સાહિત્ય વાસ્તવિકતાને ઉવેચે છે મારે ?

ના. કલાની વાસ્તવિકતા અને સામાન્ય વાસ્તવિકતામાં ફેર હોય છે મારે.

વાણીએ વાસ્તવિક ભાપામાંથી પસંદગી કરી, ચાળવણી કરી અને ગોતાને સુયોગ જણાયાં તત્ત્વોની ગોઠવણી કરી.

એટે સાહિત્ય એ ભાષા વિશ્િષ્ટ છે. ભાષાનાં સૌનદર્ય અને સામર્થ્ય ઉપર અત્યારે લેતી એ વાણીકલા છે. સાહિત્યનું આમ પ્રથમ અંગ ભાષાસૌનદર્ય, ભાષાસૌનદર્ય અને ભાષાસામર્થ્ય. એ અંગોનો જ્યાં અભાવ ત્યાં સાહિત્યનો અભાવ. સૌનદર્યવિહોણી, સૌનદર્યવિહોણી, સામર્થ્યવિહોણી ભાષાને આપણે કદી સાહિત્ય કરી શકીશું નહીં.

બિટિશ પ્રજાસંઘમાં હિંદુનું સ્થાન

લેખક : શ્રી પ્રાણુશંકર જોડી
“રંગદ્વધનો ફર્ગ”ના કર્તા

૧

બિટિશ સાભાજ્યનો જીવન

બિટિશ સાભાજ્યનું ક્ષેત્રકળ એક કરોડ ઓગણુચાળાસ લાખ નવહનર સાતસેચણ્ણસી ચોરસ માઈલ છે. પૃથ્વી પરના દરેક ખંડમાં તે પથરાયું છે. પૃથ્વીની કુલ વસ્તીનો ચોંચો લાગ બિટિશ સાભાજ્યમાં વસે છે. તેનાં ક્ષેત્રકળ અને વસ્તીના આંકડા આ પ્રમાણે છે:

અંક	ક્ષેત્રકળ	વસ્તી
	ચોરસ માઈલમાં	
યુરોપ	૧,૨૧,૫૧૨	૫,૦૦,૦૦૦૦૦
અશ્રિયા	૧૮,૨૪,૫૫૦	૩૬,૫૦,૦૦૦૦૦
આફ્રિકા	૪૬,૫૨,૦૦૦	૬,૦૦,૦૦૦૦૦
ઉત્તર અમેરિકા	૩૮,૬૩,૦૨૦	૧,૨૦,૦૦૦૦૦
મધ્ય અમેરિકા	૮,૬૦૦	૫૦,૦૦૦
વેસ્ટ ઇન્ડીઝ	૧૨,૩૦૦	૨૦,૦૦૦૦૦
દક્ષિણ અમેરિકા	૬૭,૮૦૦	૩,૨૦૦૦૦
આશનીયા	૩૩,૦૦,૦૦૦	૧,૦૫,૦૦૦૦૦
	૧,૩૬,૦૮૭૮૨	૫૦,૦૮,૭૦,૦૦૦

બિટિશ સાભાજ્યની ૫૦ કરોડની વસ્તીમાં ૭ કરોડ ગોરાયો, ૩૬ કરોડ હિંદુયો, ૪ કરોડ કાળા લોકો, ૬૦ લાખ અરયો, ૬૦ લાખ મલાયો, ૧૦ લાખ ચીનાયો અને ૧૦ લાખ પેલોનેસીયોનો, ૨૩ ચન્દ્રિયનો વગેરે છે.

આ વસ્તીમાં ૨૧ કરોડ હિંદુયો, ૧૦ કરોડ મુસ્લીમો, ૮ કરોડ બિરતીયો, સત્તા કરોડ ઔછ્છો, ૪૦ લાખ શીખ-નૈન અને પારસીયો, સાડા સાત લાખ યહુદીયો અને બાકીના નંગદી ધર્મી પાળનારા છે.

લૌગાલિક દસ્તિયે બિટિશ તાજ હેઠળ ખંડવાર નીચે પ્રમાણે દેશો છે:

યુરોપ-ગ્રેટબિટન, આર્થિક, ગ્રાન્ટર, માદ્રા, સાઈપ્રિસ, ચેનલ ટાપુયો.

અશ્રિયા-હિન્દ, લંકા, અલદેશ, એડન, મલાયા, બિટિશ નોર્થ એન્નિયો, સારાવાક, હોંગકાંગ, પેલેસ્ટાઇન.

આફ્રિકા-દ. આફ્રિકા, ખિ. પૂર્વ આફ્રિકા, ખિ. પશ્ચિમ આફ્રિકા, ખિ. સોમાલીલેન્ડ, મિસર, સુદ્ધાન, મેરિશિયસ, સિશિસ્સ, નાઈજીરિયા.

બિટિશ પ્રણસંઘમાં હિંદુનું સ્થાન .. ૫૧૬

ઓસ્ટ્રેલેશિયા-ઓસ્ટ્રેલિયા, ન્યૂડીલિંડ, ફીજુ, પાપુઆ અને પેસિફિક મહાસાગરના સંખ્યાબંધ ટાપુઓ.

અમેરિકા-કેનેડા, ન્યૂઝાઇન્ડલેન્ડ, ચિ. વેસ્ટ ઈ-રીજ, ચિ. લાન્ડ્રાસ, બિટિશ ગીયાના, ફિલ્પિન્સ ટાપુઓ, બહામાઝ, ટ્રીનીડાડ, બરમ્યુડા.

રાજ્યારી દિલ્લી, બિટિશ સાભાજ્ય પાંચ વિભાગમાં વહેંચી શકાય.

૧. ક્રેટથિટન અને સ્વરાજ ભોગવતો સંસ્થાનો.

૨. હિંદ જ્યોતિ દરજને ભોગવતા દેશો.

૩. ડાલોનીઓ.

૪. પ્રોટેક્ટરેટો.

૫. રાધ્રસંધન મેન્ડેટ હેઠળના દેશો.

સંસ્કૃતિની દિલ્લી, બિટિશ સાભાજ્યના એ ભાગ પાડી શકાય.

૧. ક્રેટ થિટન, છ સંસ્થાનો, સાઈપ્રેસ, વેસ્ટ ઈ-રીજ વગેરે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળા દેશો.

૨. હિંદ, લંડા, મલાયા, હેંગકાંગ, મેન્ડેટ હેઠળના પ્રદેશો જેવા કે પેલેસ્ટાઈન, ટાંગાનીકા, સેમોઆ વગેરે; પેસિફિક અને હિંદી મહાસાગરના ટાપુઓ, અને બીજ બીન-ગોરી સંસ્કૃતિવાળા અને કેવળ સાભાજ્યની સલામતી માટે રાજ્યારી હેતુસર બિટિશ ધ્વજ હેડળ રખ્યાયેલા દેશો.

આજના વિશાળ બિટિશ સાભાજ્ય પર સૂર્યોરત થતો નથી. જ્યારે સાભાજ્યના એક અર્ધ ભાગ પર રાનિ હોય છે ત્યારે બીજ અર્ધ ભાગ પર સૂર્યો પ્રકાશતો હોય છે. અતુભૂતિનું પણ એવું જ બધારણ થયું છે. સાભાજ્યનો એક ભાગ જ્યારે ઉનાળો માખુતો હોય છે ત્યારે બીજો ભાગ શિયાળાની ડંડી અનુભવતો હોય છે.

જગતનો ડાઢ પણ અંડા, કે મહાસાગર બિટિશ સાભાજ્યની એધીવતી સત્તા વગરનો નથી. સાભાજ્યમાં ડેટલીક સર્વોચ્ચ પર્વતો, સર્વોત્તમ સરેવરો અને સર્વશ્રેષ્ઠ સરિતાઓ છે. વિશ્વની પ્રત્યેક પ્રકારની આભોહવા, પ્રત્યેક પ્રકારની ધરતી, પ્રત્યેક પ્રકારનું ખનીજ બિટિશ સાભાજ્યમાં છે.

આજનું બિટિશ સાભાજ્ય વિવિધ ભાષા, સંસ્કૃતિ, ધર્મ, ડ્રામ, વર્ણ અને આદૃતિવાળું સહખરંગી માળજું છે. સાભાજ્યનો સુદૃઢ પાયો બિટિશ ટાપુઓ છે, જ્યારે ધ્રીમારત વિવિધગુણી છે. રાજ્યારી દિલ્લી, આ બિટિશ કણામહેલ સૌદર્ય અને કદ્દુપતા, આરોગ્ય અને માંહંગી, સ્વાધીનતા અને પરાધીનતા, સમાનતા અને અસમાનતાના પાષાણ્યાથી ચણાયો છે. આ કળામહેલની ડેટલીક ઈંટો બિટિશ પરમાર્થનું ગીત લખકારે છે ને ડેટલીક ઈંટો મિશ્રૂર સ્વાર્થનું દર્શન કરાવે છે.

બિટિશ સાભાજ્યનું શાસન પણ વિવિધરંગી છે. ડેટલીક પ્રજાઓ બિટિશ તાજ હેઠળ સ્વરાજ માણ્ય છે, તો ડેટલીક ગુદાગીમાં સંખ્યા છે; ડેટલીક સ્વરાજને પણે કૂચ કરી રહી છે, ડેટલીક પ્રજાઓ કરેશો. રાજ્યારી વિકાસ સાધ્યો નથી, ડેટલીક પ્રજાને રાજ્યારી અસ્તિ છ્ટાં આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવતો નથી. આખી બિટિશ પૃથ્વી-વ્યાપી

૫૨૦ .. સુવાસ : કાણગુન ૧૯૬૫

મલતનતનો પ્રાણુ ચ્રેટથિટન છે. મહાન સામ્રાજ્ય ત્યાં જ રહે છે. આપું સામ્રાજ્ય લક્ષ્યરી રક્ષણ માટે એજ ચ્રેટથિટન તરફ મીટ માಡે છે.

ચિઠિશ સામ્રાજ્ય લોકોને આવશ્યક દરેક વર્સ્તુ પૂરી પાડે છે. એવો ડાઈ મનુષ્ય-ઝોરાક નથી કે કે ત્યાં ઉગાડવામાં ન આવતો હોય ! એવો ડાઈ ઉદ્ઘોગ નથી કે કે ત્યાં વિદ્વમાન ન હોય. વિદ્વા, કંપા, હુનરનો અખૂટ ખળનો ચિઠિશ સામ્રાજ્યમાં નજરે પડે છે અને તેનો પૃથ્વીને ખૂબું ખૂબું પ્રભરેલો વેપાર તેનું ઉદાહરણ છે.

ચિઠિશ લોકોનો મોરો સમુદ્ર સામ્રાજ્યને “સાર્વજનિક ન્યાય અને દ્વારાન્તર્ય પરમાંથનાં અંધેડ વહેતાં ભરણાં” ઇવું વર્ણિતે છે ન્યારે ડેટલાક તેને વિવિધ તત્ત્વોવાણું માળખું દેખે છે. તે “ડાઈ સ્થળ ઉગમગતું છે, તો બીજે સ્થળ દમનકારક છે, ધર્મ આગે આદ્યે વગરનું છે તો શેડા માટે દ્વારાકારક છે.”

ચિઠિશ સામ્રાજ્ય ૪૦૦ વર્ષ પહેલાં જન્મયું તે પહેલાં જગતે વિવિધ સામ્રાજ્યો નોયેલાં. એમાલોન, ધરાન, ઓસ અને રોમનાં સત્ત્વાન્યોએ વિશ્વને સામ્રાજ્યવાદના પાડો અણુવેલા. આને જેમ હીં અને બીજા દેશો ચિઠિશ સામ્રાજ્યવાદના સાખુસામાં જકડાયા છે, તેમ ખુદ ચિઠન પણ ૨૦૦૦ વર્ષ પહેલાં રોમન સામ્રાજ્યવાદના અંપરમાં જડાયેલું. તેણેથી પરહેશી શાસન હેઠળ પરાધીનતાની એડીઓ ખખડાવેલી.

એ સમયનો ચિઠિશ ઈતિહાસ પ્રેરણાત્મક કે ગારવસર્યો નથી. એ તો પશુત્વ અને મનુષ્યત્વ વર્ણની સંરકૃતિનો છે. એ સમયે હિંદુ સંરકૃતિની સર્વોચ્ચ કળાએ ખડું હતું. તેના પ્રતાપનો સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશનો હનો. ૧૯૦૧માં હિંદુ દરભાર પ્રસંગે હિંદુના વાયસરેય લોડ કર્યે આ સત્ય ઉગ્ચારવાની હિંમત દાખલી હતી. તેણે કહ્યું: “ન્યારે અંગ્રેજે જંગલમાં રખડતા અને પોતાનાં શરીરો રંગતા, ન્યારે ચિઠિશ કોનોનોએ કેવળ અરણ્ય કે જંગલ હતાં, ત્યારે હિંદુમાં શક્તિશાળી સામ્રાજ્યો દસ્તી ધરાવતાં હતાં અને ખીલ્યાં હતાં. હિં પૃથ્વીના પટ પરના ડાઈ પણ દેશ કરતાં જનસમાજના ઈતિહાસ, તત્ત્વજ્ઞાન અને ધર્મ પર વધારે જીડી છાપ પાડી છે.”

રોમન સામ્રાજ્ય યુદ્ધામ રાન્યોનું બનેલું, આમ છતાં ચિઠન પર તેણે ખાસ ઉપકાર કરેલો. તેણે ચિઠનમાં સંસ્કૃતિ આણી, લોકોને માણસ અનાબ્યા; રાજતંત્ર સિધર કર્યું; જેતાને ધર્મી સમૃદ્ધ કરી; ખાલુકામ, કાંતણ, વાણાટ, રંગ, કુલારકામ વગેરે ઉદ્ઘોગો ખીલબ્યા. રોમન ખુદીએ ચિઠનને સુંદર રસ્તાંગો આપ્યા, વેપાર આપ્યો, સુધારા આપ્યો, ધર્મ આપ્યો.

સાડાચારસો વર્ષના સુંદર શાસન આહ, રોમન લોકોએ સહાને માટે ચિઠન છાડ્યું. એમ કહેવાય છે કે આ સમયે ચિઠનના લોકા રહેલા. તેઓ દળું સ્વ-રક્ષણ માટે શક્તિમાન થયા ન હતા. ચિઠને દળું પરહેશી અમલની વિરોધ પૂંસરી અમલાની આકી હતી.

અંગ્રેજે મૂળ ઉત્તર જર્મની અને ડેન્માર્કના વતની ચેન્ગલસ, સેક્સન્સ, જ્યુટસ અને એવી ખીજી ટ્યુટોનિક જતોના વંશને છે. તેઓએ રોમન-પલાયનનો લાલ લીધી અને ચોથી અને પાંચમી સહીમાં ચિઠનનો ધર્મો ખરો લાગ પડાવી લઈ પોતાનું શાસન જમાવ્યું. લગભગ ૧૧મી સહી સુધી ચિઠન જે હવે ધૂગઢાં અન્યું હતું, તે એક યા ખીજી પ્રગતના રાગએ હેઠળ પરાધીન રહ્યું.

ખિટિશ પ્રજાસંધમાં હિંદુ સ્થાન ..૫૨૧

ઇ. ૧૦૬૬માં નોર્મનયુગ શરૂ થયો. વિનેતા વિલિયમના રાજશાસન હેડળ ઈંગ્લાડ ઐક્યના શ્રી ગણેશ માંડ્યા. પરહેઠી નોર્મનોએ સાયા સરકાર સ્થાપી જેટલું જ નહિ, પણ એક સદીમાં તેઓ પોતે અંગ્રેજ બન્યા અને એકન્ન રાજ્યનો પાતો નાખ્યો. બારમી સદીમાં રાજ્યનોના ત્રાસને અંગે, પ્રજા સ્વરાજના પાડો ભણ્યા લાગી અને જુદાં જુદાં ક્ષેત્રોમાં રાજ્યકારી પ્રગતિ થઈ. ઇ. સ. ૧૨૧૫માં મેગનાકાર્ટાએ રાજ્યનો હંકો સ્વીકાર્ય અને શાહી પાર્લિમેન્ટની સ્થાપના થઈ.

આ અરસામાં યુરોપના નાવિકોમાં નવીન દેશોને શોધવાની તમજા જાગી હતી. આ તમજાનું પહેલું કારણ પોતાના દેશની આર્થિક સ્થિતિ હતી, તેથી નાવિકોને રાજ્ય તરફથી ઉત્તેજન અપાનું; વસવાટ અને કારખારના લડો અપાતા.

નવીન દેશોની શોધ કરવાનો જરૂર પોર્ટુગીઝ, સ્પેનિશ અને ઇટાલિયન પ્રજાનોને જાય છે. શ્રેષ્ઠ ખિટન, ફાંસ અને હોલાંડ આવાં સાહસમાં બીજી પેંકિયે છે, જ્યારે જર્મની તો કેવળ છેલ્લું જાગે છે.

નવીન દેશોની શોધ એ દિશાએ વહેંચાયેલી હતી. પૂર્વમાં યુરોપને સમૃદ્ધિની છોગમાં નહુવડાવતાર હિંદ પહેલુંચયાનો પ્રયાસ હતો, અને પણિમે આરથકારિક મહાસાગર દોઢાવવાનો હતો.

ઇ. સ. પૂર્વે ઉરુજમાં મીસના સભ્રાટ સિકંદરે હિંદની ભૂમિ પર પગ મૂકેલો. ત્યારથી અશિયાનો ભૂમાર્ગ યુરોપવાસીઓને જાહીનો થયો. હતો, પણ આખા અશિયાનો પ્રવાસ કરનાર ડ્રાઇ યુરોપીય એટા હજુ સુધી નીકળ્યો ન હતો. એનો યશ તો વેનિસના એ ભાઈ-ઓને તેરમી સદીમાં મળ્યો. નિકાલો અને મેદિયા પોલો નામના વેનિસના વતની એ ભાઈઓએ નિકાલોના પુત્ર અને મેદિયાના લત્રીઝ માર્કો પોલો સાથે ઇ. સ. ૧૨૭૧ થી ઇ. સ. ૧૨૮૫ સુધીની પા સહી દરમિયાન આખા અશિયાનો પ્રવાસ કરેલો. માર્કો પોલોએ એ સમયના અશિયાની સામાજિક, વેપારી અને રાજ્યકારી પરિસ્થિતિનું હુઅહુ વર્ણન પોતાના પ્રવાસયંથમાં કર્યું છે. આ અન્ય પોણાયસ્સો વર્ષ સુધી અપ્રેગટ રહ્યો. ઇ. સ. ૧૪૭૭માં આ અંથ પ્રગટ થયો. ત્યારે પ્રથમ વેનિસ સગશ્ય અને પણી આખા યુરોપ સમક્ષ ભારતનો વૈલખ પ્રસિદ્ધમાં આવ્યો. વેનિસ અને જુનોઓના હિંદ સાથેના વેપારનો અને ઇટાલિયન આર્થિક પ્રગતિનો અરેખરો પ્રાથમિક યશ આ અંથને જ ધરે છે. આ રીતે ઇટાલિયને પહેલાં પરહેઠા-પગરણ માંડ્યાં, પણ નવીન દેશો કંપે કરવાનું અને સાખ્રાન્યો સ્થાપવાનું પણ બીજી દેશોના કપાળો જ લખાયું હતું.

વેનિસ અને જુનોઓની હિંદ સાથેના વેપારને અંગે થયેલી સમૃદ્ધ ચોર્ટુગાલને ખૂચ્યો. તેણે સમૃદ્ધ ચોર્ટુગાલના સ્વર્પનાં સેવાં અને હિંદ પહેલુંચયા માટે જળમાર્ગ દૂંબવા માંડ્યો. સમૃદ્ધો દોડાળવાની આ ભાવનાએ જગતનો નવો ઇતિહાસ સરળયો. છે, જગતની પ્રગતિ કે અધ્યાગતિ આણું છે, જગત પર યુરોપની આણુ ફરકાવી છે, અને જગતના દૂર દૂર પડેલા ખંડો અને દેશોને જનસમાજના સંસર્ગમાં મૂક્યા છે.

આ બધી સફરોનું લક્ષ્યાંખિનું ભારત હતું. આ બધા પ્રયાસનો પ્રધાન આશય પોતા પોતાના દેશોને ભારતની સમૃદ્ધિના મહાસાગરનાં પુણ્ય-જળથી નહુવડાવવાનો હતો. આ ભારતને નામે અનેક પુણ્યો અને અનેક પાપો જગતભરમાં યુરોપના દેશોને હાથે થયાં છે.

પરં .. સુવાસ : હાંગુન ૧૯૬૫

આ મધ્ય-યુગનો ઈતિહાસ યુરેએપને માટે આર્થિક વેહનાનો, ધાર્મિક ધૈલણા અને યુદ્ધનો, અને સાથે સાથે સાંભળ્યવાના પુનર્જન્મનો હનો. ઈજિવાઉ સો વર્ષનાં યુદ્ધમાં ફાંસનો પરાન્ય કરવા મથન કર્યું હતું, પણ તેને નિષ્ફળતા વરી હતી. ઉમરાવેની સત્તા પડી આંગી હતી અને ટયુરરને દમનખર્યો અમલ શરૂ થયો હતો.

પોર્ટુગલમાં ધાર્મિક જુરસો ઊળણી રહ્યો હતો. કિશ્ચિયાનિટિ તેનો મુદ્રામંત્ર અને આરાધ્ય-વસ્તુ હતી. પોર્ટુગલના રાજ પ્રિન્સ હેનરીએ પોતે હિંદુના પ્રવાસનું પગરણ માંડ્યું. ઈ. સ. ૧૪૭૦-૭૫માં પોર્ટુગીઝ વદ્ધાણુવટી ગેમેજે આર્થિક કોસ્ટ શોધી આફિક્ટાતો. પશ્ચિમ કિનારો દ્વારાના માંડ્યો. ઈ. સ. ૧૪૮૧માં ગીનીનો અભાત, ઈ. સ. ૧૪૮૨-૮૪માં ડાન્યો. નહીનું સુખ, ઈ. સ. ૧૪૮૮માં કેપ ચ્રેસાદ ગુડ હોપ અને ઈ. સ. ૧૪૯૭માં હિંદુનો આયો જળમાર્ગ શોધાયો. પોર્ટુગીઝો ઈ. સ. ૧૫૧૬માં ચીન અને ઈ. સ. ૧૫૪૨માં જપાન સુધી પણ પહોંચ્યા હતા.

હિંદુનો જળમાર્ગ શોધવા માટે પ્રથમ હામ ભીડનાર અને તેની સર્વીગતા માટે પારો નાખનાર પ્રિન્સ હેનરી ધ નેવિગેટરની ભાવના વેપાર કરતાં ધર્મયુદ્ધની વધારે હતી. એ સથ આ પ્રસંગે આપણે રણું કરીએ તો અરથને ન ગણ્યાય. તે જગતને કિશ્ચિયાનિટિનું કૃત શરખત પીવડાવવા માટે પણ કટિઅષ્ટ હતો.

મિ. નેટ્સ એ. નિલિયમસન પોતાના અંથ-A Short History of British Expansion-માં આ સત્ય પ્રત્યે લક્ષ્ય ખેંચતાં કહે છે: “પ્રિન્સ હેનરીનો જુરસો એક વેપારીનો. નહિ, પણ ધર્મગોક્ષાનો હતો. તેનું “હિંદ” એટલે એક કિશ્ચિયન દેશ. તે નાસ્તિકાતો ઉચ્છેદ કરવા મદ્દહે ધાર્ય જ. પ્રિન્સ હેનરીએ આ આશય એક યુદ્ધિશાળી ફૂરતા અને અડગતા વડે આગળ ધર્પાવેલો. જ્યારે દુખિયા હાસ્યસીએઓ પોર્ટુગાલને કિનારે જિતરતા અને ભારે આફંદ વચ્ચે શુલામેના લીલામ વડે તેમનાં કુંદુંએઓ છિન્બલિન કરવામાં આવતાં ત્યારે તેનું હુદ્દ્ય અડથ સંતોષભાવે પોકારી જાડતું, “દાઢ, તેઓના આત્મા રક્ષાયા છે. મારા વગર તેઓ રખડી પડ્યા જ હોત!”

વાર્સકો ડી ગામા હિંદ પહોંચ્યો. ત્યારેય હિંદ “કિશ્ચિયન” દેશ એ એ અમણ્ય ચાલુ રહેલી. કાલીકટરમાં એક જણે તેને પૂજ્યું “શું નોઈએ?” વાર્સકો ડી ગામાએ જવાબ વાલ્યો: “કિશ્ચિયનો અને તેજના.” તેઓએ હિંદ મંદિરનાં અને હિંદુ દેવોનાં કિશ્ચિયન ધારીને દર્શન કર્યા. તેઓ જણું માસ હિંદ રહ્યા ત્યાંસુધી એ રસિક ભૂલ ચાલુ રહી. તેઓને કિશ્ચિયાનિટ તો વાસ્તવિક રીતે નહોતી મળી, પણ તેમના મળ્યા હતા.

જ્યારે હિંદુનો જળમાર્ગ દૂઢવાનો યશ પોર્ટુગીઝ નાવિકાને છે, ત્યારે આટલાટિક મહાસાગર એંગેંગી અમેરિકા દૂંઢી કાઢવાનો પ્રથમ યશ ધર્યાલિયન નાવિકાને છે. કાલમ્યસ જુનોઆમાં જન્મેલો, પણ તે વખતનું ઈટલિ એક દેશ તરીકે નવીન હેશા શોધવાનાં સાહસને ઉતેજાતું ન હતું. તેને રાજ્યે રાજ્યે લટકતું પડ્યું. છેવટે સ્પેને તેને આશરા આપ્યો અને ઈ. સ. ૧૪૯૨માં તે અમેરિકા પહોંચ્યો.

સામાન્ય માન્યતા એવી છે કે અમેરિકાની ધરતી પર પહેલો પગ મૂકનાર જોરો પુરસ્ખ કાલમ્યસ છે, પણ ઐતિહાસિક પૂરાવો એથી વિરુદ્ધ છે. અમેરિકસ વેરયુશિયસ નામના ધર્યાલિયન નાવિકે કાલમ્યસની પહેલાં આ ખડ નેયો હતો અને એ સત્ય ૧૫૦૭માં તેના

ધ્રિટિશ પ્રભાસંધમાં હિંદુનું સ્થાન .. ધરતે

પ્રવાસ-વર્ણનમાં પ્રસિદ્ધ થતાં એ ખંડનું નામ તેના પોતાના નામને અનુલક્ષીને અમેરિકા અપાયું છે.

ક્રાલમ્બસે તો આ ખંડને હિંદુસ્તાન જ ધારેલું તેણે એ ખંડની મૂળ પ્રજાને નામ પણ 'ઈન્ડિયન્સ' આપ્યું. એ ભૂલ પાછળથી સમજાઈ, રૂપેનના લોકો નિરાશ થયા, પણ 'ઈન્ડિયન' શબ્દ તો ત્યાંની મૂળ વસ્તી માટે હજુ સુધી રહી ગયો છે.

આમ છતાં પદરમી અને સોળમી સહી રૂપેનની પ્રગતિ માટે યાદગાર રહી જરો. ક્રાલમ્બસે રૂપેનને નાના મોટા ટાપુએ શોધી આપવાની પહેલ કરી. એ સાથે જ રૂપેનની નાવિકો પણ આટલાંટિક અને ચેસિસ્ક્રિક મહાસાગરમાં ઘૂમી વલ્યા અને આખા અમેરિકા ખંડ પર રૂપેનનો વાવટો ફ્રેકવા લાગ્યો.

ઇંગ્લાંડ, નિઃરંક, રૂપેનની પુછળ જ ચાલ્યું. તેણે જ્ઞાનામાં જન્મેદા ખીજ નાવિક જેન ક્રેબટને આશરો આપ્યો. ક્રેબટને પણ ક્રાલમ્બસની જેમ ખર ન હતી કે પશ્ચિમે અમેરિકા ખંડ વચ્ચે પડેલો છે. તેને પશ્ચિમનો સમુદ્ર એલાંગી એશિયા પહોંચવાની હામ હતી. ધ. સ. ૧૪૮૫-૮૬માં તેણે રાજ હેનરી સાતમા પાસેથી પૂર્વ ઉત્તર કે પશ્ચિમ ગઢે તે સમુદ્રો ઘૂમવાની અને નવા દેશો કરુંને કરવાની સત્તા લીધી. ધ. સ. ૧૪૮૭માં ક્રેબટ ૧૮ ખલાસીએ સાથે જિપડ્યો. તેણે ન્યુ ઇઓન્ડલેન્ડ અને કેનેડા શોધ્યા. આમ હિંદના જળમાર્ગની શોધ અને કેનેડાની શોધ એક જ વર્ષે થઈ. ક્રેબટ અહીં ઇંગ્લાંડ અને વેનિસના ધરજ ફ્રેકવાયા. તેણે પણ ક્રાલમ્બસના જેવી જ ભૂલ કરી. તેણે આ પ્રદેશ એશિયાનો જ કોઈ ભાગ છે એમ માન્યું.

૧૮ ડિસેમ્બર ૧૪૮૭ ના રોજ ક્રેબટના એક મિલાનવાસી સાથીએ પોતાના રાજને કષ્ટયું: "આપ નામદાર ધણી પ્રવૃત્તિમાં હશો, છતાં આપ મહારાજાએ તલવારના એકથી ધા વગર એવે એશિયાનો એક ભાગ સર કર્યો છે એ જણી આપ નારાજ નહિ થાએ." ધ. સ. ૧૪૮૮ માં ક્રેબટ ખીજ સફર કરી ત્યારે તેને માલમ પડ્યું કે એ કંઈ એશિયા ખંડ નથી. એ તો કેવળ કોઈ અન્યાંએ નિર્જન પ્રદેશ છે.

સોળમી સહીએ ઇંગ્લાંડના રાજ્યોમાં વિકાસનો નવુંગ શરી કર્યો હતો. પદરમી સહી સમાસ ન થઈ લાં તો ધ્રિટિવાહે પૂર્વ અને પશ્ચિમના નવા દેશો શોધવા માંડ્યા હતા. ગૌરુંગબે રિંકી, સિંકી ને સમુદ્ધિથી છલપથતું ભારત નિષ્ઠાલયું હતું. ત્યારે તેનાજ પાડોશી રૂપેન પનામાની સંયોગીભૂમિ વટાની દક્ષિણ અમેરિકાનું સોના ઇપાથી છલપથતું 'સાઓન્ય' હસ્તગત કર્યું હતું.

આ નવુંગ નૈતિક દાખિયે કલેક્ટિને છે, ઐતિહાસિક દાખિયે કાળો છે, પણ એક સાઓન્યવાહની દાખિયે નોંધવાનેં છે. ઇંગ્લાંડનો આ યુગ રૂપેન અને પોર્ટુગાલ પ્રત્યેના દ્વિતોને, તેઓએ સાહસથી મેળવેલું પડાવી દેવાનો હતો. આ યુગે સાઓન્યવાહને જન્મ આપ્યો. તેણે ધ્રિટિને હાથે અનેક ચોરી, લૂટફાટ, દ્રોઝિટ્ટો કરાયાં. તેણે દોલતને દૂંદતા દેખદેશો વચ્ચે કાપાકાંપી કરાવી. તેણે વેપારને નામે ચુલામીને ઉસેજી. તેણે વેપારને નામે દેશાવરમાં રાજ્યદારી અને આથીક ધુસકાનીતિ આદરી. તેણે એજ બહાને કેટલીક મૂળ વસ્તીનું કૂર નિકંદળ કાઢી નાખ્યું.

સોળમી સહીએ સર ક્રાન્સિસ ઇંગ્લાંડની પૃથ્વીની પ્રદક્ષિણા કરી નામના મેળવી. પણ સાથે આંદે દક્ષિણ અમેરિકામાં રૂપેનનું સોનું ઇંગ્લાંડ શ્રીથી લૂંડી દેખનીતિનું પ્રદર્શન કર્યું.

પ્રેરણ .. સુવાસ : ફેબ્રુઆરી ૧૯૯૪

ત્યારાં વર્જિનિયામાં થાણું ગોડવાયું અને હિદમાં ધરસ્ટ ઈન્ડીઆ કંપનીદ્વારા ડેક્ઝિઓ સ્થાપવામાં આવી. રેપેન અને પોર્ટુગલને પોપની મંજુરીથી મળેલા ધરનરા સામે લડનારી સોણમાં સદી પૂરી થઈ અને સત્તરમી સદીએ હોવાંડ સાથે દુરોપના વેપાર માટે યુદ્ધ ખેલાયાં અને ખિટિશ સામ્રાન્યવાદનો વધુ નિકાસ થયો. ન્યૂ ઇન્ડિયન્ડ, અરમુડા, ન્યૂ ઈંગ્લાંડ, અહામાડ, જમૈકા, મેરીલેન્ડ, મુંબઈ, મદ્રાસ, વગેરે ખિટિશ સામ્રાન્યવાદના છત હેડળ આવ્યાં.

આ સદીમાં ફાસે માથું ઊચકયું હતું. તેણે સેનિગાલ, સેનિગેલીયા, એક્ટીયા (નોવાસ્કાશિયા), પેંડીચેરી, વેસ્ટ ઈન્ડીઝના ઘોડા ટાપુઓ, લુધસીયાના વગેરે કંપને કરી હરીએ સામ્રાન્ય સનયું હતું.

આ સદી ખિટના આંતરિક વહીવટ અને પ્રગઠીય જુસ્સા માટે ઈંગ્લાંડના ધરિલાસમાં પ્રસિદ્ધ છે. હિદમાં રાજયોનો પ્રથમ હજુ આજેય અણઉકેવ રહ્યો છે, ત્યારે ઈંગ્લાંડ ખિટિશ સામાન્યની સત્તાઓનો નિકાલ લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે કરી દીખેલો. રાજ અને પ્રજન વચ્ચે, રાજયોના નિરંકૃત રાસનના “દિંબ દસ્ય” અને પ્રજનના સ્વાતંત્ર્યના જન્મસિદ્ધ હક્ક વચ્ચે અથડામણો જામી હતી.

આ યુગ સ્ટુઅર્ટ રાજયોનો હતો. ઈંગ્લાંડ અને સ્કોટલાંડના પહેલા રાજના વખતમાં રાજને પાર્લિમેન્ટથી સ્વતંત્ર અને કાયદારી પર જાનાવના પ્રવૃત્તિ શરી થતાં રાજ્યોય આજાહી આદ્ધતમાં આવી. ધ. સ. ૧૬૦૪ માં પાર્લિમેન્ટ રાજસાસનની જવાઅધારીમાં લાગ દેવાનો હક્ક જાહેર કર્યો. રાજ જેમ્સ પહેલાના મગજમાં શાહી સર્વોપરિતાનું ભૂસું લરાયું હતું. તેનું શાસન આપણું હતું. તેને પ્રજનના ટેકાની ડિમતનો ખ્યાલ સરખેયે ન હતો. પણ અંગ્રેજ પ્રજન આજાહી માટે કટિયક થયેલી હતી. ધ. સ. ૧૬૨૧ માં પાર્લિમેન્ટ રાજના પ્રધાનો પર અંકૃત રાખવાનો હક્ક ઈરીથી જાહેર કર્યો. જેમ્સ પહેલો પ્રજનમતને સાન્ત્વન આપવામાં નિર્ણય તીવૃત્તો. આ પરિસ્થિતિમાં તેના પુત્ર પહેલા ચાલ્સ સામેના અળવા માટે તેનું પોતાનું રાજસાશન ભૂમિકા રૂપ અન્યું હતું.

ધ. સ. ૧૬૨૫ માં પહેલો ચાલ્સ ગાહીએ એડો અને તેણે પ્રગઠીય શાસનનો સામનો કરવા માંયો, ત્યારે દિવાને આમે, પાર્લિમેન્ટનું અધારથું ટકાવી રાખવાનો અડગ નિર્ણય દાખલ્યો. અંગ્રેજ પ્રજનને પાર્લિમેન્ટના સ્વાતંત્ર્યનું રણ્યથીયું હુંકયું; રાજનો ને આપણું તંત્રનો પ્રયોગ ક્ષેત્રમાં સામનો કર્યો. છેટે ધ. સ. ૧૬૪૮માં રાજ રાન્ય કરે કે પાર્લિમેન્ટ રાન્ય કરે એનો નિકાલ લાવનાર આંતર-વિશ્વ ફ્રાન્સ નીકળ્યો. પાર્લિમેન્ટાદીઓનો લશ્કરી વિજય થયો અને ધ. સ. ૧૬૪૮ માં પહેલા ચાલ્સને ફાંસી અપાંગ. લોકશાસનનો આ વિજય ખિટિશ ધરિલાસમાં યાગાર પ્રયત્ન અની ગયો છે. ચાલ્સનું માયું ઈંગ્લાંડના ભાવિ રાજયો માટે એક ચ્યામડાવનારા દાધ્યાંત રૂપ અની ગયું છે.

અદારમી સદીએ ખિટિશ સામ્રાન્યનો વેગ વધતોએ જેયો અને અસુક સ્થળે કપાતોએ જેયો. ઈંગ્લાંડ પોતાની ભૂમિ પર લોકશાસનવાદ માટે યુદ્ધ ખેલ્યું, સ્વાતંત્ર્યની વેહી પર ચાલ્સનું માયું હોમ્યું, પણ અમેરિકન ડાલોનીએને રાજકારબારમાં પ્રતિનિધિત્વ આપવાની ના પાડી. અમેરિકન ડાલોનીએનો અળવો જગાંયો અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. આ ફ્રાન્સ એ ઈંગ્લાંડના કાન ચ્યામડાવા અને અમેરિકાનું યુનાઇટેડ સ્ટેટ્સ બોર્ડ માટે વર્ષો સુધી પરસ્તાવો કર્યો. આ પછ્યાટ સિવાય ઈંગ્લાંડની સામ્રાન્યવાહી હૂચ ચાલુ રહી હતી અને કુદરતી

ખ્રિટિશ પ્રજાસંઘમાં હિન્દુનું સ્થાન .. ૫૨૫

સહાય અને આંતર-રાષ્ટ્રીય ભંગળગોએ એ કૂચને વેગવંતી કરી હતી. ફેલો સામે યુદ્ધ ખેલી હિંદ અને ડેનેડા જીતવામાં આવ્યાં હતાં. રૂપેન પાસેથી જ્યાદાટર અને ત્ય પાસેથી ડેન્ડ ડાલોની ઝૂંટની લેવામાં આવ્યાં હતાં. એઓટ્રેલિયા અને ન્યૂઝીલાંડ પણ આજ સહીમાં શોધાયાં હતાં. ખ્રિસ્ટને ટ્રિનિડાડ તથા બીજન વેસ્ટ ઇન્ડીયન ટાપુએ અમેરીકામાં અને સ્ટેટ્સ સેટ્ટબેન્ટ્સ એશિયામાં પણ આ સહીમાંજ જીતેલાં.

એગણ્ણીસમી સહીએ ખ્રિટિશ સામ્રાજ્યની સત્તા અને મહત્ત્વ જગતભરમાં જમાવી દીધાં. તેનો વિરતાર પ્રગતાએ પ્રગતમાં અને અંડેઅંડમાં થયો. અર્ધ આફિકા અંડ અને આખા એસ્ટ્રેલેશિયા અંડ પર પણ ખ્રિટિશ વાવરો ફરકવા લાગ્યો. ત્રણ સહીમાં ખ્રિસ્ટન ન્હાનકડા કંગાલ કૃષિ-પ્રધાન દેશમાંથી હિન્દુગન્ત આણુ ફેરવનાર, અનેક દેશો પર શાસન કરનાર, જગતનું અભૂતપૂર્વ, સમર્થ અને સમૃદ્ધ મહાસામ્રાજ્ય અની ગયું.

—————○—————

ન જાને !

મોહન ઠક્કર

[વંશેતતિવક્તા]

જ્યારે અનંત ફ્લકે અણુફીઠ પીછી
આદેખી રે' સુલગ મોહક રંગ રેખા,
જ્યારે ધરી ક્ષણુ ક્ષણે નવતા અપ્રીછી
સંદ્યા લસે, અધુકું હસી બીજ લેખા,
જ્યારે રહે મધમધી શુચિ સોણુલાં શાં
સોહામણું પરમ પ્રેમળ પારિજાત,
જ્યારે અગે તરલ-તારક-તેજ-ભાત
મુંઘા ઉરે સળકતી પ્રિય સંસ્મૃતિશા !
જ્યારે કિલોલી મધુ સારસં જોડલું યે
નીડ પળે, શિશુ ટળે નિજ માત ખોળે,
જ્યારે સમસ્ત જગ જીલતું મોદ છોળે,
સૌન્દર્ય દિવ્ય અમતાં અણુએ અણુએ,
ત્યારે થ રે કમનસીબ હું એક શાને
જૂંકું, વિધાદ ઉરમાં શીદ આ ? નંબને !



આપણું રાસસાહિત્ય [પ્રાચીન]

લેખક : શ્રો. ચતુરભાઈ શાંકરભાઈ પેટેલ
અમ. એસ. એસ. બી.

[3]

ગુજરાતમાં ગરભીની હાડ વગાડનાર રસરાજની દ્વારામનું દર્શન કરતા પહેલાં આપણે ડેટલાક છૂટક-નુટક ડવિએ નેર્ધ જર્ધ એ. રામભક્ત ભાવખુનાં રામભાલચરિત અને કૃષ્ણલીલાનાં પરો ગરભીએમાં ગણી શકાય એવાં છે, જે કે એ પરો એક સંગ કૃતિના અંગ ઇથે હોઈ છૂટક પરો નેટવાં પ્રયોગિત નથી થયાં. પંડિત ભાવખુનું ધોય છૂટક પરો રસવાનું હતું જ નહિ. એને તો કાદમ્ભરી અને નળાખ્યાન કેવાં લાંબાં કાળ્યો સર્જવાં હતાં. તેમ છતાં એને નામે ચાલાં “સાંલળ રે તું સજની મારી, રજની કયાં રમી આવીજ રે?” એ રસિક પદ એની રાસસિદ્ધની પ્રતીતિ કરાવે છે.

કવિશરેભાષિ પ્રેમાનન્દનો આદર્શ રસભર્યો આખ્યાનો દારા ગુર્જરીને સમૃદ્ધ કરવાનો હતો, એટલે એણે પણ ભાવખુની માફક નહાનાં પરો પર પોતાની લેખિની ચવાવી નથી. બાકી સર્વીગસુનન્દર આખ્યાનો લભ્ય પ્રાસાદ સર્જનાર એની ઉત્તત પ્રતિકાને સાદા પદ્દોનો એક લઘુ અંડ રચ્યો એ રમતવાત હતી. દશમરંધરનું મનોહર રાસવર્ણન રાસનું અત્યુત્તમ ઉદ્ઘાટણ હોઈ એ વાતની સાક્ષી પૂરણે. સોહામણી શરહમાં ‘સ્વરૂપ સ્વામ, ડાટિ કામ’ શ્રદ્ધાળું ‘વામદક્ષિણ સુનન્દરી ગોપી સાથ’ રસિક રાસ એવી રહ્યા છે, ‘ઝમક તાલ, ખીજાળ રસાળ ગીત’ ગાઈ રહ્યો છે એને ‘ચીર ખસે હસ્તે તાળી દેધ દેધ’ એવી રસમસ્તીમાં રાસ અંચ ચંગી રહ્યો છે. એનું ચિત્ર મહાકવિ પ્રેમાનન્દ ડેવું જરૂર અંત અને તદ્દૂર આલેખે છે !

“ આનન્દ કન્દ, નન્દ-નન્દ, છન્દ રાગ રાગણી,

વેણુ વાય, ગીત ગાય, સરલ સહુ સોહામણીઃ

૩૫ સરસ, સોળ વરસ, રમે અંક લેઈ લેઈ,

ગોપાળલાલ, શરદકાળ રમે રાસ થેઈ થેઈ.

શોરઠી ડા, ગોરઠી ડા, સ્વામણી સોહામણીઃ

ડા સાહિતી, મનમોહિતી, કટાક્ષ કીકી કામનીઃ

રાસરમણ, બ્રમણ નમણ, લીલા કહુ ડેઈ ડેઈ,

ગોપાળલાલ, શરદ કાળ, રમે રાસ થેઈ થેઈ.”

પ્રેમાનન્દની બ્રમરપચીસી અને દ્વારુલોકા પણ ગરણીના ઉત્તમ નમુના તરીકે ગણી શકાય એમ છે. એ જેતાં કડેવું નેર્ધ એ કે પોતાનો ચિષ્ય નહિ હનાં એ સિદ્ધહસ્ત સાહિત્યકારે ગૌણું રીતેય ગૌરવભરી ગરભીએ ગુજરાતને ચરણે ધરી છે.

રાધાકૃષ્ણના પૂજારી રત્નશરના રાધાકૃષ્ણના મહિના એના મધુર મધુલ બા રો લીધે હીક પ્રચલિત છે. એનો દેશી ગરભીની ચાલ સાથે માલિનીવૃત્તનો યોગ કવિની સિક્કા અને વિદ્વત્તાની જાંખી કરાવે છે. એડાનો ભાવસાર રત્નો એના ગોપીવિરહના મહિના માટે ખૂબ જાણ્યું હૈ, અને વિરહદુઃખનું એનું આદેખન વાસ્તવદર્શી અને હૃત્યસ્પર્શી છે. મહિનાના આપણા સાહિત્યમાં એના મહિના અનુપમ અને અનેડ છે.

મુખ અને પ્રહૃદાદનાં આખ્યાનથી પરિચિત વસાવડના નાગર કાલિદાસે શક્તિની રતુતિનાં ડેટલાંક પદ લખ્યાં છે, તેમજ પીજના કવિ નરલેરામે એડાણાની મૂળનાં આશરે ૧૦૦ પદો લખ્યાં છે. પરતુ પદ માટે ખરો પ્રતિષ્ઠિત ને ડાચ પણ હોય તો તે છે સંદેશરનો ખારોટ પ્રીતમહાસ. “હરિનો મારગ છે શરાનો, નહિ કાયરનું કામ જોને.” એ ગાંધીજીના પ્રિયતમ પહના પ્રણેતા પ્રીતમે અનેક રસિક, મધુર અને ચિરંજિન પદો ગુજરાતને આપ્યાં છે. લાવમાર્દવ, પદ્ધતાલિત્ય અને સંગીતમાધુર્યથી અંકિત એની ગરભીઓ સુણી મન મુંખ ખને છે. “મનમોહનલાલ, મુારગડો મૂકો તો મથુરા જઈએ.” એ ગોપીઓની હાલસોયી વિનવળી અથવા “હે જસોદાજુ, આવડો લાડકવાયો લાલ ન કીજો.” એ એમની મોડી ફરિયાદ સાંભળી હિલ ઢાલી ઉડે છે. પ્રજ્વનિતાનાં વેરણ વાંસળાને સંમેયેલાં વચ્ચેનો ઝેવાં હૃત્યવેધક છે !

“હે વાંસલડી, વેરણ થઈ લાગી રે પ્રજની નારેને.

તે આવડાં કામણ શાં કીધાં,

શામળીએ મુખ ચુંઘન લીધાં,

મન વજવાસીનાં હરી લીધાં.—હે વાંસલડી૦”

પ્રીતમના જ્વોજ પરમ રસિક પાટીદાર કવિ રધુનાથદાસ આપણું ધ્યાન ખેંચે છે. વિરહેલી ગોપીઓએ ઉદ્ધવજુ જેડે શ્રીકૃષ્ણને પાડવેલા ભાવભીના સંદેશાનો એ સર્જન્ક છે. “ઓધવજ સંદેશો કહેને જ્યામને” એ મધુર પંક્તિ સૌને પરિચિત છે. અને ‘તમે અજાણ્યા અમે જાણ્યીએ રે’થી શરૂ થતી એની રસિક દાણલીલા એટલી જ જાણીતી છે.

તદુપરાંત ગિરધરનાં તુલસીવિવાહ, કૃષ્ણલીલાનાં પદો તેમજ પ્રેમાનન્દ સ્વામી, અધ્યાત્મનન્દ, નિષ્કુલાનન્દ, દેવાનન્દ આદિ સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓનાં કૃષ્ણભક્તિનાં પદો પ્રખ્યાત છે. એમને વાગતે જેવાનો મોહ છોડી, રસરાજવી દ્વારામનાં જિછળતાં પ્રેમભક્તિનાં પૂરનાં કંદક દર્શન કરીએ. પૂરમાં તણુાઈ જવાની બીડ ફૂર રહી કરેલાં દર્શન આછાં—અધૂરાં જાણ્યાય તો ઉદારચિત વાચક ક્ષમા આપશે એવી વિનંતી છે.

દ્યારામ

ગ્રાચીન રાસસાહિત્યમાં દ્યારામે રસડાંડો વગાડ્યો છે. સમસ્ત સાહિત્યને ધડીલર ભૂલાની હે એની રસડાંડી વર્ણાવી છે. દ્યારામ એટલે સાક્ષાત રસનો અવતાર. દ્યારામ એટલે પ્રેમભક્તિનું મૂર્તિમંત રૂપરૂપ. રસિક ફક્કડ દ્યારામે રસ અને પ્રેમનાં પૂર વહાબ્યાં છે. સાહિત્યના અખ્યાત કુવારા ઉડાયા છે. સંગીતની નીરી હેલી રેલાયી છે. એની જન્મલરી કલમે કામણ કર્યો છે. એની હૃદયંગમ વાણીએ વશીકરણ કર્યો છે. એની મસ્તીલરી રસિકાએ ભાન ભૂલાબ્યાં છે. એનાં રસકલાન્ધિત કાવ્યો પાછળ ગુજરાત ગાંડું થયું છે. એની ગુણગૌરવયુક્ત ગરભીએ।

૫૨૮ .. સુવાસ : ઝાણગુન ૧૬૬૫

પાછળ ગુજરાતણે વેવી અની છે. ગરભીવિધાવક દ્વારામ એકલો રસરાજી નથી, પણ ગરભી ગુજરાતનો હૃદયરાજી છે.

રસધનમાંથી ડામય રીતે કારી કાઢ્યાં હોય એવાં એનાં અદ્ભુત કાળોએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કારધનરમાં અધૂર્ણ દિસ્સો આપ્યો છે. એની ગરભીઓએ રસરેખાકાને અવનવા લાગ આપ્યા છે. એનાં ગીતોની ખૂબી અને સંગીતમાધુરી આજે યે નિત્યનૂતન લાગે છે અને શોર્સરી નથી, એથી એમની ગુણવત્તાનાં સાચાં મૂલ્ય અંકાય છે. એ રસિયે શરહની શેરીઓને જેવી સોલામણી કરી છે તેવી ભાગે જ બીજા કોઈએ કરી હશે.

એક એકથી ચટ્ઠિયાતાં એનાં કાબ્યરતોમાંથી અમુકની પસંદગી કરવાનું કાર્ય કેટલું વિકિટ છે તે સમજ શકાય એમ છે. મારે જ મેં આગળ આ દર્શનને આધું-અધૂરું કર્યું છે. તો હવે આપણું એનાં શ્રાંક રાસરનોનાં અધૂરાં છતાં મધુરાં દર્શન કરીએ.

પ્રેમાંશી દ્વારામની પ્રેમની પર્યાપ્તશા વેપક અને તત્ત્વપર્શી છે. એની અનોખી રનેહ-ભીમાંસાની જેડ સારા સાહિત્યમાંથી જરૂર એમ નથી. પ્રેમવક્ષણા ભક્તિના અતન્ય ઉપાસક દ્વારામનું પ્રેમભક્તિનું આદેખન સર્વાગંસંપૂર્ણ અને ડાંડાણથર્યું હોય એ સ્વાભાવિક છે. પુષ્ટિમાર્ગ કંવિ પ્રેમને પ્રભુનો પરમ પ્રસાદ માને છે, અને એવી પ્રભુપુષ્ટ વ્યક્તિગોજ એમની સાચી અધિકારી નીવડે છે. તથી તે લખે છે:-

“ ને કાઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ડરે.

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તહપિ અર્થ ના સરે;

મત્તયભોગી અગલે મુક્તાદળ દેખી ચંચુ ના ભરે.”

અને કવિને એ પ્રેમવક્ષણા ભક્તિ એક જ પ્રભુને પામવાનું સરલ અને સીધું સાધન દેખાય છે. એટલે એ કહે છે:--

“ એમ કોઈ સાધને પ્રેમ વિના, પુરષોત્તમ પૂંડ ન ઈરે;

દ્વારીતમ શ્રીગોવર્ધનધર પ્રેમભક્તિયે વરે.”

પ્રણયભીમાંસાનું અનુપમ આદેખન કરતું કવિનું ‘પ્રેમ પરીક્ષા’ કાબ્ય એકલા ગુજરાતી સાહિત્યમાં નહિ પણ કદાચ જગતમાસાહિત્યમાં ‘એકેમ અદ્વિતીયમ’ ગણાશે. Shelley ની પ્રેમની હિલસુરી (Love's philosophy) ઉપર આદ્રીન પોકારનારે ધરાયાંગણ્ણાનું આ પ્રેમપરીક્ષા કાબ્ય વાંચ્યું-વિચારયું ધરે છે. આપણા ભક્તકવિને ભક્તિ તરફ રૂપ્ય પ્રકાપાત છે, એટલે સુધી કે જાન અને યોગને તે તદ્દન ઉતારી પાડે છે. પ્રભુપ્રાતિસિંહાં ભક્તિને સુધીએ એ સાધનો અને છેકજ નિર્ણય ને નમાલાં લાગે છે. પ્રેમપરીક્ષામાં જાની ઉદ્ઘવ અને પ્રેમી ગોપીઓના સંવાદ દ્વારા તેમજ ધતર પણ એક સ્થાને એણે આ વસ્તુ વ્યક્તિં કરી છે. જાનજડ ઉદ્ઘવને પ્રેમની રસાદિલસુદી સમજાવનાં રસાદેવી ગોપીઓ કહે છે:-

“ એખવણ છે અગળી રે, વાત એક પ્રેમતણી;

કોઈ અનુભવી જાણે રે, કહેતાં તો નારે બાળી.

પ્રસ્તુતાની પીડા રે, વંતા તે શું જાણે?

નાથયું કેમ આવે રે, માણ્યાને પરમાણે?”

અનુભવસિદ્ધ અને અનિર્દ્યનીય પ્રણયની અચ્યુત ને અભ્યથ સ્થિતિ વર્ણયતાં કહે છે:-

“ નેથ સુખથી ન વાયે રે, દેખો હુંખ નવ ધટે;

નેમ વૃક્ષને વળગી રે, વેલી તો ઇરી ના લટે.”

અને સાચી પ્રીતિ ગ્રાણુંને પણ પરી થતી નથી કહી પ્રેમની અંધિત્તા ને અનન્તતા વર્ણવે છે:—

“ સાચી પ્રીત તે ગ્રાણું લે રે, સાધારણું થાય પરી;
દાદુર જળવિષુ લુંબે રે, માછલડાં તો નય મરી,
છીપ રહે સાગરમાં રે, દૃચ્છા સ્વાતિભિન્દુ તણી;
જુઓ દષ્ટિ ચકોરની રે, અચળ રહે છે ધન્દુ ભણી.”

પ્રેમની આ મોડી મીમાંસા પછી એની જ્ઞાન-યોગ સાથે તુલના કરતો ગોપીઓ ઉદ્ઘાને કહે છે:—

“ છે અગમ પંથ સ્નેહનો રે, ઓધવળ તેં નથી દીઠો,
ત્યાં લગી જ્ઞાન જોડે રે, જોગ છે પણ મોડો.
તમારો તો હરિ સધને રે, અમારો તો એક સથળે;
તમો રીજો ચાંદરણે રે, અમો રીજું ચંદ મળે.”

અતે ગોપીઓનાં ‘એવાં વચન સુણીને રે, ઓધવળની ભાતિ ટળી’ ‘જેગ જંજળ ફૂટી’ અને પ્રેમના આધિક્યની પ્રતીતિ થઈ. પરિણામે પ્રલુપ્યની એ દીપિકાઓને શુરૂ માની ‘અભિમાન મૂક્ખને રે, ઓધવ ગોપી પાય પડ્યા.’

અન્યન્ય પણ જ્ઞાન ઉપર લક્ષિતની સરસાધ વર્ણવતાં કવિ લખે છે:—

“ શું જણે વ્યાકરણી, વસ્તુને શું જણે વ્યાકરણી ?

શુખ પર્યત લર્દી ધૂત તદ્વાપિ સ્વાદ ન જણે બરણી.—વસ્તુને૦ ”

અને તેથીજ લક્ષ્ટકવિ આગહપૂર્વક દૃઢ્યે છે કે:—

“ પ્રકટ મળે સુખ થાય, શ્રી ગિરિધર પ્રકટ મળે સુખ થાય.

તૈલ વિના રૂક્ષટ તિલ પ્રેરેથી, દીપક ક્યામ પ્રકટાય ?

પ્રકટ પાવક વિના કાણને બેટે, શ્રી પેર શીત સમાય ?—શ્રી ગિરિધર૦ ”

પ્રેમની ફિલસુરીના આટલા વિવરણું પછી આપણે પ્રેમપંખિણી ગોપીઓની મોડી મધુરી પ્રેમપીડાનું કંઈક દર્શન કરીએ.

ગબર ગોપીને પ્રીતની રીતનું ભાન નથી, પણ કામણુગારા કૃષ્ણને જોઈ એના હક્ક્યમાં સ્વયંભુ પ્રેમ ઉદ્ભાવે છે. આંતર: કોડપિ હેતુ: એને કૃષ્ણ પ્રતિ આકર્ષે છે. ‘પ્રેમને અરણો સાથે સંબંધ કાંઈ એ નથી.’ એટલે એનું આંતર નિષ્કારણ સ્નેહથી કૃષ્ણમય બની નય છે, અને આમ અનુભાવે એને પ્રીતની અતિ અટપદી રીત સમજાય છે:

“ પ્રીતડીની રીત અતિ અટપદી, ઓધવળ છે પ્રીતડીની રીત૦ ,

થાવાનો ઉપાય પણ જાવાનો જડે નહિ, વજ રહેણે જટી તે જટી,

પ્રીત ના કહેવાય તે, તે સ્વારથ સમજવો, ચાર દિવસ પ્રગતી ને મરી.”

જણે-અજણે એકવાર પ્રેમતું ખાણું પીણું અને એનો નશો રગેરગ વ્યાપ્યો પછી ઝાં જાં ! રાત દિવસ એનીજ પીડા ! ડાડતાં બેસતાં એની જ વાત ! ડાખતાં જગતાં એનુંજ ચિંતન ! અને પ્રેમની એ ગુલ્લ વાત ડાઢ ને કહેવાય પણ શી રીતે ? એટલે જાના જાના સંબેજ દ્રુટકો ! ગોપી પોતાની એવી દુઃસહ દુઃખભરી સ્થિતિ વર્ણવતાં કહે છે:—

“ પ્રેમની પીડા તે ડાને કહીયે રે, હો મધુકર, પ્રેમની પીડા તો

થતાં ન જણી પ્રીત જાતાં પ્રાણુ જાયે, હાથનાં ઝાંખાં તે વાજ્યાં હુદ્દે;

ધીકોયે ટાંકયાં રાત દિવસ અંતરમાં, શુખ નિદ્રામાં નવ લહિયે.”

૫૩૦ .. સુવાસ : ક્રાણગુન ૧૬૬૫

અને એવિજ અસલા સ્થિતિ ભીજુ એક ગરખીમાં કહિ ડેવી સરસ આપેયે છે !

“કાળજ કોચું તે ડોને કહિયે રે, એધવ છેલાખીલડે.

કળ ન પડે કાંઈ પેર ન સુઝે, રાનિ દિવસ ધેલાં રહિયે રે,

કાંઈ વરસુમાં કશું ચિત ન ચોટે, અલઘેલો આવી એડો હદ્ધે રે.”

ગ્રેમધેલી અને કૃષ્ણવિરહે આકુળવ્યાકુળ થએલી જોપીને ૨૮ પણ ચેન પડતું નથી. ધરીમાં ધરમાં નય છે, ને પાછી બારણું આવી કૃષ્ણની રાહ જુવે છે ! પોતાની વિવશ-પરવશ સ્થિતિને લક્ષમાં લેઈ વધુ નહિ તથસાવવા એ કૃષ્ણને અત્યંત આર્જવભરી વિનવણી કરે છે:-

“ ઉલા રહો તો કહું વાતડી, બિહારીલાલ.

તમ માટે ગાળી છે મેં જાતડી, બિહારીલાલ.

વેદના વિરહની તે ક્યાં લાખિયે, બિહારીલાલ.

ભીતરનો લડકો તે ક્યાં દાખિયે, બિહારીલાલ.

ધેલી ઠરી છું સહુ ગામમાં, બિહારીલાલ.

ચિત ચોટાં નથી ધરકામમાં, બિહારીલાલ.”

કૃષ્ણ પાછળ ધેલી થએલી આવી પુત્રવધુને સાસુ જેવી વજનદાર બ્રહ્મિત ક્યાં ચુંધી સાંખી શકે ! એટલે પોતાને ત્યાં વધુ વખત એવું નહિ નહે, અને ‘તમે તો નિર્બજ રે, હુમે લાજ મરીયે’ કહી એને ડપકાભરી શિખામણું આપે છે:-

“ શીખ સાસુજ દે છે રે, વહુજ રહો દેગે;

આવડો શો આસંગો રે, શામળિયા સંગે ?”

પણ માથાની વહુ ‘ગંગાજળ સરખાં વિશુદ્ધ !’ સાસુજને રોકડું પરખાવે છે ! પ્રભુ-અભિતમાં દૂષણું જોતાં સાસુજની આંખમાં કમળા થયો હશે કહી પ્રભુપ્રેમી એ પત્ની પોતાના વિશુદ્ધ ગ્રેમમાં અડગ રહે છે, અને ‘દ્યાનો પ્રભુ લજનો રે, ડાઈથી ન ડરવું’ એ નિશ્ચયપૂર્વક સાસુને પડકારે છે:-

“ એવાં વચન સુણુને રે, વદાં વળતાં વહુજ;

ગંગાજળ સરખાં રે, હો સાંભળો સાસુજ.

કહો છા તેવાં હોશો રે, ત્યારે એમ સુઝે છે;

દોષ પ્રભુમાં શો દીડો રે, જેને જગ પૂજે છે.”

ગ્રેમીપીડા અને વિરહુબ્યથના આ અદ્ય વિવેચન પછી એ પીડા અને વથના કારણુંપ્રક કામણુગારા શ્રીકૃષ્ણનાં આપણે સહેજ દર્શન કરીએ. પરમ લાગવત દ્યારામ પોતાના ધિધ્રભલુનું વર્ણન કરતાં કદી ધરાતાજ નથી. એટલે શ્રીકૃષ્ણના વર્ણનનાં એમનાં પુષ્ટળ કાવ્યો હોઈ, આપણે તો એમાંથી માત્ર એ-ત્રણુજ જોઈશું. કાનુંાની જદુલરી કાનિત વર્ણવતાં કહિ લખે છે:-

“ કાનુડો કામણુગારો રે, સાહેલી આતો કાનુડો.

કાનુડો કામણુગારો, રસલરોં ને રૂપાળો,

આ શું આંખલડોનો ચાળો રે.—સાહેલી૦

રંગરતો, મદમાતો, વાંસળીમાં ગીત ગાતો,

નયણું શું કરે વાતો રે.—સાહેલી૦”

અને અનુપમ એ અલખેલાનું સોહામણું સૌન્દર્ય આલેખતાં કવિ કહે છે:—

“તું જેને સખી, શોભા સલૂણું સ્થામની.

કાટિ કદર્ષ લનવે એતું મુખઙું,

શ્રીકી પડે છે કળા જામિની.—તું જેને૦”

કોડામણું એ કન્હૈયાનાં મોહક અંગસૌષ્ઠવ અને આંખનાં છાનાં જાદુ, મીઠી હલક ભરી આ ગર્ખીમાં, કવિ ડેવાં મૂર્તિ કરે છે!

“કામણું દીસે છે અલખેલા તારી આંખમાં રે;
બોળું લાંખ મા રે.

મંદ હસ્તીને ચિતરું ચોર્યું, કુટિલ કટાક્ષે કાળજ કોર્યું;
અદ્યપિયાળી આજે ત્રીણું આંખ મા રે.—કામણું.

નખરાણ રૂપ ધાણું રદ્વિયાળું, લટકું સધણું કામણુગારું;
છાનાં ઘંજન રાખે પેકજ પાંખમાં રે.—કામણું.

કૃષ્ણના સુભગ દેહલાવણ્ય જેતું જ એની માનીતી વાંસળીનું વર્ણન પણ મનજીર અને મનજર છે. વૃદ્ધાવનમાં જીબા રહી કૃષ્ણે છેડેલી બંસીની અસર અદ્યકૃત અને અવર્ણનીય છે. યમુનાનાં નીર થલી જય છે. પક્ષીઓ સાહ સાંભળવા રિથર બની જય છે. વાછરડાં પયપાન કરવું છોડી કાન માડે છે, અને ગાયો તો ગળા તોડી ત્યાં દોડી જય છે. આમ વાંસળીનાં જાદૂથી સારી પ્રકૃતિ ખળલળી ઉંડે છે, ત્યાં કૃષ્ણથેલી ગોપીઓ એહાલ બને એમાં શી નવાદ્ધ! એમનું ભાન ભૂલ્યાનું હાસ્યરસિક ચિત્ર કવિએ સુંદર આલેખયું છે:—

“એકના કરમાં ડાળિયો રે, પીતી ચાલી એક નીર;

એક છારુ રડતાં મેલી ગઈ રે, ચાલી જમનાને તીર.”

વાંસળી પ્રતિની સપત્નીભાવે ગોપીની ઉક્તિએ પણ જીવત, હદ્યંગમ અને ભાવભરી છે:—

“માનીતી તું છે મોહનતણી, હો વાંસલદી;

તું ને બ્લાકમ કરે છે ધાણું બાલ રે, હો વાંસલદી.

પીએ અધરામૃત પિયતણું, હો વાંસલદી;

અમને શોક્ય સરીણું તું સાલ રે, હો વાંસલદી.”

હવે કવિની સંગીતની સિદ્ધહસ્તતાનાં એક-એ દાટાં જેઠાં. બંસીઅર્ટના રસ-
ગોડમાંના રાધા અને એની સખીઓના સુભગ ગરાયાનું વર્ણન કવિએ ને સુકુમાર શંદોમાં અને સુરીલા લયમાં કર્યું છે, તે કવિની સંગીત નિપુણતાની સરસ આંખી કરાવે છે:—

“ગરબે રમવાને ગોરી નીસર્યી રે લોલ,

રાધિકા રંગીલી અભિરામ મિજવાસિણી રે લોલ;

તાળી દેતાં વાગે આંજર ઝુંમાં રે લોલ,

ગિડ ગિડ તામું છુમું છુમું ભાજે ધૂધરા ર લોલ.”

એથી એ અધિક “ચાલ વ્હેલી અલખેલી ખારી રાધે” એ સોરઠ રાગની, તાલની વિકટ આંગીધૂંટીવાળી ગરબી કવિના સંગીત પરના અનન્ય પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે. તથ્યલાના એક ઉસ્તાદ અભ્યવૈયા સાથેની સંગીતરસધની અંગે કવિએ એ ખાસ રચી ગાઈ હતી, અને એના અટપરા તાલમાં ઉસ્તાદ અટવાઈ જતાં વડોદરાની વિરાટ જનતા સમક્ષ કવિએ જવલંત વિજય મેળવ્યો હતો! છતાં એ ઉસ્તાદની સંગીતનિપુણતાથી ખૂશ થઈ આપણું ચુણુમાહી કવિએ પોતાના ગળામાંની સોનાની કંઈ અને બેટ કરી હતી!

પત્ર ૦ સુવાંસ : કાલગુન ૧૬૮૫

છેલે કવિની કાલ્યકલાની એક-એ ખૂબીઓ દર્શાવી આ લેખ પૂરો કરીએ.
કૃપટી કૃષ્ણના ઉપર કોથે લારાયલી રાધા કાળી વરતુમાત્રનો ત્યાગ કરે છે, કેમકે કાળી
વરતુઓમાં એક સરખું કૃપટ હશે એમ એ માને છે. રાધાના એ નિશ્ચય પાછળ કવિની
રમતિયાળ કલેપના ડેવી રસિક અને આદ્યલાદડ છે:—

“સ્થામ રેગ સમીપે ન જતું, મારે આજ થકી સ્થામરંગ
નેમાં કાળાશ તે સૌ એક સરખું, સરવમાં કૃપટ હશે આવું.
કસ્તુરીની બીજી તે કહે નહિ, કાળી ના આંખમાં ઘંઠાં.

નીલાંબર કાળી કંચુકી ના પહેંચે, જમનાનાં નીરમાં ન નહાવું.”

માનિની રાધા કૃષ્ણની સાથે અભોલા લે છે. સહેજ વાતમાં વંકાતી રાધાને રીસાતાં વાર
શી? કૃષ્ણ બ્લાકથી એને શરિવહની કહી, ત્યારે એને ઉલ્લંઘ વાંકુ પહુંચું, અને કૃષ્ણ
નેડે અભોલા લીધા! એ વરતુ કવિએ ડેવી ખૂબીથી રજુ કરી છે!

“હાવાં હું સખી નહિ બોલું રે, કહાપિ નંદુંવરની સંગે;

મુને શશિવહની કહી છે રે, ત્યારની દાજ લાગી છે અંગ.

ચંદ્રબિલમાં લાંછન છે વળી, રાહુ ગળે ખરમાસે;

પક્ષે વધે ને પક્ષે ધરે કળા પૂરણ નિત્ય તે નવ પરકારે.”

રીસાયલી રાધાને લલિતા ધાર્યું સમજાવે છે, પણ હડીલી એની હડ છેઢતી નથી.
આખરે પ્રલુ પોતેજ એનો સરસ રસ્તો શોધી કાઢે છે. એ યુક્તિમાં કવિની રસિકતાની
ને કાલ્યકલાની આપણુંને સુરેખ જાંખી થાય છે. કૃષ્ણ પોતે એક સુંદર સુવતીનું ઇપ
ધારણ કરી રાધા પાસે આવે છે, અને વાતવાતમાં પોતે કૃષ્ણને જોવા જય છે એમ
જણ્ણાવે છે. એ સાંલળી રાધાને ચટપટી થાય છે કે “મુજ કરતાં રૂપે છે રડી, હેખતાં
લાલ લેલાશો.” એટલે એની સાથે સહીપણાં બાંધી એકખીજાનું વચ્ચન પાળવાનો ડોલ
પરસપર લે છે, અને પોતે ચતુરાઈ કોવી માની મનમાં પુલાય છે, તે માગે છે:—

“સ્થામા કહે સખી માણું, તમો સ્થામ સમીપે ન જશો;

સખી કહે હું પણ માણું, તમો તે ઉપર મા રીસાશો.”

અને પછી પ્રલુ ખરે સ્વરૂપે પ્રગટ થતાં માનિની મનાય છે અને રાધાકૃષ્ણ
એક થાય છે.

રાધા પોતાને અડવાની કૃષ્ણને ના પાડે છે, ત્યારે એના ઉત્તરમાં કૃષ્ણ બેવડા
સ્પર્શનો ઉકેલ કાઢે છે એમાં પણ કવિનું સુંદર કલાકૌશલ્ય હેખાય છે. જોરી રાધા કૃષ્ણને
કહે છે કે “મુજને અડરો મા, આધા રહેલો અલેલા, છેલા અડરો મા.” કેમકે “કહાન
કુવર કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં.” એના જવાબમાં શ્રીકૃષ્ણ જણ્ણાવે છે:—

“તું મુજ અડતાં સ્થામ થર્દા તો હું કયમ નહિ થાડ જોરો;

કરી મળતાં રેગ અદ્લાઅદ્લી, મુજ મોરો તુજ તોરો.”

આમ જાં રાધા અહાતું કાઢી એક મિલન અટકાવવા મથે છે, ત્યા યુક્તિયાજ કૃષ્ણ
એનાજ અહાનાથી એને બાંધી બેવડુ મિલન મુક્રર કરે છે! એમાં જ કવિની કલેપનાની
ખરેખરી ખૂબી રહેલી છે. કવિના “લોચન મનના જવડા” માં પણ કલેપનાની એવીજ
વિલક્ષણાતા વ્યક્ત થાય છે, પણ સ્થળાંકેયને લઈ હવે અહીજ અટકોશું.

આપણા પ્રાચીન રાસસાહિત્યનું રસહર્શન આ રીતે પૂરુ થાય છે. અર્વાચીન રાસ-
સાહિત્યને અનુરૂપ અવસર પર છોડી વિરમીશું.

નાટકિયો

લેખક : ધ. ન.

[ગયા અંકના પૃ. ૪૬૧ થી ચાલુ]

ધનશ્યામ ખુદ્દશાળી હતો. વર્ગમાં તેનો નંબર પહેલો રહેતો. પણ રસિક અને તેની મંડળી ત્યાં થતેને રમકું ગણું જનાવતાં. રસિકના બધા જેડીદારો ધનશ્યામને મામા કહીને જ એલાવતાા, અને તે પહેલો નંબર રાખે એ તેનો ગુનોહ હોય તેમ તેને 'ગોખિયો, ખીકિયો, અંધો' વગેરે ઉપનામોથી નવાજતા.

ધનશ્યામે એકાદ એ વખત વેણુને શાળામાં થતી પજવણીની વાત કરી નેર્ધ પણ વેણું તો "તારે પણ તેમના જેવું થવું તું શા માટે ડરે છે?" એટલું કહી તેની વાત ઉડાવી દેતી.

શાળાનું સોશિયલ જેટરિંગ હતું. ધનશ્યામના પાડમાં તેને એક ગાયન ગાવાનું હતું. રસિકનો તો અગ્રભાગ હતો જ. પરન્તુ ધનશ્યામના સુરીલા ગળાની મીઠી હલકથી આખો પ્રેક્ષકર્ણ એટલો ખુશ થઈ ગયો કે તેમને ખીજ કોઈનું 'કામ' નજરમાં આવ્યું જ નહો. ખુરશીની પહેલી હરોલમાં એકોલ પ્રતાપરાયને તો માનવામાં પણ મુશ્કેલી પડી કે "આ ગાનાર ધનશ્યામ તે વેણુને જલો-બોળો-શરમાળ લાઈ જ હતો!"

મેળાવડો પૂરો થયા પછી પ્રતાપરાય સાથે એલી શકે તેવા દરેક જણે તેને કહ્યું, "રસિકભાઈ તો સારા જ, પણ ધનશ્યામે તો કમાલ કરી! ગળું તો ચિંધરી જ બદ્ધિસ જણે!"

મેળાવડાથી પ્રતાપરાય ખૂબ પ્રસન્ન થયા.

ધેર આવી તેમણે વેણુને પૂછ્યું, "તે ધનશ્યામને ગાતાં સાંભળ્યો છે?" પણ પછી તરત જ તેમને ખ્યાલ આવ્યો કે, "એક સાથે જિછરીને મોટાં થયેલ લાંકુને આવો પ્રશ્ન પૂછાય?" અને તે પોતાના પ્રશ્નની વિચિત્રતા પર હસી પડ્યા.

વેણું પણ હસી પડી.

"ધનશ્યામ અહો શાંત થઈ ગયો છે. ધેર તો આખો દિવસ ગાતો જ હોય."

વેણું કહ્યું.

"હા."

"ત્યારે અહો કેમ તદ્દન શાંત થઈ ગયો છે?"

"કોણ જાણે?"

"એને અહો ફાવતું નહો હોય?"

"ના. ના. એમ તો શું, પણ શરમાતો હશે."

"વેણું, એના ગળાનું માધુર્ય અજર્ય છે. ધેર કેમ કોઈ દી ગાતો નથી?"

આ વખતે જ રસિક અને ધનશ્યામ બહારથી આવ્યા, પ્રતાપરાય તેમને એલાવ્યા.

૫૩૪ .. સુવાસ : ક્ષાવગુન ૧૯૬૫

“બાપુજી, મામાને ચેંડક આપવાનું નક્કી થયું.” પોતાને નહોં અને મામાને ચેંડક આપવામાં આપનારનું અજ્ઞાન સમાયું હોય તેવું દેખાડતાં તેણે મામા શણ્ણ ૫૨ ભાર મૂકી કર્યું.

“એમ કે ? ધનશ્યામ તેને લાયક છે. અને રસિક, તું અલિનયની અતિશયતા શીદ કરે છે ? તારામાં કુશળ નટ થવાનાં લક્ષણો છે, પણ આને તો તે તે તારો પાડ અગાડી જ નાખ્યો હતો. તું શું ડોઈ ધંધાદારી નટ હતો, કે તારી સમક્ષ શું એકદું મવાલી પ્રેક્ષક-મંડળ એકું હતું ? સાચા અલિનયમાં તો સંયમ આસ આવસ્યક છે.”

રસિકને પિતાની સલાહ કરી તો લાગી, તોય તે શાંત જાઓ રહ્યો. તેણે તો પિતા તરફથી વખાણ મેળવાની આશા સેવેલ, અને એટલે જ તો તેણે જોશોરથી હોકારા-પડકારા કર્યા હતા ને ! પણ આ તો અલિનયની તદ્દન નવીન દશ્ચ ! અલિનય અને સંયમ ! રસિકને પિતાની વાત બરાબર ન સમજાઈ.

“અને ધનશ્યામ, તારી બેનતે તારું ગાયન સાંભળતું છે. ચાલ, ગા જોઉ ! હું વાળ પર બેસું છું.”

ધનશ્યામ શરમાઈ ગયો.

“રસિક તીવ્યેથી વાળનું લઈ આવતો !”

રસિક વાળનું લઈ આન્યો; ધનશ્યામે ગાયું કેટલીક વ્યક્તિઓ. એવી હોય છે કે જ્યાં-સુધી તે શરમાય ત્યાંસુધી તેમના મોઢામાં જુલ હશે કે નહિ તેની ય શકા જાડે; પણ તે જ વ્યક્તિ એક વાર શરમ મૂકી પોતાના પ્રિય વિપ્યની છણુવટ કરે ત્યારે તો કમાલ કરી દે છે. ધનશ્યામે ગાયું શરીર કર્યું અને તેની શરમ જાડી ગઈ. અધાં સુગંધ થઈ ગયાં. ધડી ભર તો રસિક પણ !

“દે, આ મારા તરફથી ચાંદ !” કહી પ્રતાપરાયે ધનશ્યામને દશ ઇપિયાની બેટ આપી.

ધનશ્યામ પર તેને દેરથી અવારનવાર પત્રો આવતા. તેનો નાનો લાઈ મોટાભાઈ પાસેથી કંઈ કંઈ વસ્તુઓ મંગાવતો, અને રણ પડે ત્યારે એ અધું સાચવીને લાવવાનું લખાવતો. પિતાજ્ઞાનો પત્ર આવતો તે દિવસે ધનશ્યામ અહુ આનંદમાં રહેતો. પ્રતાપરાય તેને અવારનવાર થોડા થોડા પૈસા વાપરવા આપતા, તે અધાં તે સાચવી રાખતો, અને એ પૈસામાંથી જુદી જુદી ચીને નાનાભાઈ માટે લઈ જવાના મનોરથા સેવી આનંદ પામતો.

ધનશ્યામને પ્રતાપરાયને લાં રાખવાનું આસ પ્રયોજન તો વેણીને આનંદ આપવાનું હતું, અને વેણીને લાઈના વિકાસથી, લાઈની સોઅતથી આનંદ થતો ય અરો ! પરન્તુ ધનશ્યામ તો આ મોટા લોક વચ્ચે આવી કયારાઈ રહ્યો હોય એમ જ લાગતું. એક વેણી સિવાય બીજું કોઈ ભાગ્યે જ તેની સાથે આનંદપૂર્વક વાત કરતું. પ્રતાપરાયને તેને માટે લાગતું હતી, પરન્તુ તેમની સાથે વાત કરવાનો પ્રસ્તુગ તો ધનશ્યામને કયારેક જ આવતો, એટલા તે કામઠા હતા.

પરીક્ષા આવી. ધનશ્યામ પહેલે નંબરે પાસ થયો. રસિક એ વિષયમાં-સંસ્કૃત અને ગણિતમાં-નાપાસ થતો હોવા છતાં તેને ઉપર ચડાવવામાં આવ્યો. રસિકના મોટાભાઈ પણ આ વખતે બી. એ. માં વીજે અખતરે પાસ થયેલ, તેમણે એકશેલ. બી. થવા ધાર્યું હતું.

નિશાળમાં રજ પડી અને ધનસ્યામ રમકડાં છત્યાહિની ખરીદીઓ કરી દેર જવા જિપુયો.

ધનસ્યામની રજાઓ પૂરી નહોતી થઈ ત્યાં તો તેને અને તેના આપુણે તરત જિપુવાનું સ્થયવતો વેણુનો તાર મળ્યો.

સોણ વર્ષનો ધનસ્યામ બેનનું છક્ક્ય બરાબર સમજ શકતો હતો. તેને બરાબર ખર હતી કે અરી મુશીયતમાં આવી પડ્યા વિના મોટીએન આવો તાર કરે જ નહિ ! તેણે તેના પિતાને જદ્દી તૈયાર થવા કહ્યું અને બંને પહેલી જ ગાડીમાં જિપુયા.

વેણું ખહ જ ગંભીર દશામાં આવી પડી હતી. પ્રતાપરાયને એકાએક લક્નો થઈ આવો હતો. ધનસ્યામ રજાઓ માણુયા ધેર ગયો ત્યારે સંપૂર્ણ તંડુરસ્ત લાગતા પ્રતાપરાય પર એકાએક જિતરી આવેલ આઝતથી આખા ધરમાં હાહાકાર થઈ ગયો હતો.

મૃણાલ ને વેણું આ પરિસ્થિતિમાં સાચી બેનો બંની ગઈ હતી. રસિક અને ધનસ્યામ પણ સાચા લાધુએ અની ગયા.

સાવકાંપણુનો ભાવ તદ્દન ઓસરી ગયો. સર્વનું લક્ષ્ય પ્રતાપરાયની સેવા કરવાનું અની ગયું.

“હું ને ધનસ્યામ આજે જથું છીએ.” વેણુના બાપુએ પ્રતાપરાયની પાસે આવી કહ્યું.

“ધનસ્યામને શા મારે લઈ જાઓ છો ?” પ્રતાપરાયે ધૂજતે હાથે લખ્યું.

“તમારા મંદ્વાડમાં જેટલી તકલીફ ઓછી થાય તેટલી કરવી !”

“ધનસ્યામ પર તો મારી અનેક આશાઓ છે. આ મંદ્વાડમાંથી ઊંઠું તો એને તો હું ખૂબ ભાષુધીશ.” પ્રતાપરાયે વળી લખ્યું. તે બોલી શકતા ન હતા. બધું લખીને જ સમજાવતા.

“આપને જરા ઢોક થશે એટલે ધનસ્યામને પાછા મોકલીશ.”

પ્રતાપરાયે ‘જેવી તમારી મરજી !’ તેવું આંખોદારા સ્થયંદું, અને આંખો બંધ કરી દીધી.

ધનસ્યામ અને તેના બાપુણ એ ઓરડામાંથી બહાર આવ્યા.

“બાપુણ, હું તો તમારી સાથે નથી આવતો.” ધનસ્યામે કહ્યું.

“કેમ ?”

“એન-અનેલીને આવી સ્થિતિમાં મુકી હું નહિ આવું.”

“તારે આવવું કે ન આવવું તે હું સમજું કે તું ?”

“મને તમારી વાત ગળે નથી જિતરતી. હું તો રોકાધશ.”

આપ દીકરા વર્ચ્યે ધણો રકજક થઈ પણ ધનસ્યામ એકનો એ ન થયો. આપ દીકરા પર શુસે થઈ જતા રહ્યા.

ધનસ્યામે તો પ્રતાપરાયની સેવા કાને અભ્યાસ છાડી હેવાનું કહ્યું, પણ તેની એ વાત કોઈએ માની નહિ. તેને અણુવા તો જવું જ પડતું, પણ તે સિવાયનો બધો વખત તે પ્રતાપરાયની પથારી પાસે જ રહેતો.

ગોતાની માંદગીએ ધરની દરેક વ્યક્તિમાં એકભાવ જગાડ્યો છે તે નેઈ પ્રતાપરાય

૫૩૬ .. સુવાસ : ઝાણગુન ૧૬૬૫

સંતોષ પામતા; અને એ વ્યાધિમાંથી સુકત થવા ઈશ્વર પાસે ભૃત્યની યાચના કર્યા કરતા.
દિવસો પર દિવસો પસાર થતા હતા અને પ્રતાપરાયનું શરીર લેવાતું જરું હતું.

“બધાને અહીં બોલાવ ! ” પ્રતાપરાયે એક દિવસ વેણુને લખી આપ્યું.
વેણુએ બધાને બોલાવ્યાં. બધાં આવ્યાં. ધનશ્યામ તો ત્યાં હતો જ.

“કુમ બાપુજી ! ” રસિક બોલ્યો.

“મારે શેડી વાત કરવી છે.” પ્રતાપરાયે લખ્યું.

“શી બાધત ? ” વેણુ બોલી.

“મને મારું શું થશે તે નથી સમજતું—” પ્રતાપરાય લખ્યે જતા હતા. ડાઈમાં
એક શાબ્દ બોલવાની પણ શક્તિ ન હતી. “પણ હું ન હોઇં ત્યારે ય તમે સંપત્તિ રહેશો
એવી મને આશા છે. તમારે કમનસીમે હું બહુ પૈસા એકડા નથી કરો શક્યો. પણ મેં
ડાઈતું ય અરાખ નથી કર્યું, એટલે ઈશ્વર મારા કુંભને પણ રોટલા વિના નહીં જ રાખે
તેવી મારી અચળ અધ્યા છે.”

બધાંની આંખ લીની થઈ હતી.

“અને ધનશ્યામ, તું તો બહુ ડાઢો છે. તારી ઉમ્મરના પ્રમાણમાં તું ખૂબ શક્તિ-
શાળા છે. મને એટલું વચન ન આપે કે તું સહાય રસિક ને તેનાં લાંદુનો બાઈ જની
રહીશ ? એ બધાં ગમે તેમ કરે પણ તારે તારી ઉદારતા ન જતી કરવી.”

ધનશ્યામ સજણ નયને નીચું લેઠ રહ્યો.

“અને છાકરાંચો, વેણુ તમારી માતા છે, તે વાત કદી ય ન ભૂલશો. ક્રી પરણવામાં
મેં ભૂલ કરી એમ લદે માનો પણ વેણુનો તેમાં શો દોષ ? મારે ખાતર પણ તને તમે
માતાસમ ગણુશો. તો મને શાંતિ થશે.”

બધાં દૂસરાં ભરતાં હતાં. ડાઈ કંઈ બોલી ન શક્યું.

“વેણુ, તને શું કહું ? ” પ્રતાપરાયનો હાથ ખૂબ દ્વૃજવા લાગ્યો. વેણુ પ્રેમપૂર્વક
તેમના હાથને વળગી પડી અને બનેની આંખમાંથી અશુદ્ધારા વહી રહી.

આ પરમ પવિત્ર પળ હતી. રાગ, દ્વાપ કે સ્વાર્થ અશુદ્ધી વિશુદ્ધ થયેલા આ વાતા-
વરણમાં ડાંકિયું પણ કરી શકે તેમ ન હતાં.. આ પવિત્ર પળ ધનશ્યામે મનમાં સંકલ્પ
કર્યો કે “પ્રતાપરાયની આ મુરાદ બર લાવવા હું ગમે તે લોગે ય મર્થીશ.”

પ્રતાપરાય લગભગ એક વર્ષ સુધી માંદા રહ્યો.

તેમની સારવારમાં વેણુએ જરાય ભણું ન આવવા દીધી. સારામાં સારા ડોકટરો
પ્રતાપરાયની માવજત કાંકે આવતા. આ ડોકટરોની શીના પૈસા શી રીતે ચૂકવાતા હોય
એ પ્રશ્ન પ્રતાપરાયના મનમાં ઘોળાયા કરતો; પરન્તુ એકથી એક ચિયાતા ડોકટરો
તો આપે જ જતા.

વેણુ તેનાં ધરેણું એક પછી એક વેચી દવાઓનું, ડોકટરોનું, અને રસિક તથા
મોટાબાઈના લણતરનું ખર્ચ કાઢ્યો. ધનશ્યામ પણ રસિક સાથે જ લાંદુનો, પરંતુ તને
પહેલે નંબરે પાસ થવા બદલ શિષ્યવૃત્તિ મળતી હોવાથી તેનું ખર્ચ કંઈ ન આવતું.

“એન, મારાં ધરેણું પણ જરૂર પડ્યે તમારાં જ છે એમ માનજો હો ! ” મુણ્યાદે
એક દિવસ વેણુને કહ્યું.

“તમેથ અમારાં જ છોને ? ” વેણુએ હસતાં જવાબ આપ્યો.

“ પણ હું તો તમને કંઈજ ખપમાં આવતી નથી.”

“ તમારો ખપ પડ્યે તમને ય નહીં મુકું ! ”

“ આજે મારો ખપ છે જ ! મારાં ધરેણું દ્યો જ ! ” મૃણાલે જરા હડ કરતાં કહ્યું.

“ ગાંડાં થાવ મા ! તમે મારા દીકરાની વહુ છો, તમને તો અમારે લાડ કરવાનાં હોય ! ” વેણુએ મૃણાલના અન્ને ગાલ પોતાની હૃદેલી વચ્ચે લઈ પાડેલ કેરિને ધોળે તેમ ઘોળતાં કહ્યું.

“ ના....ના.” મૃણાલ બોલી.

“ એન, હું ખરે કહું છું કે જરાર પડ્યે હું તમારાં ય ધરેણું માગી જ લઈશ. અસ્યારે જરાર નથી જ. ” કહી વેણુ ડોઈ કામ એકાએક થાદ આવ્યું હોય તેવો હેખાવ કરી જતી રહી.

પ્રતાપરાયના મંદ્વાડે વેણુને ધરતી અધિકારીનું સ્થાન અપાવ્યું હતું. પહેલાં જે વેણુની અવહેલના કરતાં તે હવે વેણુનો પડ્યો બોલ જીવામાં કર્તવ્યપરાયણતા માનતાં થાં હતાં. વેણુમાં પણ ખરેખરે પીઠપણું આવી ગયું હતું.

પ્રતાપરાય ગયા. બધાને માથે આબ તૂટી પડ્યું હોય એમ લાગ્યું. બધામાં વેણુની સ્થિતિ બહુ કદ્દાડી હતી. તેનું અંતર તરફાડી રહ્યું હોવા છતાં તેને આંખનાં આંસુ ખાળવાં પડતાં. તેના મોટાબાઈ જેવડા મોટાબાઈનું માણ્યું પણ તે જોણામાં લેતી અને તેને રડતા છાના રાખતી. વેણુનું માતૃત્વ એકાએક વિકસી ગયું. બધાં તેની પાસે એસી રડતાં અને વેણુની હુફ્માં આશ્વાસન શોધતાં.

પરિક્ષાનાં પરિણામ આવ્યાં: મોટાબાઈ નાપાસ. રસિક નાપાસ. ધનસ્યામ પહેલે નંબરે પાસ.

રસિક કે મોટાબાઈ પર રોષ કે દ્વારા દર્શાવવાની કે ધનસ્યામને શાખારી આપવાની છાઈ ને પડી જ ન હતી. સહુ અને ભાસ તો વેણુ, પ્રતાપરાયના ગયા પણી ‘હવે શું કરવું ? ’ તેની જ ઉપાધિમાં પડ્યાં હતાં. વેણુને બીજી બધી વાત કરતાં પ્રતાપરાય જમાવેલ આખરનું જતન કરવાની ભાસ એવના હતી.

વેણુનું છેલ્લું ધરેણું વેચાઈ ગયું. મૃણાલના આગહોને વશ થઈ—તેમજ બીજો કંઈ ઉપાય પણ ન હોનાથી તનાં થોડાં ધરેણું વેચી પ્રતાપરાયની ઉત્તરક્રિયા કરવામાં આવી.

આવી કદ્દાડી સ્થિતિમાં વેણુ લોડા સમક્ષ તો જોતાની સ્થિતિ ધણ્ણી સંક્ષર હોવાનો હેખાવ કરતી. ડોઈપણું આખતમાં તેણે ધરતું મોણું નહોતું હેખાવા દીખું. સૌ ડોઈ-માનતું કે પ્રતાપરાય જેવા મોટા હેદેશારની પાસે સાંચે એવું સંચિત હોય તેમાં શી નવાઈ ! અને ઐસો હોય તો જ એકથી એક ચાડિયાતા તોકટરો બોલવવાનું સહેલે ને !

એવી તો ડોઈને કલ્પનાય નહોતી આવી કે પ્રતાપરાયની સારવાર માટે આવેલ તોકટરોનાં બીલ વેણુનાં આખૂષણ્ણો વેચી ચૂકુવવામાં આવ્યાં હતાં: એવો તો ડોઈને ખ્યાલ પણ નહીં ગયેલ કે પતિવરિહમાં દૂઢળો થયેલ વેણુનાં દૂધળાં થવામાં જિંચી જતના જ્યારાક મળવાનો અભાવ પણ એક કારણ હતું. વેણુએ ચા, દૂધ, ખાંડ, વી આવાં એંધ કર્યાં હતાં, તેમાં ગતું આત્માનો શોક પાળવાની લાવના ઉપરાંત કરકેસર કરવાની લાવના પણ હતી તેની ડોઈને એંધ સરખી પણ નહોતી આવી.

ધસાઈ ગયેલાં મધ્યમ વર્ગનાં કુંઝ માટે આખરનું તૂત જળવી રાખવાનું વહુ મુશ્કેલ હોય છે.

ખૂદી .. સુનાસ : ફાલગુન ૧૯૬૫

પોતાના કુંભની વારતવિક પરિસ્થિતિથી પરિચીત મોટાભાઈ એ એક હિવસ કહ્યું,
“હે તો હું કંઈક નોકરી શોધી લઈ તો ઢિક !”

ધરનાં બધાં માણુસો હાજર હતાં. ધનશ્યામ પણ.....

“કેમ ?” વેણુએ પૂછ્યું.

“મારે હે ધરની ચિતા કરવી જ જોઈએ ને !” મોટાભાઈ એ કહ્યું.

“ચિતા કરવા માટે હજ નાના છો !” વેણુએ સત્તાવાદી છતાં મીડા અવાજે કહ્યું.

“કેમ ?” ઉમરમાં પોતાથી નાની વેણુને આ પ્રમાણે ઓલતી સાંભળી મોટાભાઈએ નવાઈ પામતાં કહ્યું.

“ધરનો બધો લાર ઉપાડીને ફરવા તૈયાર થનાં પહેલાં તમારે તમારો અભ્યાસ તો પૂરો કરવો પડશે ને !”

“ઓહો !”

“કેમ ઓહો ?”

“હજ તો મારે દોઢ-એ વર્ષ ભણું પડે. અને આપણા ધરની આવી મુશ્કેલ સિથતિમાં ભણુવાનું ખર્ચ તો કેમ જ જિપડે ?”

“તે તમારે જોવાનું છે કે મારે ?” વેણુનો તીણો સ્વર ગાળ રહ્યો. બધાં તેની દિલાવરી પ્રશ્નાસાપૂર્ણ નેત્રે જોઈ રહ્યાં.

“ના, એના !” મૃષ્ણુલે કહ્યું, “એવી જોકી જક ન કરશો. અત્યારે ધરતું ખર્ચ પણ કેમ પૂર્ણ કરો છો. તે આપણે સમજાએ છોએ. એમાં ભણુતરનું ખર્ચ કયાંથી જિપડે ! એ નોકરી કરશો તો એટલી ચિતા તો એઠો થશો !”

“એન, તમારે એમ કહેવડાવવું છે કે હે આ ધરની માટી દશા એસી ગઢ ?”
વેણુ ખૂબ ગંભીર થઈ ગઢ હતી. બધાં ચૂપ હના.

“મારા જીવતાં” વેણુ જોલી રહી, “તો હું એમ નહીં થવા દઈએ. શું કરે મારાં માઝાપ ગરીબ છે,” વેણુએ ધનશ્યામ સામે જોતાં કહ્યું, “નહીં તો ત્યાંથી માગી બીજી લાવીને એ મોટાભાઈનો અભ્યાસ પૂરો કરાવત ! પણ હજાએ શું બગડી ગયું છે ? હું ધરની માટી ખું. ધરની લાજ સાચવાની મારી ફરજ છે. તમે બધાં નવિયત રહે. હું ખૂબી રહેવાનું કખુલીશ પણ મોટાભાઈ હે રસિકભાઈનું ભણુતર તો નહીં જ છોડાયું.”

“પણ એન.....” મૃષ્ણુલે કહ્યું.

“ના, મારા સંકલ્પને જરાય દુર્લિળ ન અનાવશો. ધર્શર મને સહાય કરશો.”
વેણુમાં અપાર્થિવ તત્ત્વ હોય તેવું લાગતું હતું.

“અને ધનશ્યામ, ભાઈ ! તું હજ નાતો છે, નહીં તો તું તારી એનને મદદ ન કરે ?”

“હું મારી એનને જરૂર મદદ કરીશ.” ધનશ્યામ દ્રદ્રતાપૂર્વક જોલ્યો.

“મોટા થા ત્યારે.....” વેણુએ વચ્ચે કહ્યું.

“હું મોટા થાજાં ત્યાં સુધી મારાથી એસી શી રીતે રહેવાય ? હું તો એન મારે કંઈક કરવાનો જ !”

“ઢિક ઢિક. એ તો જેયું જશો.” વેણુએ કહ્યું.

છેવટે મોટાભાઈ એ એલ એલ, બી. નો. અભ્યાસ કરવા જતું અને રસિક મેટ્રિકનો
અભ્યાસ ચાલુ રાખવો તેમ વેણુની છચ્છાતુસાર નક્કી થયું.

[અપૂર્ણ]

ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ

લેખક : પ્રમા

નવવર્ષના મંગળપ્રકાસને હજ ચાર માસ પૂરા વીત્યા નથી, ત્યાં તો હિંદ અને ગુજરાતે અનેક સંસ્કૃતાધીય વિભૂતિઓ ગુમાવી છે. તે ગત વિભૂતિઓમાં શ્રીમન્ત સયાજીરાવનું સ્થાન અતન્ય ને અપૂર્વ છે. ગત મહા વહી એને સર્વર્ગસ્થ બનેલ એ ગુજરનરેશની જીવનરેખા, ધ્યાને ધ્યાને પ્રભુતાથી દૂર હઠતા અને હઠાવતા વર્તેગાન હિંદના અદ્ય રાજગીરસુદીયમાં પણ કંઈક એવું જળહળણું તેજ દાખવે છે કે ગમે તેવા હિંદીને પણ તે આકર્ષણી વિના નજ રહે.

તેમનું જીવન અનેક રીતે મનનીય છે. સામાન્ય કુંઝમાં જન્મયા છતાં ગુર્જરપતિનું પદ શોલાવનાર, સ્વમાનને જાળવ્યા છતાં પરદેશીઓનો પ્રેમ જીતનાર, હિંદુ પ્રજાના રાજપ્રતિનિધિ છતાં જીનાયોરેને પણ સંતોષનાર ભારતીય નૃપતિ તરીકે; અને વૈભવ છતાં સાદાઈ, પ્રભુતા છતાં કારુણ્ય અને પ્રજાવતસલતા છતાં અઙૃતા જેવા પરસ્પર વિરોધી ગુણોને પચાવનાર સુધારક નરવીર તરીકે હિંદની પ્રગતિમાન પ્રજાના હૈયામાં તેમણે અમર સ્થાન જમાવ્યું છે.

તેમનો અને તેમના પૂરોગામીઓનો ધર્તિહાસ કંઈક રોમાંચક, સાથે જ મરાડી સામાન્યના અંગ તરીકે ભારતીય ધર્તિહાસનું એક જ્યલંગત પ્રકરણ રેઝિક એવો છે.

ગાયકવાડ કુંઝના મૂળ સંસ્થાપક દામાજીરાવ ગાયકવાડના માતામહ શ્રી નંદાજીએ એક સમયે યવનોથી હરાતી ડેફ્લીક ગાયોને પોતાના કિલ્વાનાં ડાડાડ-ડમાડ મોદી અંદર એંચી લઈ બાયાવી લીધેલી. પરિણામે તે ગાયકવાડના નામથી ઓળખાયા. શ્રી દામાજીરાવને એ પદ તેમની પાસેથી વારસામાં મળ્યું.

દામાજ ગાયકવાડનું યુદ્ધનેપુણ્ય વિરલ હતું. યવનો સાથેના યુદ્ધમાં તો તેમની શક્તિ માઝા મૂકૃતી. ધ. સ. ૧૭૨૦માં નિઝામ સાથેના યુદ્ધમાં તેમણે દાખનેલા અપૂર્વ પરાક્રમથી ખુશ થઈ શાહૂ છત્રપતિએ તેમને 'સમરોર અહાદૂર'નો ઈલ્કાખ આપેલો.

દામાજના પુત્ર પિલાજીરાવની મરાડી સૈન્યના સેનાપતિના નાયઅદ્વિાન તરીકે નિમાયુક્ત કરવામાં આવી. તેમણે પ્રથમ તો પોતાનો વસવાટ આનહેશમાં રાખ્યો; પણ પછી ગુજરાતમાં સોનંગઢ પાસે એક કિલ્ડો બાંધીને મુગલ સુખેહારોની વિર્દ્ધનાં યુદ્ધોમાં મદ્દ કરી તેમણે ડેફ્લીક પ્રદેશ પર ચોથ ઉધરાવવાનો હજ મેળવ્યો. બીજાપુરના યુદ્ધ પછી તેમને મહારાજાં ચેકનર્તી તરફથી 'સેના ખાસખેલ'નો માનવન્ત ઈલ્કાખ બસ્યવામાં આવ્યો.

ઉપરના બંને ઈલ્કાખો આજે પણ એ કુંઝના મુખ્ય રાજવંશી—ગાયકવાડ નરેશ ધારણ કરે છે.

પિલાજના અતૂટ પરાક્રમથી ગુજરાતમાં વધી રહેલી મરાડી સત્તા મોગલસમાટને ખૂંચવા લાગી. તેણે ગુજરાતના મોગલ સુખેહાર સર ખુલ્દભાનને પાણે ઓલાવી લેધપુર નરેશ અભયસિંહને ગુજરાતની સુઆંશીરી સુપ્રત કરી. અભયસિંહે વડોદરા કંઘે કર્યું અને સંધિના ખાનને કપ્તથી પિલાજીરાવનું ખૂન કરાયું. પણ ખૂને રેગાયદ તેના હાથ ગુજરાતને

ન સાચચી શક્યા. પ્રેરણના લાયકવર્ગે બંડ કર્યું અને તે તે સમાવી શકે તે ખેલાં જ પિલાળના ભાઈ મહાદળાએ વડોદરા કાગજે કરી તેને સથકાન અનાવી દીધું. તે સમર્થી વડોદરા ગુજરાતની મરાઠી સત્તાનું પાટનગર અની રહ્યું.

પિલાળના પુત્ર દામાળ ભીજાએ વ્યવસ્થિત તત્ત્વ ને ભાવ્ય રાજગાડીની સ્થાપના કરી. તેણે પ્રથમ અમદાવાદ અને પછી ગુજરાતની અડધી વસુલાત પર અધિકાર સ્થાપી માળવામાં પ્રવેશ કર્યો. ચક્રવર્તી શાહુના મરણું પછી તે તારાયાઈના પક્ષમાં લગતાં મરાઠી સત્તાના તન્નપ્રતિનિધિ પેશાએ તેને ડેફેન્સાં નાંખ્યો. પણ તેથી કઈ ન વળતાં માનબરી સંધિ સાચે તેને છૂટો કરવામાં આવ્યો. એ સંધિની ઇચ્છે ગુજરાત પરની તેની સત્તા વ્યવસ્થિત, મરાઠી સાંનાન્યના અંગભૂત છતાં એકત્ર ને કંઈક અંશો સ્વતંત્ર અની.

૧૭૬૧ના પાણીપતના યુદ્ધ પછી તેણે કાઢિયાવાડનો ડેટલોક ભાગ સર કર્યો. અને લાડીની રાજકુંઝરી વેરે તેનાં લગ્ન થતાં ભાડીનો ડેટલોક ભાગ તેને ખેલામણીમાં મળ્યો.

આ રીતે પિલાળ અને દામાળના પરાક્રમી અમર્થી ગુજરાત, કાઢિયાવાડ, માળવા, ખાનહેદ્દા અને રજુપુતનાનો ધખોઅખરો પ્રદેશ ગાયકવાડના કંઘનભાં આવ્યો. પણ પિલાળના પુત્રો ઇસોહસિંહ અને ગોવિંદરાવ વચ્ચે કલાક જગતાં ઇસોહસિંહે મુખ્ય પ્રાન્તમાં તે સમયે પરિણગ જમાનતા અંગ્રેજે સાથે લખકરી સંધિ કરી. એ સંધિની ઇચ્છે ઇસોહસિંહને તાપીની દક્ષિણે આવેલો પ્રદેશ અંગ્રેજેને સાંપ્રદેયો. પડ્યો ને અંગ્રેજેને તેના રક્ષણુની જવાબદારી સ્વીકારી. તે પછી સાલાયાઈના કરારની ઇચ્છે ગાયકવાડ પેશાને ડેવળ નિયમિત અંગણી આપે એવું હર્યું. આના પરિણામે અંગણી સિવાયના વિધયમાં ગાયકવાડી રાજ્ય મહારાષ્ટ્રોથી સાંનાન્યથી ડેટલોક અંશો સ્વતંત્ર બન્યું. ઇસોહસિંહે તેને સુવ્યવસ્થિત બનાવ્યું. રાજધાની વડોદરાની ભીલવણી માટે તેણે શક્ય ઉપાય લીધા.

ઇસોહસિંહની પછી તેના ભાઈ ગોવિંદરાવે વડોદરાની ગાડી સંભાળી. વસાઈના કરારની ઇચ્છે તેઓ મરાઠી સાંનાન્યના ગુર્જરપ્રતિનિધિ મટી વડોદરાના રાજ્યકર્તાની ગણ્યાયા. તેમના પરની પેશાવી સત્તા કરી થઈ. પણ સાથે જ તે બ્ધિટિશ રક્ષણ હેઠળ મુક્કાયા ને મેજર વોકરની વડોદરાના રેસીટેન્ટ તરીકે નિમાણૂક થઈ.

વેકર ખૂબ પ્રતિબાસાળી ને લખકરી દમામનો પુરૂષ હતો. ગોવિંદરાવની પછી ગાડીએ આનેક કુમાર આનંદરાવની લદમનસાઈનો લાલ લઈ તે વડોદરારાજ્ય અને ગુજરાત-કાઢિયાવાડનો સર્વ સત્તાધીશ અની બેઠો. તેણે ડેટલાંક બંડ સમાવ્યાને ગાયકવાડના આંતરિક તત્ત્વમાં પણ સાથે સ્વતંત્ર બન્યું.

૧૮૨૪માં, પેશાએ ગાયકવાડને કાઢિયાવાડની અંગણી અને અમદાવાદના ધારા સંખ્યી, આપેક પટાની મુહંત પૂરી થતાં તેણે નવો પદ્દો કરી આપવા અનિચ્છા દર્શાવી. આ જુદાનો ઉકેલ આણવા ગાયકવાડના દિવાન ગંગાધર શાસ્ત્રીને, અંગ્રેજેની બાંહેખરી નીચે, પૂના મોકલવામાં આવ્યો. પણ લાં તેનું ખૂન થતાં અંગ્રેજેને પેશાવી ગાયકવાડ પરની સત્તા પૂર્ણપણે ખૂંચવી લીધી. ને ૧૮૧૮માં મરાઠી સાંનાન્યનું પતન થતાં ગાયકવાડ સ્વતંત્ર, અદ્યાત્મ અંગ્રેજેનોના કાખુ હેઠળના, ગુર્જરપતિ બન્યા.

આ અરસામાં ઓખામંડળમાં બંડ જગતાં અંગ્રેજેને અભ્યવસ્થાના અહાના નીચે ગાયકવાડના હાથમાંથી દ્વારકા સિવાયનું લગભગ કાઢિયાવાડ છીનવી લીધું. પેશાનું પીઠળ

જવાથી ગાયકવાડની સત્તા નખળી બનતાં તેને રક્ષણ આપવાના અદ્દામાં, અથવા તો જેની મુદ્દત પાકવા છતાં હંમેશાં કાચી જ રહેતી હોય એવા પદ્ધાણો નીચે, અંગ્રેજેએ ભીજે પણ અગત્યનો મુલક ગાયકવાડના હાથમાંથી પડાની લીધો.

કુમારનરેશ આનંદરાવના વાલી તરીક નીમાયલ ઇસેફસિલ્ને અંગ્રેજેની આ દખલગીરી ઓરથીએ કર્દી લાગતી. તે આખા રાજતંત્રને અંગ્રેજેના પ્રતિસ્પર્ધિ તરીક જ ગૂંથી નાંખતો. પરિણામે રેસીડેન્ટ ડાનીકે પોતાની પસંદગી પ્રમાણેનો દિવાન નીમવાની નીતિ અખત્યાર કરી.

આનંદરાવની પછી ગાદીએ આવેલ સયાજીરાવ, પ્રતિભાસંપત્ર ને તેજસ્વી રાજી હતો. તેણે અંગ્રેજેના પ્રતિનિધિ-મુખ્યમંત્રી ગવર્નર સમક્ષ, આંતરિક દખલગીરી સંબંધમાં, અને જરીક પણ બદલા સિવાય પોતાના સૈન્યના ઉપયોગ સામે પ્રમાણ વિરોધ જાડાયો. ગવર્નર, જે ગાયકવાડ, અંગ્રેજેની ધર્યા પ્રમાણેની પરરાષ્ટ્રનીતિ, ઝડપચૂકવણી ને અંગ્રેજે સાથે અમાધિત બાપાર ને ભીડા સંબંધની નીતિ સ્વીકારે તો તે દખલગીરી અટકાવવાનું વચ્ચેન આધ્યાત્મિક સયાજીરાવે તેમ કરવા કંઈકાયું. પણ કરવા સંબંધમાં ગાયકવાડ ને રેસીડેન્ટ વર્ચ્યે ક્રમક જરી. અંગ્રેજેએ ગાયકવાડ પર બીજું પણ વીશ લાખનું ઝડપ એઢાડાયું. ને એ ઝડપ ને સૈન્ય અંગેનો અર્થ વગેરે તેમણે કેટલાક મહાલો શ્રાંક વર્ષ સુધી પોતાના કઅનમાં લઈ વસુલ કર્યા. આંતરિક વહીવિઠી તત્ત્વ અંગ્રેજેની ધર્યા પ્રમાણે ન રચાય તો આખા રાજ્યની વસુલાત પણ પોતે જ એકદી કરવાની તેમણે ધમકી આપી. સયાજીરાવના દિવાન વેણીરાયને દૂર કરી અંગ્રેજેએ તે સ્થળે પોતાની પસંદગીનો દિવાન નીચ્યો.

આ અંગ્રેજનીતિનું પરિણામ કંઈક જુદું જ આવત. પણ તે અરસામાં મુખ્યમંત્રી ગવર્નર તરીક નવા નીમાયલ લોાડ કરેઅરે સયાજીરાવ સાથે મિત્રતાની નીતિ સ્વીકારતાં બધું થાળ પડી ગયું. સયાજીરાવે પોતાના આનગી ખલનામાંથી ઝડપ ચુકાયાનું. તેમણે અંગ્રેજેની ધર્યા પ્રમાણે રાજ્યમાં કેટલાક સુધારા પણ કર્યા ને અથવા શ્રમ લઈ તેમણે, અંગ્રેજેએ જરીત કરેલા મુલકમાંથી બની થકે તેટલો પાછો મેળની લીધો; અંતરંગ વહીવટ સંબંધમાં શક્ય સ્વતંત્રતા પણ મેળની.

સયાજીરાવના મૃત્યુ પછી તેમના પ્રણી પુત્રો ગણુપત્રાવ, ખંડેરાવ ને મલ્હારરાવ અનુકૂમે ગાદીએ આવ્યા. તેમાંથી ખંડેરાવની કારકીર્દી વિશેષ યશરસી નીવડી. તેમના સમયમાં મર્દાની અને મેદાની બેદેને ઉત્સેજન મળ્યું. તેમણે મકરપુરા રાજમહેલ બંધાવ્યો; કિંમતી હીરા અને જરી-જવાહીરનો સુંદર સંગ્રહ કર્યો. સત્તાવનના ખળવામાં તેમણે અંગ્રેજેને પૂરતી મદદ આપવાથી અંગ્રેજેએ તેમને દટક લેવાનો અધિકાર આપ્યો. અને કેટલીક વધારાની ખડણી માદ્દ કરી.

ખંડેરાવના મૃત્યુ સમયે મહારાણી જમનાખાઈ સગરાં હતાં. પરિણામે તેઓ સંતાનને જરીમ આપે ત્યાંસુધી મલ્હારરાવને 'રીન્ટ' નીમવામાં આવ્યા. મલ્હારરાવને શ્રીમન્ત ખંડેરાવ સાથે મળ્યાની જ અચુચનાવ હોઈ તેમણે, કહેવાય છે તેમ, રાજગાઢી હાથ કરવાને અનેક પ્રપણો રહ્યા. સગરાં મહારાણી રેસીડેન્ટને આશ્રમે જઈ રહ્યાં. ત્યાં તેમણે કુવરીને જરીમ આપતાં મલ્હારરાવને રાજગાઢીનો અધિકાર સહેને મળી ગયો; પણ તેમના પર રાજ્યની ગેરવ્યવરસ્થા, ને ખંડેરાવના કંદુંને તેમજ રેસીડેન્ટને એર આપવાના પ્રયાસ સંબંધી આરોપ આવ્યા. તે સંબંધી સરકારે કમીશન નીમ્યાં પણ તે કમીશનો મલ્હારરાવને પૂર્ણપણે દ્વારા પદ્ધતિ ન હેઠળ શક્યાં. છતાં હિંદી સરકારે ભીજીં અનેક કારણોને લઈ મલ્હારરાવને પદ્ધતિ ન હેઠળ કર્યા. ને

મહારાણી જમનાભાઈએ શ્રીમન્ત ખંડેરાવને મળેલો દટક લેવાનો અધિકાર પોતાને સુપ્રતી કરવાની માગણી કરતાં સરકારે તેમને તેમ કરવાની, અમુક શરતોએ છુટ આપી. એ શરતેમાંની સુખ્ય એ કે ચૂંટાયલ દટક એવી સરીર વયનો હોવો જોઈએ કે તેને અમુક વર્ષો સુધી જરૂરી ડેણવણી આપી શકાય ને તેની બાલ્યાવસ્થા દરમિયાન રાજ્યમાં ચિંહિત સુખ્યવસ્થા આણી શકાય.

ને મહારાણી જમનાભાઈ, જ્યાં ઉક્ત શરત સચવાય, જેના પર પોતાની ઈંચા અને વાત્સલ્ય ઢોળાય, જેનામાં શુદ્ધભ્ય તેજરિસત્તા જળકી રહી હોય અને જે ગાયકવાડ કુંઘમાં નરણીરનો શુદ્ધ અને આશાસપદ વંશજ હોય એવા દટકને ખાળી કાટવાની જરૂરિયાતમાં મૂકાયાં. ને એ બધી ગણુતરી જ્યાં સંતોષાય એવો એક બાલકુમાર તેમને મળી પણ આવ્યો.

* * *

ગાયકવાડ કુલભૂષણ દામાજુરાવને પ્રતાપરાવ નામે એક તેજસ્વી ભાઈ હતો. તે ભાઈની ચોથી પેઢીએ કાશીરાવ અને ઉખાજુરાવ નામે એ ભાઈ થયા. ગાયકવાડ કુંઘમાં રાજપદ્યોઽય વારસ તરીકે, મહારાજાવ સિવાય, આ એ ભાઈ તથા તેમના કુમારોનું હૃદાતિ ધરાવતા હતા.

ઉક્ત અને ભાઈઓની સ્થિતિ સામાન્ય હતી. કાશીરાન આનદેશના કવાણાણું ગામમાં જેતીનો ધંધો કરતાં. ઉખાજું કંઈક સમપર્યી વડોહરામાં જઈ વરસ્યા હતા. કાશીરાવને આણુંદ, ગોપાળ ને સંપત્ત નામે નષ્ટ પુત્ર હતા; ઉખાજુને દાદા સાહેય નામે એક પુત્ર હતો.

મહારાણી જમનાભાઈએ ચો઱્ય દટક મેળવી લેવાને આ કુંઘ્ય પર નજર હોડાવી. તેમણે કવાણામાં તપાસ કરવાને રાજ્યહૃત ને ડેટલાડ સૈનિકો મોકલ્યા. તેમણે કાશીરાવને જોળા કાઢ્યા ને તેમને અને તેમના કુંઘને રાજ્યવંશી તરીકે ચકાસી જોઈ ચો઱્ય સંતોષ મળતાં તેઓ કાશીરાવને તેમના ત્રણે પુત્રો સાથે નાશિકમાં કર્નાલ એન્થરિઝની સમક્ષ લઈ ગયા. ત્યાં તે ગોરા સાહેયે રાજ્યોરા પાસે ચો઱્ય તપાસ કરાવરાણી તેમની રાજ્યવંશિયતાની આત્મ મળતાં તેમને વડોહરામાં મહારાણી જમનાભાઈ પાસે મોકલાયા.

કાશીરાવ ને ઉખાજું તો મોટી વયના હતા. એટલે કાશીરાવના ત્રણે પુત્રો ને ઉખાજુના પુત્ર દાદાસાહેય—એ ચારમાંથીજ એકની પણણીનો સવાલ હતો. મહારાણીએ ચારેને ચકાસ્યા. તેમાંથી વધુ, તેજ, લક્ષ્મણ અને સ્વભાવ જેતાં તેમની નજર કાશીરાવના વચેટ પુત્ર ગોપાલ પર હરી. તેમણે તે કુમારને દટક તરીકે ચૂંટી કાઢ્યો. અને અંગ્રેજ સરકારે તેમની એ ચૂંટણીને સંમતિ આપતાં કુમાર ગોપાલ, તેર વર્ષની વધે, સયાજુરાવ નીજ તરીકે વડોહરાના ગાદીપતિ બન્યા.

કુમાર ગોપાલને જન્મ ૧૮૭૩ ના માર્ચની સતતરમીએ થયેલો. કુંઘની સામાન્ય સ્થિતિ છતાં બાલવયમાં પણ તેમનામાં અભ્ય અને રાજ્યોઽય મહેન્દ્રાઓ બિલ્લાતી. જેતીનો ધંધો છતાં તેમનું જીવન ડાઈ મહાન રાજ્યવંશી કુમારની જેમ વિકસનું હતું. મહારાણી જમનાભાઈએ જ્યારે કુમારોને, તેમને વડોહરે શા માટે બોલાવવામાં આવ્યા છે તે સંખ્યાએ પૂછેલું ત્યારે આં ગોપાલેજ એધડક જવાય આપેલો કે, “રાજ્ય કરવા.” મહારાણીએ જ્યારે જુદી જુદી ધાતુની વાડકીઓમાં ખીર પોરસેલી ત્યારે આ ગોપાલેજ તેમાંથી સોનાની વાડકી બાંદ્રી લઈ રાનેન્દ્રને ચો઱્ય અદાથી તે આરોગ્ય માંડેલો.

તેમનું ભાગ્ય પણ અપૂર્વ અને કંઈક અંશો ચ્યામતકારિકે હતું. બાર વર્ષની વધે તે તેમને માટે ગુજરાતની ગાદી વરી લાગ્યું એટલું જ નહિ, તેણે એજ વધમાં તેમનામાં સંસ્કારનું કંઈક એવું માધુર્ય સિંગેલું અને ઐશ્વર્યની કંઈક એવી રેખાઓ આંકલી કે તેમની સ્થિતિમાં બેછાલેલો ભાગક નયાં જતાં પણ સોદ્ગાય અતુભવે તે સ્થળના એક માત્ર અધિષ્ઠાતા તરીકે પણ તે શોલી બઢ્યા. ગાદીએ એસતાં તરતજ તેમણે વડોદરાના પ્રત્યેક દેવમહિરનાં દર્શન કર્યો, અનેક સંન્યાસીઓના આશિર્વાદ લીધા.

ગાદીપતિ તરીકે તે નાની વધના હેઠાં તેમની સત્તા રાજમાતા જમનાખાઈ, દિવાન સર દી. માધવરાવ ને વડી સરકારના પ્રતિનિધિને હસ્તક રહેતી. રાજમાતાનું તેમના પર અપૂર્વ વહાલ વરસતું. તેમની પ્રાથમિક ડેળવણીની જવાબદારી શરૂઆતમાં એ વિદ્ધાન પદિતોને હસ્તક સૌંપવામાં આવી. મહારાજાએ તેમની સમક્ષ સરસ્વતીહેવીના સવિધ પૂજન પછી શિક્ષણનું મેગલાચણું કર્યું. તેમના ભાગ્ય સંપત્રાવ અને કાકાપુત્ર દાદાસાહેબ પણ તેમની સાથે એ અભ્યાસ કરતા થયા.

શ્રીમન્તના શિક્ષણની શરૂઆતમાં બિટનના યુવરાજ અને અવિષ્યના સભાટ સાતમા એપૂર્વ હિંદનાં દર્શને આવ્યા. તેમને સન્માતવાને મહારાજને રસાલા સાથે મુંબદ્ધ જવાનું થયું. ત્યાં તેઓ યુવરાજને સત્કારવાને મુંબદ્ધ જઈ પહોંચેલ વાધુસર્દાય નોર્થયુક સાથે સંસર્ગમાં આવ્યા અને યુવરાજ મુંબદ્ધને બારે બેતરતાં તેમની સાથે પણ મુલાકાત થાય. એ સમયે યુવરાજને આકસ્મિક વડોદરા આવવાનું નિશ્ચિત થતાં મહારાજ રાજમાતા, દિવાન અને રસાલા સાથે તરતજ વડોદરા પાછા કર્યા. અને મહારાણ્ટ્રોય સાભાન્યના વંશને અને ગાયકવાડના પાઠનગરે બિટનના યુવરાજનાં અપૂર્વ સન્માન માટે તૈયારીએ કરવા માંડી.

યુવરાજ વડોદરા આવતાં તેમને એક લંબ હાથી પર સેનાની ચંચાડીમાં એસાડી વડોદરાના રાજમાર્ગ પર સરધસના આકારમાં ફેરવવામાં આવ્યા. મહારાજાએ તેમની મધુર મહેમાનગીરી સાચવી. યુવરાજે વડોદરાના નિવાસ દરમિયાન એક વિરાસ ચિત્તાનો શિકાર કર્યો; અને મહારાજ ઉચ્ચ અને વિજયી શિક્ષણ વરી પોતાના સંસ્થાનમાં સાર્વનિક સુધારા કરવામાં આય્યાશાળી નીવડે એવી તેમણે મહદૂ આરા પ્રદર્શિત કરી. રાજમાતા જમનાખાઈએ યુવરાજને પોતાના જવેરાખાનામાંથી એક રત્નજડિત મોતીનો હાર ને એક જડાવકડો બેટ ધર્યો. અને એ રીતે અરસ્પરસની મુલાકાતો દ્વારા મધુર ચંચંધ સ્થાપી ના. યુવરાજ મુંબદ્ધ પાછા કર્યા.

વડોદરાના રેસીડેન્ટ સર રોચર્ડ રોડ અને મુંબદ્ધસરકારને શ્રીમન્તની ડેળવણીમાં ખાસ રસ પડતો. ને ના. યુવરાજને પણ એ વિષયમાં એટલો જ રસ દાખવતા બોછ મહારાજના શિક્ષણને વધારે કાર્યસાધક બનાવવા એક તેજસ્વી યુરોપિયન શિક્ષકની જરૂરિયાત બેલી થાય. પરિણ્યામે ના. રેસીડેન્ટની ચેજના અને લાલામણુથી રલાગિરિના એક વખતના આસી. કલેક્ટર મી. છલિયટની મહારાજના શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી.

મી. છલિયટ મહારાજની ડેળવણીની પ્રેરણ સાચવી લીધી. તેમાં તેમણે એક એવું નવતેજ પૂર્યું કે જે તેજ શ્રીમન્તની કીર્તિવન્ત ભાવિ કારકિર્દિનું મૂળ થન્યું. મહારાજના મન પર તેમણે કયું સ્થાન તેમને શી રીતે શોભાવવાનું છે તેની સતત છાપ પાડ્યા કરી.

૫૪૪ .. સુવાસ : ફાલગુન ૧૯૬૫

રાજમાતાને દાક પુત્ર પર સાચા પુત્ર જેટલુંજ વહાલ છતાં તેઓ કદી તેમની ડેળવણીની આડે ન આવ્યાં. દિવાન સર ટી. માધવરાવે રાજયની અધી જવાભદ્રારી પોતે સંભાળી લીધી એટલુંજ નહિ—મહારાજને વિરોધમાં તેમણે કેટલુંક રાજકોય રાન પણ આપ્યું.

આ રીતે શ્રીમન્તનું શિક્ષણ અનેકવિધ વિધ્યોમાં વિકસવા લાગ્યું. રાજનીતિ, ધર્તિ-હાસ, સાહિત્ય, રમતગમત, ધોઢેસ્વારી વગેરેમાં તે યોગ્ય રીતે અળકતા થયા. રાજ્યકારોભારનું તેમને તરિત રાન આપવાને ભારતના નામાંકિત અને રાજનીતિન પુરુષોનાં સેકડો ભાષણોની હારમાળા ગોઠવવામાં આવી. એ સર્વ ભાષણોમાં સર ટી. માધવરાવે સુભ્યવસ્થિત કરોભાર સંખ્યાની આપેલાં ભાષણો ખૂબજ કિમતી લેખાયાં છે.

એ અભ્યાસક્રમ પૂરો થયા પહેલાંજ શ્રીમન્તને, ૧૮૭૭ના દિલ્હી-દરભાર પ્રસંગે, ‘કૃજનહે ખાસ હૌલતે ઈચ્છિકિશિયા’—નો ધર્ટકાય ભક્ષવામાં આવ્યો.

સત્તાર વર્ષની વયે, રાજભગિની તારાખાઈના લગ્ન પછી તરતજ, તેમનું લગ્ન કરવામાં આય્યું. તે લગ્નમાં દેશપરદેશના નામાંકિત મહેમાનોએ હાજરી આપેલી, અને રાજમાતાના વાત્સલ્યપૂર્ણ ઉત્સાહથી તે લગ્નની ધામધૂમ એક અપૂર્વ ઉત્સવરૂપ બની ગયેલી. મહારાજનાં પત્ની લક્ષ્મીખાઈ તાંબેર રાજ્યના કુંઠાંથી વિખ્યાત મોહિતે વંશનાં કુંવરી હતાં. લગ્ન પછી તેમનું નામ ચિમનાખાઈ રખાયેલું. મહારાજને એ લગ્ન ખૂબ સુખદ નીવડેલું.

ઉકા લગ્નપ્રસંગે જ આજના વિખ્યાત લક્ષ્મીવિલાસ મહેલનો પાયો નંખાયો. દશ વર્ષની મુહત અને પચાસેક લાખના ખરે તે મહેલ તૈયાર થયેલો. તેની ખાંધણી ઘન્ડો—સારાસન પદ્ધતિની છે અને હિંદના કોઈપણ રાજમહેલ કરતાં તે વધુ ક્રેષ્ટ ગળ્યાય છે.

લગ્ન પછી તરતજ મહારાજના હાથમાં રાજ્યની લગામ સુપ્રત થવી જોઈએ એવી ભાવના જન્મી. મહારાજનું શિક્ષણ પણ એ સમયે ખૂંડું થવા આગ્યાં હતું. પરીણુંમે રાજમાતા અને દિવાનના પ્રયાસથી એ વાત વડી સરકારના કાને નામાઈ. અને ૧૮૮૧ ના ડીસેમ્બરમાં, ખિટનની સરકારની સંમિતિથી, મહારાજને સર્વ સત્તા સુપ્રત કરવામાં આવી. ઉકા પ્રસંગે મહારાજને કરેલું ભાષણું ખૂબજ આશાસ્પદ અને પ્રજાપ્રેમ ભર્યું હતું.

મહારાજને આ રીતે રાજ્ય સંભાળી લેતાંજ તેમના દિવાન અને ગુરુ સર ટી. માધવરાવ પોતાના હોદાનું રાજ્યનાસું આપી પોતાને વતન ચાલ્યા ગયા. મહારાજને તેમના સ્થાને કાળ શાહુદુદીનની નીમણૂક કરી.

રાજ્યની લગામ હાથમાં લીધા પછી તરતજ મહારાજને શિક્ષણ સાથે ડેળવાયેલી તેમની ઉદ્દાત અને સુધારક ભાવનાઓને મૂર્તિ સ્વરૂપ આપવા માંડ્યું. તેમણે મંજનરાપદ્ધતિ બંધ કરી રૈયતવારી પદ્ધતિ અપનાવી, જકાત અને જેઝૂતો પરનો કર કંઈક અંશે કર્મી કર્યો, નવનવાં ખાતાંએ જોલી તેના ઉપરી તરીક નવા અમલદારો નીમવા માંડ્યા. રાજ્ય તરફથી થતા દાનમાં ખૂબ ધરાડો કરી નાંખવામાં આવ્યો. રૈલ્વેની નાની સડકો બંધાવા લાગ્યો, ને સ્થળે સ્થળે નિશાળો ને વાંચનાલયો ખૂલવા લાગ્યાં.

ધ. સ. ૧૮૮૩ ના ઓગસ્ટમાં મહારાણી ચિમનાખાઈએ યુવરાજ-પુત્રને જન્મ આપ્યો. વડોદરાએ અવિષ્યના એ મહાન યુવરાજ-શ્રીમાન હેતેખસિંહરાવનો જન્મ જન્મેત્સવ બન્યા. તે પછી ખીજ વર્ષે મહારાણીએ એક કન્યારતને જન્મ આપ્યો. પણ એ અરસામાં

ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજુરાવ .. ૫૪૪

એમની તથિયત ક્ષયરોગના પરિણામે વધારે લથડી. અને એજ વર્ષમાં તેઓ અવસાન પામ્યાં. તેમનો પ્રેમ, પ્રભાવ અને વિરલ ખોત્વ વડોદરાના રાજવંશની કૃતિને પણ વધારે ઉજ્જવળ અનાવે એવાં હતાં. તેમની સ્મૃતિને કાયમ રાખવા વડોદરાના ટાવર અને ન્યાય-મંહિર સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે.

ઉકા મહારાણીના અવસાન પછી બીજે વર્ષે શ્રીમન્તે દેવાસનાં રાજકુંવરી ગણરાખાઈ સાથે લઘુ કર્યું. લઘુ પછી એ મહારાણીને પણ ચિમનાખાઈનું જ નામ અપાયું. તેઓ મહારાજનાં અન્ત સુધીનાં સાથી તરીકે હૃયાત છે. ૧૮૬૪માં મહારાણી વિકોરિયાએ તેમને 'કાઉન ઓઝ ઈન્દીયા' નો છલકાય આપ્યો.

આ સ્થિતિમાં શ્રીમન્તે વડોદરાના મધ્યરથ તત્ત્વે અલ્પ સમયમાં સુલ્યવસ્થિત કર્યું. તે પછી તેઓ રાજ્યમાં પર્યાટને નીકલ્યા. તેમણે બળદગાડીમાં ગામડે ગ્રામડે પ્રવાસ કર્યો ને સામાન્ય પ્રજનાના પણ તેઓ સંસ્રંખ્યમાં આવ્યા. પોતાના રસાલાથી ગ્રામજનોને કન્ડગત ન થઈ પડે એ ખાતર તેઓ. પોતાની સાથે માણસો પણ ખૂલ્ય ઓછા રાખતા.

પ્રજને શિક્ષણ અને સુધારાને માર્ગે વાળવાની મહારાજની ઉત્કટ ઈચ્છા ડેવનાયલી. તેને સિદ્ધ કરવા તેમણે ધીમે ધીમે શક્ય ઉપાય અજમાવવા માંડ્યા. તું થી ૧૨ વર્ષની ઉભ્મરના છોકરાએ. અને તું થી ૧૦ વર્ષની ઉભ્મરની છોકરાએ. માટે આખા રાજ્યમાં તેમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અનાવ્યું. અંતને અને બીજી સામાન્ય ઢારો પણ એ શિક્ષણનો પૂરતો લાભ ઉડાવી શકે એવી તેમણે વ્યવસ્થા કરી.

માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે પણ તેમણે એવાં સુંદર પગલાં કીધાં. તે માટે જરૂરી સ્થળોએ તેમણે માધ્યમિક શાળાએ. કે હાથર્ડુલેસ સ્થાપવા માંડી. ઉચ્ચ શિક્ષણ માટે વડોદરામાં કોલેજ પોલી તેને નામાંકિત અનાવવા તેમણે અગીરથ પ્રયાસ આદર્યો. તેમની આ શિક્ષણહેઠાં અને પ્રગતિ છેવટ સુધી ચાલુ રહી. અને વડોદરાનું કલાકબન તેમજ વડોદરા અને રાજ્યનાં બીજાં અગત્યનાં સ્થળોએ આવેલાં સંસ્કૃત કે આયુર્વેદને લગતાં મહાવિદ્યાલયો એ વિષયની અનેકવિધિતાના સ્થાયક નમુના છે.

પોતાને દરેક વિષયથી માહિતગાર રાખવાને અને તે તે વિષયમાં સલાહ આપવાને તેમણે ખાતાવાર અધિકારીએનું એક સલાહકારક-મંડળ નીમયું. ૧૬૦૪ તેમણે મુંબઈ ધારા-સભાની દ્વેષે પોતાના રાજ્ય માટે પણ એક ધારાસભાની ચોજના ઘડી કાઢી ને તેને તરત અમલમાં મુકી એ સભાને વિસ્તૃત પાયા પર ચાવવા માંડી.

ગાદીએ આવીને મહારાજાએ તરત ન્યાયશુદ્ધ માટે પ્રયાસો આદરેલા. તે માટે તેમણે કાયદાએને શુદ્ધ અને નવીન સ્વરૂપ આપ્યું, એક બધ્ય ન્યાયસભાની સ્થાપના કરી. ૧૬૦૪ માં તેમણે ન્યાય અને કારોઅંદી અને ખાતાં પૂર્ણપણે અલગ કરી નાખ્યાં. લોડ મિન્ટોએ ન્યાયની ચાલી સુંદર અને આર્કષક વ્યવસ્થા માટે તેમને ધન્યવાહ આપ્યો.

લોડાના જનમાલને ચોગ્ય રક્ષણ મળે તે ખાતર પોલીસ ખાતાની નવીન વ્યવસ્થા કરવામાં આવી. પ્રજને પૂરતી વૈકુણ્ઠ સગવડતા આપવાને ડેર ડેર સુંદર દ્વાખાનાં પોલવામાં આવ્યાં. ૧૬૦૨ માં રાજ્યવસ્થાનાં જુનાં સ્વરૂપો સાથે નવીનનું મિશ્રણ કરી આખ્યાંયાં પતોની સ્થાપના કરવામાં આવી. અને તે પછી તરતજ મોટાં શહેરોને મુનિસિપલ-સ્થાનિક સ્પરાન્યને લગતા હક્ક આપવામાં આવ્યા.

આ એ આભા પછો તરતજ મહારાજના મનમાં શહેરની પાણીની મુશ્કેલી હું કરવાની વના જન્મેલી. તે માટે તેમણે એક લખ સરોવર અંધાવાતી ચોજના વિચારી. પણ તે એ ધમાં યુરોપિયન ધ્રજનેરાની આંકણી નાપસંદ પડતાં વડોદરાનાજ એક ધ્રજનેર શ્રી જગન્નાથ સદાશીવાની ચોજનાનુસાર, વડોદરાથી તેર માછલ હું પૂણી નદીના પંખ પર, ચોતીશ લાખના ખરે, સયાજી સરોવર અંધવામાં આવ્યું. આને તે સરોવર વડોદરા શહેર અને ડેર્પનું પાણી પૂરું પાડે છે.

આ અરસામાં મહારાજને પરહેશપ્રવાસ કરેલો. તે પ્રસંગે લંડનમાં મહારાણી વિક્ટોરિયાએ તેમને, વીડિસર મહેલમાં દરાર લરી, જી. સી. એસ. આઈ. નો ધ્રિકાશ આપ્યો.

ઓળ એક પ્રવાસ દરમયાન અમેરિકામાં મહારાજને ટેર ટેર રમણીય વાચનાલયો નિહાલ્યાં. તે જોઈ પોતાના રાજ્યમાં પણ એવી વ્યવસ્થા કરવાની તેમનામાં મહેલા જન્મી. તે માટે તેમો ઢા. બાઈનને પોતાની સાથે લાયા. તેમણે વડોદરા રાજ્યમાં એ રીતે પુસ્તકાલયો સ્થાપવાની ચોજના વિચારી. પરિણામે વડોદરામાં એ વિષયને લગતી મધ્યરથ સંસ્થા ખોલ્ખામાં આવી. મહારાજને પોતાના અંગત પુસ્તકાલયનાં વીશ ફાનર પુસ્તકો એ સંસ્થાને અર્પણ કર્યો. ને એ રીતે વડોદરાના મધ્યખર્તી (સેન્દ્રલ) પુસ્તકાલયનો જન્મ થયો. આને એ લખ પુસ્તકાલય ઉપરાંત રાજ્યમાં ચૌદશો જેટલાં વાચનાલયો હરિત ધરાવે છે.

મહારાજનો સ્વહેશગ્રેમ અને આર્થ સંકૃતિ પ્રતિનો બાન પણ ઝીર્તિવર્ધક હતો. હિંદી ભાષાને રાંધ્રીય તરીકે તેમણે જ પ્રથમ અપનાતી છે. ગમે તેવાં અટપટાં અંગ્રેજ નામોને પણ તે સ્વભાવામાં ડિતરાવતા. પ્રાચીન સાહિત્યનો ધીમે ધીમે લોપ થતો હોઈ તેના રક્ષણ ને સંશોધન માટે તેમણે પ્રાચ્ય વિદ્યામંદિરની સ્થાપના કરી. પ્રાચીન અવશેષોની શીધખોળ ને જળવણી માટે તેમણે સંશોધનાતું પણ સ્થાપ્ય. પ્રાચીન ગુજરાતી કાવ્યમાળાને ઉતેજન આપવા ઉપરાંત નવા સાહિત્યલેખન માટે તેમણે સયાજીઅન્યમાળાની શરૂઆત કરી.

૧૯૬૬ના દુષ્કાળમાં જેઠોતાની બેહાલ સ્વિધતિ પ્રતિ શ્રીમન્તતું ધ્યાન દોરાયેલું. ત્યારથી તેમણે જેઠોતાના સુખ માટે સતત અમ આદર્યો. જેઠોતાને મહેસૂલમાં રાહત, ધીરધાર કરનારા-આની લુંટમાંથી તેમને છોડાવવા કાયદાનું રક્ષણ-વગેરે દ્વારા તેમણે પ્રગનના તે પ્રથમ વર્ણને સ્વિધત અને સુખી બનાવવા ભાવના સેવી છે; તેમના વિકાસ માટે તેમણે પાથાત્ય હૈ, પ્રદર્શનો ને બાધણોની પણ વ્યવસ્થા કરેલી. જીવનની છેલ્લી કષણ સુધી જેઠોતો પ્રતિનો તેમનો એ પ્રેમ કાયમ રહેલ. સ્વર્ગવાસના ચોડાક જ દિવસ પહેલાં તેમણે મહેસૂલમાં સવાએકવીશ લાખનો ધરાડો કરેલો.

સમાજસુધારક તરીકે તો તેઓ અનોડ હતા. પરહેશગમનમાં નડતી મુશ્કેલીઓનો તેમણે બહાદુરીપૂર્વક સામનો કરેલો. સામાજિક કે ધાર્મિક સુધારણાને લગતા જે કાયદાઓ કરતાં ખિટિશ સરકાર પણ આંચડો આતી તે કાયદાઓ આ મહાન સુધારક સહેલાઈથી ખડી શકતા-એ વિષયમાં તો વડોદરાની ધારાસભા પણ વડીધારાસભાની અધોગભૂમિ ગર્થી રાકાય. બાળકમ-પ્રતિબધ, ધર્મસ્વાતંન્ય, સીનીલ મેરેજ-એકટ, આંતરકોનીય કે આંતરનાતીય ક્ષમણ્ટ, વિધવાપુનર્વર્ગ, છૂટાછેનો કાયદા, લરિજન મંદિર-પ્રવેશ, સગોત-લમ, ઓવારસા ૬૫, સંન્યાસિકાપ્રતિબધક નિયમન-જેમાંના કટલાક કાયદાઓ હિંદી સરકાર હજ સુધી પણ નથી કરી શકી તે, લાક્ષ્મિયિક રીતે ડેળવાયેલ મહારાજને વર્ષોથી અમલમાં મૂકેલા છે.

મહારાજાનું કૌદુર્યિક જીવન સહૈ સુખી નથી નીવડ્યું. ગાદીએ આભા પણી તરતજ

ગાયકવાડ નરેશ શ્રીમન્ત સચાળશબ .. ૫૪૭

તેમના પિતાશ્રી અવસાન પામ્યા. તે પછી મહારાણી વિમનાખાઈનું અવસાન. યુવરાજ ઇસેહસિહરાવ પર તેમણે મહદું આશા સેવેલી. તે કુમારને પોતાથી પણ અધિક બનાવવાની તેમની આવના હતી. ને એ વીર કુમારે એવી તેજસ્વિતા દાખવી પણ અરી; પણ એ મહાન યુવરાજ યુવાન વયે જ અવસાન પામ્યા. તે જ સમયથી મહારાજના થનગનતા તેજસ્વી હૈયા પર જણે તિમિરનો પટ પથરાઈ ગયો. તે પછી તો તેમણે રાજમાતા, લગ્નિની તારા રાને, ભાઈઓ, નવાં મહારાણીના એ કુંવર, એક પુત્રવધુ, એક જમાઈ વરેરને પોતાની આંખ આગળ જ અદશ્ય થતાં નોયાં. છતાં એક મહાન વીર તરીકે મહારાજાએ આ બધું હુઃખ સહી લીધું. ને સ્વ. યુવરાજ ઇસેહસિહરાવના પુત્ર શ્રીમન્ત પ્રતાપસિહરાવને તેમણે યુવરાજ તરીકે ડેળવણી આપવા માંડી.

વડી સરકાર સાથેનો શ્રીમન્તનો ઘંણંધ મીડો હતો. છતાં ડેટલીક વખત સ્વમાનની ભાવનાના કારણે એ સરકાર સાથે તેમને અથડામણમાં આવતું પડેલું. બાપટ-કેસ પ્રસ્ને કમીશનની સખત શિક્ષાની લલામણોનો અરનીકાર કરી તેમણે આરોપીને નિર્દોષ ઠરાની છોડી મૂકેલો. ત્યારે હિંદી સરકારની તેમના પર અફામરળ ભતરેલી. હિંદી સીનીલ-સર્વોસે યુક્તિથી દૂર રાખેલા અરવિંદ ધોષને તે વિલાયતથી પોતાની સાથે લેતા આવ્યા અને અવિષ્યની તે મહા-વિલૂતિની રાષ્ટ્રીય પ્રવૃત્તિએ. ન્યારે વડોદરામાંથી પ્રકાશના માંડી ત્યારે સરકારને ફરી ચીમકી લાગી. પેંડ્યા-પ્રકરણમાં પણ કંઈક એવું જ બન્યું. હિંદી-દરખાર પ્રસ્ને સાંનારી મેરીને સલામ ભરવી ભૂલી જગતાં ચિન્તનમાં પણ જાહાપોહ નાગેલો. આંતરિક વહીવટમાં માયું મારવાના રેસિડન્ટના પ્રયાસોને તો તેઓ મૂળમાંથી જ નિષ્ઠળ કરી નાંખતા. લોડ કર્ઝને તેમના પર મૂકેલ ડેટલાક પ્રતિઘંધનો પણ તેમણે સફળતાપૂર્વક સામનો કરેલો. એક સમગ્રે તો એક પત્રમાં તેમણે જણાવી દીધેલું કે, “અમને કહેવામાં તો રાજએ આવે છે પણ વડી સરકારના પ્રતિનિધિગોનો અમારી સાથેનો વર્તાવ એક નોકર કરતાં પણ ખરાય હોય છે. અમારી સાથે કરવામાં આવેલા કરારોની કરી કિંમત નથી લેખાતી.”

ભીજ હિંદી રાનગો, પરહેશના નામાંકિત વીરા અને હિંદના પ્રજનકીય આગેવાનો કે પ્રતિષ્ઠિત ઘંસ્થાએ. સાથે મહારાજ મીડો ઘંણંધ ધરાવતા. ૧૮૬૨માં તેમણે ઈજલાંના નામાંકિત વડા વળુર ગ્લેડસ્ટન, ૧૯૦૫માં પ્રેરિન્ન-ઇઝેલ્ટ, ૧૯૧૦ માં જાપાનપતિ મીકાડો, ૧૯૩૪ માં ના. પોપ ને ૧૯૩૬ માં હર હિટલર-ની મુલાકાત લીધેલી. ઓલિમ્પિક્સ રમતગમતોના પ્રયોગે હિટલરે સામા આવીને મહારાજનો સત્કાર કરેલો. બનારસ-હિંદુ યુનીવર્સિટીના તેઓ ચાન્સેલર હતા. અને બનારસ તથા લંડન યુનીવર્સિટી તરફથી તેમને એલ. ડી. ની ડીઓ આપાયેલો.

દાનેશ્વરી તરીકે પણ તેઓ નામાંકિત છે. જીવનકાળ દરમિયાન તેમણે એ કરોડ લગ-ભગનું દાન કર્યું છે. તેમાંથી એક કરોડ તો તેમણે હીરકમહેત્સવ પ્રસ્ને આગ્યોદ્ધારની યોજનાની સિદ્ધ અર્થેજ અર્પેલા; બાકીના દાનનો મોટો ભાગ તેમણે શિક્ષણ, સાહિત્ય ને સંસ્કૃતિના વિકાસ અર્થે વાપરેલો.

રાજ્યાલિષેકનો-રૌષ્ય કે સુવર્ણ-મહેત્સવ તો ડેટલાક રાજવીઓએ માણ્યો હશે. પણ હીરકમહેત્સવ પણ નજરે જોનાર ગાદીપતિ તરીકે તો મહારાણી વિકટોરિયાથી ભીજે નાયર એમનોજ આવે. તેમના હીરક-મહેત્સવની ઉજવણી પણ અપૂર્વ અનેલી. તે પ્રયોગે ના. શહેનશાહ, હિંદી વળુર, ના. વાર્ધસરાય અને જગતના ભીજ અનેક નામાંકિત પુરષરતનોએ તેમને અલિનંહન આપેલાં.

હિંદની શરીરિક નિર્ણયાત્મા તેમને ખૂબ ખૂચતી. તે હુર કરવા તેમણે વ્યાયામસેસ્થાયોને મોકળે હાથે ઉત્તેજન આપેલું. રાજ્યના પ્રત્યેક વિલાગમાં એવી સંસ્થાઓને તેમણે વિકાસ વાછેલો. છેલ્લા ડેટલાક સમયથી વડોદરા-કાલેજમાં પણ તેમણે લશ્કરી તાલિમ ફરજિયાત કરેલી. પ્રજને રાજીનીતિનું જ્ઞાન આપવાને પણ તે ખૂબ ઉત્સુક હતા. તે માટે તેમણે એક અભ્યાસપૂર્ણ અન્ય તૈયાર કરાવરવેલો.

પછાત ડામો પ્રતિ પણ તેમને મધુર અને સક્રિય પ્રેમ હતો. મ. ગાંધીજીની હરિજન ચળવણ તો થાડાંક વર્ષથીજ રાજ્ય થઈ છે, પણ શ્રીમન્ને તો હિંદના અન્ય ભાગોમાં અત્યજીવે ને રથાને હજી સુધી નથી મળ્યું તે વર્ષો પર અક્ષી દીધેલું.

પાંસઢ વર્ષના દીર્ઘ રાજકાળ દરમિયાન તે પ્રજના એકનિઃધ શાસક અને પ્રેમાળ પિતા તરીકે રહ્યા છે. છેલ્લાં ડેટલાક વર્ષથી તેમનો મુખ્ય વસવાટ જે એક અનેક કારણોના અંગે પરદેશમાં રહેતો છતાં તે દરમિયાન તેઓ પ્રજને વીસરી ગયા છે એમ તો નજ ગણ્યાય. તેમણે પચીશ વખત પરદેશની મુસાફરી કરી છે પણ હર વખતે પ્રજાપ્રભ તો પોતાના હૈયેજ રાખ્યો છે. જગતર્થમ-પરિપદ્ધની ઉદ્ઘાટનક્રિયા પ્રસંગે તેમણે રાજ્યના એકારોનો સવાલ હાથ ધરેલો; હર હોટલરની સુલાકાત પ્રસંગે પોતાના રાજ્યમાં પણ લશ્કરી તાલિમની જરૂરિયાત રસીકારેલી.

વડોદરાની આજની રૈનક એ મહાન રાજીવીને આભારી છે. પાટનગરની અદ્ધી શોભા તો તેનાં સરકારી કે નાહેર-ભવનોને લાઘે છે અને તેમાંના લગભગ દરેક સ્વ. શ્રીમન્તના હુસ્તેજ બંધાયાં છે. ક્રીતિમંહિર, મુદ્રાશાહી, ડાલેજ, કલાભવન, લાયચેરી, લક્ષ્મીવિકાસ મહેલ, અંડેરાવ માર્કીટ, ન્યાયમંહિર વગેરે અભ્ય દ્ધમારતો તેમના પ્રયાસને આભારી છે.

શ્રીમન્તે કરેલી ડેટલીક નવરચનાઓ જે કે આર્થ-હિંદી સંસ્કૃતિને પ્રતિકૂળ છે પણ હિંદી પ્રજનનું આર્થિક આજે જે મહાવેગ તેની પુનિત સંસ્કૃતિ પર ધસી આવીને અને ગૂંગળાવી અને દાડી રહ્યો છે એ ગૂંગળામણુથી અચ્યવાને આરણાં જોલી નાખવામાં અને એ દાહમાં પણ સાન્ત્વન પામવાને અંગ પર હંકુ પાણી રેડવામાંજ પ્રકાશી શકે તેમ હોંઠ આ મહાન રાજીવીએ એ શંખધમાં લીધેલાં પગલાને અસ્થાને કહેનાં સુશ્કેલ છે.

સ્વતંત્ર હોય તો એક મહારાજ્ય તરીકે શોભા ભઠે એટલો અવકાશ: કોર્ટિવન્ત નૃપતિ, પચીશ લાખની પ્રજન, નણું ડરોડની આમદાની, તર તિનેરી, ને ૧૯૬૪ માર્ધિલનું ક્ષેત્રફળ-અમાં પ્રજાએ કંઈ દુઃખ બોગવ્ય હોય કે તે બોગવતી હોય તો તે એના રાજીવીને નહિ પણ એમના હાથ નેને હસ્તક હોય એને આભારી ગણ્યાં જોઈ એ.

ગ્રંન્સાઈકલોપીડિયા બિટાનિકા વડોદરા રાજ્યના વર્ણનપ્રસંગે શ્રીમન્તની કીર્તિ સંબંધમાં મૌન સેવે છે એટલું નહિ પણ વડોદરામાં કયાં કયાં ખાતાંએ યુરોપિયનોના નેતૃત્વ નીચે પોષાઈ રહ્યાં છે તેનેજ તે પ્રાધાન્ય આપે છે.

થાડાંક માસ પહેલાં પરદેશની છેલ્લી સફરેથી પાછા ફરતાં શ્રીમન્ત મુંબઈ બંદરે એકાગ્રે ગંભીર બિમારીમાં પટકાઈ પડ્યા. ને પૂરતી સારવાર છતાં એએક માસની માંદાંગી બોગવી તે સ્વર્ગવાસી અન્યા.

અવસાન પછી તરતજ તેમના શાયને ખાસ ટ્રેનમાં વડોદરામાં લાવવામાં આવેલું. ત્યાં થાડાંક સમય સુધી તે દર્શન માટે ખુલ્લાં રાખી ભીજે હિસે બેપોરે, પ્રજાપ્રેમનાં પ્રતીકિસમ વર્ષાં ફૂલોના ઉપહાર વચ્ચે, અભ્ય રાજવંશી માનપૂર્વક તેને પાલખીમાં નગરના

રાજમાર્ગો પર ફેર્વી, કીર્તિમહિસંસારાં વોગાનમાં, યંહનકાઉની ચિનામાં, પંચોતેર તેપોની સલામી સાથે અભિસંસ્કાર કરવામાં આવ્યો.

તેમના અવસાનથી ડેવળ વડોડા રાજયેન નાલિ, દિલ્લી પણ એક નરવીર સુધારક પુત્ર ગૂમાયો છે. દિલ્લી સરકારે આસ પરિકા દ્વારા તેમના અવસાનની દિવઃપીશીભરી નોંધ લાઘેલી. ના. શહેનશાહ, શહેનશાહાનુ, દિલ્લી વછર, ના. વાર્ષયદેશ, મ. ગાંધીજી, શ્રી. સુલાપ એઝ અને જગતની ભીજ પણ એનોક નામાંકા વડિનશોંગે તેમના અવસાન સંખ્યી દિવઃપીરી સાથે નવા મહારાજન પર દિવઃપાના વરેશ ગોકર્ણેના.

તેમનાં અસ્થિ લયારે જગાટમાં પદ્ધતાવાતે વર્ણ કરવામાં ચાંતલાં તરફે કેરકેર તે અસ્થિ પણ પુષ્પહારથી વધાતાયેના.

ભૂલો તો કેરલીક વણત
રાધ્રવિધાતાઓથી પણ થર્ન
નાય છે. પણ તેગરવી બુંદુ,
નિમણ ભાવના, અને દિગન્ત-
વ્યાપી કાર્તિં એ રાજભૂપણે
ગણ્યાં છે. શ્રીમન્ત નરેશ
એ સર્વ ભૂમણ્યાથી અંદૃત
નહોતા એમ કહેવાને ડાઈજ
તીવાર ન હોય.

તેમની પણ તેમના
યશરવી સિંહાસને આવનાર
શ્રીમન્ત પ્રતાપસિંહરાવને રવ.
શ્રીમન્તે પ્રત્યેક આતીનો અને
પ્રત્યેક વિષયનો અનુભવ અને
કૃળવણી આયાં છે. શ્રીમન્ત
પ્રતાપસિંહરાવે પણ ગાદીએ
આવ્યા પછી પ્રગણીય હંદે-
રામાં એદૂતોને રાહત આપ્યા
છે, રવ. પ્રતિના પૂઠને
પ્રેમલભાવને સ્મારકરૂપે જરૂર
દેવાને આનગી અળનામાંધી
એક કરોડ ઇપિયા જુહા તાર-
બા છે, ધારાસભાને વિસ્તૃત
અનાવી પ્રગને પ્રાથમિક
રાજકીય હઙ્ગો બદ્ધયા છે. આ રીતે તેઓ સર્વ પ્રગતિ રાખ્યાં, આવી પ્રગની સંચકૃતિક રક્ષણુની
ભાવતાને રહ્યોએ અને રાજયાસિંહે પ્રચંગે પ્રગનૈને વિશેષ ચુંદર રીતે સંક્ષિય અનાવી
તેઓ રવ. શ્રીમન્તથી પણ સવાર્હ કીર્તિં વરે એ આવના આજે પ્રત્યેક ગાયકવાડી
પ્રગણતના હેઠે જડાઈ છે.



[જાગૃતિ]

શેનાભારાંગેદા શસ્ત્રશરી પણાહુર વર્તમાન ગાયકવાડ

તરેશ શ્રીમન્ત પ્રતાપસિંહરાવ

રાજકીય હઙ્ગો બદ્ધયા છે. આ રીતે તેઓ સર્વ પ્રગતિ રાખ્યાં, આવી પ્રગની સંચકૃતિક રક્ષણુની
ભાવતાને રહ્યોએ અને રાજયાસિંહે પ્રચંગે પ્રગનૈને વિશેષ ચુંદર રીતે સંક્ષિય અનાવી
તેઓ રવ. શ્રીમન્તથી પણ સવાર્હ કીર્તિં વરે એ આવના આજે પ્રત્યેક ગાયકવાડી
પ્રગણતના હેઠે જડાઈ છે.

ચિત્રાંગદા : રસહશીલ

ભાલબંદ મહિલાદ પરીઅ

(ગતાંક પૃષ્ઠ ૪૮૧ થી ચાલુ)

૬

મહનના વરદાનથી ચિત્રાને અનુપમ દેહલાવણ્ય પ્રાપ્ત થયું એરે, પણ જ્યારે તે વતી પ્રિયમિત્રની મધુરજનીને અલિંગેક કરવાનું સુભગ પ્રલાન આવી પહોંચે છે ત્યારે તે હોઈક અગમ્ય ક્ષોલ અનુભવે છે. એકાએક તેના વિમલ ચિત્તાકાશમાં એક સંદેહરેખા ફ્રાન્ટ છે-જેને લઈ તેનું મન બ્યાંકુણ બને છે, હજુ અસ્વર્થના અનુભવે છે, અંતરમાં બધા જાણે છે. એકાજ ઉમકારમાં પૂર્વનો સંઘળો આનંદ અદરણ થાય છે. પ્રલાતપંખીના પ્રભુમણને જાગ્રત થતાં જેવી તેની નજર કિસ્સલયી અધરને હાસ્યકિરણે ગોપ્તા અર્જુનના સૌખ્ય વહન પર પડે છે કે તરતજ તેના મુખારવિદ પર હર્ષની એક આછી સિમતપ્રભા જળકી રહે છે. પણ હજુ તો એ પ્રલા તેના હૃદયમાં જીવરાતા રસોલ્લાસને સંપૂર્ણ પ્રગટાવી તેને સનાતન સૌખ્યરસિમત રૂપે તેની મુખમુદ્રાપર અંકિત કરી હે તે પહેલાં તો પેઢો સંકેદ વચ્ચે જોતાનો અંધારપડ્ડો નાખી હે છે, ને તત્કષ્ણ આનંદ અને ઉદ્ધ્વાસ—પ્રશ્નાર્થીના એ એ નૈમંગિક પ્રાદુર્ભાવ ત્યાથી વિહાય લે છે. તેમને સ્થાને વિધાદ અને ઔદાસિન્ય પોતાનું સાઓલાય જમાવે છે; અને એ માલતીમંડપ, એ નિદ્રાધીન પ્રિયતમ, એ ન્હાલી પ્રથ્યીમાત પર એક આછી ઉદ્ઘાસીની છાયા પાથરી હે છે. આસપાસની ભૂમિમાં ચિત્રાને જુનાં સંસ્કરણણે તાણે થાય છે. ચોતે પૂર્ણ શું હતી અને અત્યારે તેની શા દશા હતી તે સર્વ રમ્ભતિપદ પર જીવી તેના હજુદ્વારા ચિરસુધુમ ભાવો જગાવે છે ને તેના મનને ક્ષોભાયમાન કરી મુક્ત છે. એ પ્રિય વસ્તુધાના બાંધુપાસમાં, અર્જુનના સાનિધ્યમાં, થારીક કણો પૂર્વે તે અપૂર્વ સુખ અનુભવતી હતી તે જ વસ્તુધા પૂર્વરમણણના દર્શણ રૂપ અનતાં હવે તેને અકારી થઈ પડે છે. ને હોઈ પણ લક્ષ્ય વિના, બાલરવિના ડામબ-તેજસ્વી પ્રકાશમાં સુલાતા એ લાલિત લલામંડપ અને અંદર સુનેલા સુરસ્ય કાન્તનો સહસ્રા ત્યાગ કરી તે અરદ્ધયાના અંતઃપ્રક્રિયમાં દોડી જાય છે. આખો હિંસ તે હોડે છે-હોડ્યા જ કરે છે, આપરે એક એકાંત ખૂણો મળતાં ત્યાં સંતમ હજુને અવિરત રહનની અશુદ્ધાર્થમાં ઢાકવે છે. અભિજ્ઞ સુખની સંપ્રાતિ પણી તરતજ આવી દરણું હૃદયભૂયા શા કારણે હશે?

પ્રત્યેક પ્રસ્તુત ભીજ જાડે જાડે તેને સાંકળતા પુરોગામી પ્રસ્તુતા ગર્ભમાં જ રહેલું છે એ સત્ય તરફે જે પ્રસ્તુત વસ્તુરિથિત નિર્દેશવામાં આવે અને તેને અનુભક્ષીને, ચોતાની પરિસ્થિતિથી મહન અને વસન્તને વાડેક કરવા તેમની સમીપ ચિત્રાને કરેલા ઉક્ત પ્રસ્તુતા નિવેદનનું જો બાંધું અન-વેષણું કરવામાં આવે તો જણાઓ આવે કે તેની મનોવેદનાનો પ્રેરકહેતુ તેના આત્મવૃત્તાંતમાંથી જ એવી સ્ફ્રેદ ને મનોહારી ભાવમયતાથી વકલ થાય છે કે તેને ભીજે ક્ષાયાં શોધવા જરાની જરૂર રહેતી નથી. એ વૃત્તાંત અહીં પ્રગટ કરવાથી તેના હૃતુનો પાર મપાય એટલું જ નહિ પણ તેના પારિષુભિક ભાવિ અંતની ચાવી પણ તેમાંથી જ મળી રહે.

પ્રિયમિલન વિષે ચિત્રાનું પૂરોક્તા કથન સાંભળી, તેને સહેલી પ્રેમની અંતરભ્યથા વિષે દિલગીરી દર્શાવતાં અને પોતાના પ્રયત્નની નિષ્ઠળતા ઉચ્ચારતાં જ્યારે મદન કહે છે કે—
 ‘અદ્યસોસ ! એ માનવકન્યા ! દિલગંડારમાંથી મેં સ્વર્ગિય, સૌરભપૂર્ણ મહિરા છિપાડી તેમાંથી કિનારી સુધી ઘાલો ભરી પીવા સારી હાથમાં મૂક્યો, છતાં હજુએ આ વથાનું આદંદ સાંભળું છું ?...’

ત્યારે કાંઈક ચીડાઈ ને ચિત્રા ઉત્તર આપે છે:

‘કાણું એ ઘાલો પીધો ? જીવન-અલિકાણની વિરલતમ પરિપૂર્ણતા, પ્રેમનો પ્રયત્ન મંયોભ મને અર્પાયો, પણ હાથમાં આનતાવેંત તે ઝુંટની લેવાયો !’

આ પ્રેમનો ઘાલો શું મદને ઝુંટવી લીધો હતો ? અપૂર્વ સુખ અક્ષી તેણેજ શું તે પાછું લઈ લીધું હતું ? ના. ત્યારે તે કલ્યાણયોગમાં વિર્ધન નાખવાની ધૃતિતા કરનાર એ હોણું હતું ? ખીંણું ડાઢ નહિ, ખીંણું ડાઢ નહીં-પણ જેણે ચિત્રા પર આધિપત્ય જમાઓયું હતું તે સહેહરાણું ! ચિત્રાને એટલું તો અવસ્થ પ્રતીત યાય જ છે કે તેને મળેણું દેહલાવણ્ય ગમે તેટલું એન્જસ્ટ્યો હો, ગમે તેટલું વિકાસમાન હો,—આખરે તે પોતાનું તો નહોણું જ. અત્યારે પૌવનવસન્તમાં ખીલતી તેની પ્રેમસ્થાન અદ્ભુત અને સુમધુર હો, પણ તેનો વિશ્વાસ શો ? એક વર્ષનો સમય હતો ખરો, પરન્તુ એક યુગનો પણ નિખિલ સમય પણ જેને એંણો પડે એવા કાળમર્યાદાથી અતીત પ્રેમને મન એક વર્ષની શું કિમત ? એક દિન એવો જરૂર આવશે ન્યારે એ સૌનાર્ય ખરી પડતાં તેને આશ્રે વિકસલો પ્રેમ ધૂળમાં રંગદાળાઈ જશે. ત્યારે પોતાની શી સ્થિતિ ? આ વિચાર જ ચિત્રાને વિશ્વાસ કરી મૂકે છે. કેવી કરણું દર્શાબાં આણું જીવન વીતાવવું પડશે ? સૌનાર્ય જતાં એ જીવનમાં પ્રેમનું સ્થાન તો ક્યાંથી જ હશે ?

જે કે હજુ એક વર્ષની વાર છે, છતાં જેમ ડાઈ વરતુના ભયની અસર નીચે અન્ય નિર્દોષ એવી વસ્તુમાંય આનંદ માણુનો અશક્ય થઈ પડે છે તે જ પ્રેમાણે ચિત્રાને સંપૂર્ણ સુખનો યોગ છતાં ચેલા ભાવિલયદ્વારા રાહુની અસર તળે તેને તે બોગળી શકીતી નથી: તેના પોતાના શધ્યોમાં—

‘આ ઉછીનું સૌનાર્ય, મને વીટાનું આ અસર્ય, વધારે ખીલેલા પુણ્યમાંથી ખરી પડતી પાંખડીએ પેઠે એ મધુર સંગોગનો એક માત્ર રમ્ભતિરસ્થભ લઈ ને મારી પાસેથી સરકી પડશે અને એ ખ્રી પઢી તેના નગ્ન દારિદ્રયથી લાગતી રાતહિવસ રડતી બેસી રહેશે.....’

એ ભાવિ પ્રસંગની સંભવિતતામાંથી તાત્કાલિક ઉદ્ભાવતી અસરનું નીચેની પક્ષિભાં પ્રગટ દર્શન યાય છે:

ચિત્રા : ‘સ્વર્ગ મારા હાથની એટલું નજીક આંધું કે એક પળ તો હું ભૂલી અઈ કે તે મને પહેંચ્યું જ નહોણું. પણ સ્વર્ગમાંથી જગ્યાને મેં લેણું તો મારે શરીર મારે પોતાનું જ પ્રતિસર્વધી બની ગયું હતું.....’

આમ દેહ અને સૈંદર્ઘ્ય સહેલની ભૂમિકા પર વિભક્ત ભરાની જેણું તે સ્વતબની ભાવના લુંપે થઈ અને પરકીયતા પ્રગટી અને પરિષ્ઠુમે દેહ અને આત્માને અક્ષમ બંધને આંધીતી અંતરંગ એકતા અંડિત થઈ. ન્યારે દેહ આત્મા સાથે તદ્વાપ બની બહિર્ગતમાં તેનું વિશુદ્ધ પ્રતિભિંબ શીલે-ક્રેમ નિર્ભળ સરોવર સ્વચ્છ આકાશને તેના શાન્ત જગ્યામાં પ્રતિભિંબિત કરે-ત્યારે જ ચિરંજિવ સુખ કે શાંતિ સંભવી શકે. તેના અભાવમાં

૫૫૨ .. શુદ્ધાસ : ક્રાંતિક ૧૯૬૫

માનવી સંમતોલતા ગુમાવી હેમેશાં અસંતુષ્ટ, અવિજ્ઞાનત ખની રહે—એ જ સિદ્ધતિ ચિત્રાની છે. તેનું દુઃખ આદેખન ડેવું હદ્દભેદક બઠે છે!

ચિત્રા : ‘તેને (પોતાનાં અંગને) હેમેશાં શાણગારવાનું, પ્રિયતમ સમીપે મોકલવાનું અને તેના વડે તેને આલિંગાં નીરખવાનું કામ મને અકાંડ થઈ પડ્યું છે. ઓએ હેવ! તાંડ વરદાન પાણું લઈ લેને.’

કેવી અંદર વિલિમતા! હેઠ-આત્મા વચ્ચે આવી ભીષણ વિયુક્તાતા અનુભવનાર માટે જીવન એક સંઘામરૂપ થઈ પડે તેમાં શું આશ્રય! આ માનસિક વિયુક્તિ અને તેમાંથી ઉદ્ભલવતી વ્યત્રા ચિત્રામાં અકારણું નથી. ડોધારે આપેલ વરતુ પર છંદગીની મહેલાત રચવા એરસાએ તો બીજે જ હિવસે તેના પાયા હચ્ચમચ્ચી બઠે. જેને આપણે આપણી પોતાની બનાવવા ધર્યિછી હોધાઈ-ગમે તે વરતુ હો-તેને આપણે જીવનના નુરથી પ્રામે કરવી જોઈએ, અને ત્યારે જ તે ચિરસ્થાયી સુખ આપી શકે. ચિત્રાને અપ્રતિમ દેહલતા મળી પણ તે તેની આત્મવેતસાથે સંયુક્ત ન થઈ શકી-થઈ શકવાની પણ નથી. પારાવાર હદ્દયમંથન પછી ઉછીના સૈંકાર્યની અસારતા તેના અંતરમાં જડાઈ જય છે. એમ થાય છે કે વર્તમાન કરતાં તો પૂર્વે જ સિદ્ધતિ હતી તે જ વધુ સુંહર હતી. અને એક વીરાંગનાને છાંજે તેમ તે મહનને તેનું વરદાન પાણું લઈ લેવા પ્રાર્થે છે. પણ એ પ્રાર્થનાના સ્વીકારમાં સમાયેલી નિજ શાસનની નિષ્ઠાતાની મહનના ધ્યાન બહાર રહી શકતી નથી. એટલે વરતુસિદ્ધતિની બીજી આણુ દર્શાવતાં કુશળતાપૂર્વક તે ચિત્રાની હદ્દયવીષ્ણુના એક સંક્રમતારને ઝણુઝણું મૂકે છે—

મહનું : ‘પણ હું તારી પાસેથી તે લઈ લઈ તો પ્રિયતમ સમીપ તું ડેવી રીતે જીબી શકીશ? સુખનો પહેલો ધૂંટડો હજ એજે પૂરો પીધેની નથી એટલામાં એના એપ પરથી પ્યાદો બેંચી લેવો—એ નિર્દ્દ્ય નથી શું? કેવા રેષ્પૂર્ણ કોષ્ઠથી ત્યારે, તે તારા પ્રતિ જેશે?’

પણ આ યુક્તિપૂર્ણ શખ્દો એ વીરાંગનાને બોળની શકે તેમ નથી. અસત્ય કરતાં સત્યને તે વહાંથી લેણે છે અને પરિણામની લવલેશ પરવા કર્યા વગર પોતાના બાગ્યવિધાતા મદનહેવને રૂપણ સુણ્ણાવી હે છે—

‘આના કરતાં તો તે વહારે સુંહર હશે. આ હંબવેપ કરતાં વહારે ઉન્તત એવી મારી જતને હું તેની સમક્ષ પ્રગટ કરીશ. તેને તે પાછી ડેલશે-મને તિરસ્કારી મારા હદ્દયના ભાંગીને ભૂક્ષા કરશે તો તેથ હું શાંતિથી સહી લઈશ’


ને તેનાં નયનમાંથી ભારતકન્યાની મંગલ સર્મખ્યાલાવનાને પ્રસરાવતું, તેની વિશદ-દિવ્ય મહત્ત્વાને સ્ફુર્યતું કરુણ છતાં સામ્ય દીમિઅર્થી હઠીછું તેજ વર્ષે છે.

પણ મહનનો પ્રિય વયસ્ય વસન્ત મિત્રના સાઝાન્યને આમ એકાએક તૂઢી પડતું કેમ જોઈ શકે? પુષ્પધનવાના શૃંગારશાસનમાં પ્રકૃતિમાં માર્દવ પૂરી તેને હરેક રીતે સફળ બનાવવામાં જ તેના જીવનની કૃતકૃત્યતા. મિત્રની સત્તા ટકાવી તેને સમજ બનાવવા અને સાથે જ ચિત્રાને આદરસિમક આપત્તિમાંથી ઉગારી લેવા ને એક સ્વાભાવિક માર્ગ સૂચ્યે છે—

“મારી શિખામણ સાંભળ. શરહુના આગમન સાથે કુસુમજીતુ જ્યારે પૂર્ણ થાય છે ત્યાને ઇણજરતુનો વિજ્ય આવે છે. એની મેળે એક એવો સમય આવશે જ્યારે ત્યારે ત્યારે આત્મ-ડલાનત દેખ્યાના કરશે, અને અર્જુન તારામાં રહેલા સનાતનદીલિત સત્યનો આત્મનીપૂર્વક સ્વીકાર કરશે. અત્યારે તો તારા ઉન્માદોત્સવમાં પાછી વળ, વત્સ!”

(અપૂર્વી)

નોંધ



ના. મુનશીએ મુખ્ય વિદ્યારીની ઉલ્લેખ વસનજ માધવજ વ્યાખ્યાનમાળામાં તેમણે આપેલ છેલ્લા લાખથુમાં પાછલા પૌરાણિક સાહિત્યમાં મહાભારત કે તેની નામાંકિત વ્યક્તિ-ઓનો ઉલ્લેખ ન હોવાનું કારણ દર્શાવીને મહાભારતના મહાન યુદ્ધને અને તેના લોકાતર પાત્રોને કાલ્પનિક પૂરવાર કરવાનો પ્રયાસ કર્યો છે.

ના. મુનશીની નવું સર્જવાની ભાવના જે કે આવકારપાત્ર છે; પણ કેટલીક વખત નવું સર્જવા જતાં તેઓ જુનાનો અને ઉચ્છેદ કરી નાંબે છે કે જે ઉચ્છેદ તેમના નવસર્જનથી મળતા લાલ કરતાં અનેકગણો ગેરલાભકર્તા હોય.

તેમણે નવલત્રયી સર્જ અને મધ્યયુગની ઉજનજવળ અને તેજસ્વી નૈન સાંસ્કૃતિક સામે બિજુરંગી કાચ ધરી દીધો. તેમણે ચાણુક્ય યુગ લીધો. અને તેજવર્ષી વાતાવરણને મહિરા-મસત ચીતરી ખતાંયું. તેમણે પૌરાણિક યુગને રૂપણી કર્યો ને હિંદની અધ્ય પ્રાચીન વ્યવરથાના સુરેખ દર્શનને ચિન્હબિન્હ કરી નાંખ્યું. અમુક અરપષ્ઠ ઉલ્લેખોના અસંભવત અર્થ કરીને અને બીજી બાજુને કીલવાના કે ડીડાણુથી જોવાના અમને બિનજડરી ભાનીને તેમણે વિશ્શિષ્ટને ગણ્યુક્તપુત્ર ને સત્યવતીને માધીપુત્રો કહી દીધાં. આજે પુરાણોના પૂરતા અવલોકન અને સ્વક્રમ મંચન વિના તેઓ મહાભારતને કાલ્પનિક કહેવાની હામ લીડે છે.

પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખના અભાવેજ જે મહાભારત બિનાયેતિહાસિક કરી જતું હોય તો મેકસમ્બૂલરે પણ જેનો ઉલ્લેખ કર્યો છે એ ‘અશ્વયન’ પુરાણુનો અને તેમાં દર્શાવેલી મહાભારતની વિગતોનો ના. મુનશીએ અભ્યાસ કરી લેવો ધેર છે. પણ એ કારણને પૂરું ગણ્યુનામાં ન આવે તો પણ જ્યેતિષ, અન્ય ઉલ્લેખો અને અનુકરણો અને સાંસ્કૃતિક વિકાસકર્મની ગણુતરીએ પણ મહાભારતનું યુદ્ધ ઐતિહાસિક જ હરે છે.

જ્યેતિષ-ગણુતરીએ તો અનેક પ્રમાણો આપીને ‘કેસરી’ ના વિખ્યાત ભંપાદક શ્રી. કરેદીકરે તેને ઐતિહાસિક પૂરવાર કરી દીધું છે. ઉલ્લેખ-ગણુતરીએ મહાભારતનાં નામાંકિત પાત્રોની યુગજુની મૂર્તિએ મળી આવે છે; પ્રાચીન સ્થાપત્યમાં કેરકેર તે યુદ્ધની ઐતિહાસિકતાને ગૂંઠી લેવામાં આવી છે; હજરો વર્ષજુની સાહિત્યકૃતિઓમાં એ યુદ્ધ અને એનાં પાત્રોના ઉલ્લેખ મળી આવે છે; એ કાવ્યની ઐતિહાસિકતા પર તેના અનુકરણમાં યુગો પૂર્વે નવીન સાહિત્યકૃતિએ રચાઈ છે. અને સાંસ્કૃતિક વિકાસકર્મની ગણુતરીએ—

રામાયણયુગ અને તે પહેલાંનાં પણ લાખો વર્ષથી હિંદની મહાન આર્ય પ્રજા જે શખ્વવિકાસ સાધતી આવી તે વિકાસને મહાભારતના નહિ તો બીજ એવા ક્યા સર્વસંહારક મહાયુદ્ધના પરિણામે મર્યાદિત કરી નાંખવો પડ્યો? આદિયુગમાં પાણાણશખો, તે પછી ધતુધ્વવિકાસ, પછી તલવાર અને ધીમે ધીમે વ્યાપક સંહારને સહજ જ્ઞાવતાં અનેકવિધ તીક્ષ્ણ શખો હિંદમાં વપરાયાં છે અને રામાયણ તેમજ બીજ યુદ્ધોના ઈતિહાસમાંથી તેના વિગતવાર પૂરવાએ. પણ મળી આવે છે. આ શખ્વવિકાસ લગભગ વિ. સંવત પૂર્વે ૫૦૦૦ વર્ષ સુધી ચાલુ રહ્યો છે. પણ એ સમયમાં હિંદમાં ડોર્ધ એવું મહાયુદ્ધ જેલાંનું કે જેનું સર્વસંહારક પરિણામ જોઈ પ્રજાને શખ્વમર્યાદા સ્વીકારવાની ફરજ પડી. તે એ મર્યાદા હિંદની

૫૫૪ .. સુખાસ : ઇન્દ્રાણ ૧૬૬૫

મહાન પ્રજનાં એવી સચોટતાપૂર્વક જળની છે કે લગભગ અદારમી સદી સુધી યુદ્ધમાં તેણું તીર, તલવાર કે ભાલા સિવાય ચોથી ચીજનો ઉપરોગ નથી કર્યો.

જે શલ્વમર્યાદા સ્વીકારવાની કે તેને અમુક દિવસો સુધી પણ ટકાવી રાખવાની આજે યુરોપની શક્તિ નથી એ કરતાં પણ અનેકગણી વિશુદ્ધ શલ્વમર્યાદાને યુગો સુધી સાચ્ચી રાખનાર ભારતીય પ્રજનાં એ મર્યાદાઅંધન મહાભારતના નહિ તો બીજા કયા સંહારક યુદ્ધમાથી સ્વીકાર્યું છે ?

X X X

આ મહિને દ્વિદમાં રણુ થયેલાં ત્રણ બજેટો ખાસ ધ્યાન આકષે છે : એક મુંબદ્ધ સરકારનું, બીજું રેલવેનું, ત્રીજું હિંદી સરકારનું.

મુંબદ્ધસરકાર મહાસભાવાદી સરકાર હોઢ તેનું અજેટ પ્રજનાં સુખ અર્થે હોય એ સ્વાભાવિક છે. પણ એ બજેટ એક અણુધારી ભાવિ આઇતનો માર્ગ તો ખુલ્લો જ રાણે છે.

મુંબદ્ધસરકારે દાઝાંધીના કારણે આતી પડનારી હોઢ કરોડની ખોડ પૂરવાને નવા કરવેરા નાંખવા વિચાર્યું છે. એ કરવેરા ગમે તેવા યોગ્ય સ્થળે નાંખાતા હોય તો પણ તે ઉક્ત આઇતનો માર્ગ તો નથી જ અટકાવતા.

મહાસભાએ પ્રાન્તોનું શાસન રથાયી સ્વરૂપે તો સ્વીકાર્યું નથી. આજે મહાસભાવાદી સરકાર છે, આવતીકાલે બીજી પણ આવે. મહાસભાવાદી સરકાર દાઝાંધીના કારણે આવતી ખોડને પૂરવા જે નવા કરવેરાના માર્ગ ખુલ્લા કરે છે એ કરવેરાથી ગમેતેટહું તુકશાન છતાં પ્રજન તે સરકારને પોતાની માની આજે તો ચચાવી લે છે. પણ મહાસભાવાદી સરકાર કહાય રાજુનામાં આપે અને એ પછી આવવાનારી બીજી સરકારો દાઝાંધીને યોજનાના અમલને શિથિલ કરીને પણ એ કરવેરાને ચાલુ નહિ રાખે એવી કંઈ આવી ? અને એવી સરકારો જે દાઝ પરના પ્રતિઅંધને જ ઉડાવી લે તો, આજે જે શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપમાં દેશી દાઝનો ઉદ્ઘોગ અનેક પ્રકારે સચનાઈ રહ્યો છે એ ઉદ્ઘોગથી તેને સાચવનાર વર્ગ જુહો

પડી ગયેલ હોઢ, તે સમયે દાઝની બલી થયેલી નવી જરૂરિયાતને પૂરી કરવાનો ઈજારા ડેવણ પરદેશીઓને હસ્તક તો નહિ ચાલ્યો જાય ને ?

મહાસભાવાદી સરકારો ન્યાંસુધી સ્થિર સ્વરૂપમાં નથી ત્યાંસુધી અમુક લાલદાયી યોજનાઓના અમલ માટે નવા કરવેરા નાંખવા એ કરતાં એ અમલ લોનદારા કરવો વધુ બ્યાજબી છે. જે મહાસભાવાદી સરકાર ને દાઝાંધીને યોજના અને સ્થિર અનરો તો એ કોનો ગમે તે રીતે ભરપાઈ કરી શકશે; ને સ્થિર અનેલી યોજનાની ખોટ નવા કરવેરાથી પૂરી શકશે. પણ આજે નાંખાયલ નવા કરવેરાથી પ્રજન પરિચિત થઈ જતાં ભાવિ સરકારો દાઝાંધીને શિથિલ અનાવીને એ નવા કરવેરાને સહેલાધથી ચાલુ રાખી શકશે એને એ રીતે વધેલી આવકનો ઉપરોગ ગમે તે માર્ગ કરી શકશે.

રેલ્વે—અજેટમાં પોણાં પણાં કરોડની આવકે ઈકાએ કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે.

વાહનબ્યવહારને અનિવાર્ય રીતે વધારી હેવામાં આવેલ હોઢ, રેલ્વે એ બિનહરિદ્ધ બાપારીભેસરથા હોઢ અને લાડાના વધારા સંઅધમાંતે સ્વેરવિહારી હોઢ તે બજેટમાં અચત દર્શાવી શકે છે અને લાક્ષમાં ધ્યેયો કરે છે એ અતિપ્રસંસારો વિષય નથી.

પણ એહનો વિષય છે કે પુરાંત છતાં રેલવેને વધારી મૂકવામાં આવેલાં લાડાં જરીક એણાં કરવાની ઈચ્છા નથી, જે વર્ગ પર તેની આવકનો સુખ્ય આધાર છે તે વર્ગના મુસાફરોની સગનડતા વધારવાનો તેને અવકાશ નથી; અને ઉલ્કં અનેક અક્ષમાતો કર્યા પછી તે પ્રજને ‘રેલ્વેમાં વિશ્વાસ ટકાવી રાખવા’ની શિખામણું આપવા નિકળે છે.

હિંદી સરકારના બજેટમાં રૂ. ૮૨૧૫ લાખની આવકે ૮૨૬૬ લાખનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. તેમાં પરદેશી રૂ. પર નંભાયેલી જડત હિંદી મીલઉઘોગને ઇટકા સમાન છે. હિંદી મીલેને હિંદમાં તૈયાર ન થતું એવું લાંબા તારથું રૂ. પરદેશી મેગાવલું રૂ. પડશે અને તેનો મોંડો ભાવ આપવો પડતો તેમના સામેની પરદેશી કાપડની હરિઝાઈ વધારે તીવ્ય અનરો. એ જ બજેટમાં ‘ખાંડસારી’ ખાંડ પડતો કરદાડો તો ખાંડના ગૃહઉઘોગને સપદાવવાની એક બાળ સમાન થતું પડશે. એ ધારાઓએ ઉકા ખાંડનાં કારખાનાંને કે લાલ ડરી આપો છે એ કરતાં અનેકગણો ગેરલાલ એણે ખાંડના શૂટક ઉઘોગને કર્મો છે. આજસુધી એ ખાંડને લગતી જડત કે ડેવણ કારખાનાંનોને જ લાયુ પડતી તે હવેથી ડાલોને પણ લાયુ પડશે. પરિણામે ખાંડ જનાવવાનો શૂટક ઉઘોગ જે કારખાનાંનોને લરવા પડતા અને પોતાને ન લરવા પડતા કરતા લાલ નીચે ટકી રહ્યો હતો અને સફેદ ખાંડ સામે પણ હરિઝાઈમાં ભલો રહી શકતો તે હવે તદ્વારા લાગી પડશે અને હિંદનો એ રહ્યોસહ્યો સ્વહેરા ઉઘોગ વળું ડેવણ મોટાં કારખાનાંનોના હાથમાં ચાલ્યો જરો.

X X X

હિંદની રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયલ શ્રી સુભાપયંડ એકની એ ચૂંટણીમાં થયેલી જીત બાજખી હોએ કે ગેરલાલખી-પણુ એમની જીત સામે અમુક સ્થળે પ્રગતી નીકળેલી રોપ આપણી રાજકીય કચાશ સ્થયરે છે.

જે આપણું પ્રજલાસન પ્રિય છે તો પ્રજાએ ચૂંટદો પ્રમુખ પણ આપણું કિરોવદ્ધ હોવો જેઠાં. ચૂંટણીમાં કે પ્રતિનિધિસંસ્થામાં સરોડા કે પક્ષપાતના કારણે જે એમ અન્યું હોય તો સુભાપાયાનું એવો પક્ષપાતન જમાવવાને કેટલો અવકાશ છે કે ચૂંટાયાના કારણે કેટલો લાલ છે તે કરતાં તો ડાઇ સ્વતંત્ર દેશના સત્તાધારી પ્રમુખને એવો પક્ષપાતન જમાવવાને અનેકગણો અવકાશ હોય; ચૂંટાયાના કારણે અનેકગણો લાલ હોય. હિંદનો ડેવણ વાયલ મહાસભાવાદી વર્ગ પોતાનો પ્રજાકીય નાયક ચૂંટી લેવાને અમભર્ય હોય એ કરતાં તો જ્યાં બિનકેળવાયલ વર્ગને પણ અધિકાર હોય છે એવા સ્વતંત્ર દેશની ચૂંટણી વધારે ભૂલભરી અને અસ્થાને દેખાય. છતાં પ્રજલાંત્રવાદી દેશોમાં અહુમતિએ પ્રમુખ ચૂંટાય છે; ને નિવૃત થતો પ્રમુખ તેને અભિનંદન આપે છે.

પ્રજલાંત્ર જે આપણું પ્રિય હોય તો પ્રજલાંત્ર પણ પ્રિય હોવો ધરે. પ્રજલાંત્રની છાયા નીચે વ્યક્તિલાંત્રનાં ન ચોણી શકાય. કાં તો પ્રજ્ઞાનાદી હીટલર અનખું જેઠાં, ને નહિતર અમેરિકાનો પ્રમુખ-કે ને નવો ચૂંટાયલ પ્રમુખ કરેલો એવો એવો વિચાર પણ કર્યા વિના તેને અભિનંદન આપી, ભીજે એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય, નિવૃત અની જાય.

X X X

શ્રી. ગોપાળદાસ જીવાલાઈ પરેલે ‘પ્રસ્થાન’ ના કાર્તિક માસના અંકમાં નૈનોના પરમ પવિત્ર આગમન્ય ‘ભગવતીસ્તત્ર’ માંની અમુક પંક્તિએનો અનર્થ કરી જગતની વિરલ અહિસામૂર્તિ ભગવાન મહાવાર પર માંસાહારનો આરોપ એકાડી દીપેલો. એ આરોપને તો જે કે, શ્રીયુત પરેલે કરેલો અર્થ કેટલો અસ્થાને અને અસ્થાનનિન છે એ દર્શાની મહાન જૈનાયાયેણે અને નામાંકિત વ્યાઘ્રણ પંડિતોએ હાસ્યાસ્પદ કેરવી દીવિએ છે. પણ એ આરોપ અંગેની ચર્ચા હિંદની અર્થ પ્રજન પર એકાડીયેલ એ જ આરોપને પણ અસ્થાને કેરવાનાં દ્વાર ખુલ્લાં કરે છે.

૫૫૬ .. સુવાસ : ફાલગુન ૧૯૬૫

પાશ્રત્ય પ્રજાના આશ્રમે કરેલા અભ્યાસના પરિણામે, માંસાહાર માટે આપણો માર્ગ ખુલ્લો કરવાને, આપણામાં જેમ મહાવીર સમી પરમ અહિસામૃતિને માંસાહારી કરવાની વૃત્તિ જન્મી અને એ માટે અસ્વસ્તિવિત અર્થને પણ અખેસેતો કરવાની આપણે જેમ આવચેષણો કરી એમ યવનપ્રજાના સંસરે કરેલા અભ્યાસના પરિણામે તેમની પાસેથી અવળા અર્થ શીખી ડેટલાક મધ્યકાલીન પડિતોએ ભારતની મહાન પ્રાચીન વિદ્વતિઓના નામ પર માંસાહાર ચડાવી દઈ યવનકાલીન હિંદ્તી પ્રજાને માંસાહારના પણ ચડાવી દીખી હોય એમ કાં ન બને ?

ને વરતુરિથિત પણ મોટેલાગે એની જ છે. યવનોના સંસરેમાં આની તેમના હાથે ફેળવાયા પહેલાં હિંદ્તિની આર્થિક પ્રજા માંસાહારી હતી એમ સિદ્ધ કરવાને એક પણ ચોક્કસ પૂરવો નથી. રનિદેવ ને વશિષ્ઠના નામે ચડાવી હેવાયથી ગોવધ તો અસ્થાને કરી ચૂક્યો છે. એક અનાર્થ-પારધીના હાથે થતી કૌંચપક્ષોની હિંસા જેનું રામાયણના જગન્નિધ્યાન આલેખકરું હૈબું તીક્ષ્ણ વેહના અનુભવે છે; રામાયણ-મહાભારતનાં નામાંકિત પાત્રોના બોજનવણું પ્રમણે માંસનો ક્યાંય સ્પષ્ટાર્થી નિર્દેશ નથી જણ્ણાતો; રાજવંશી કુમારોને ધનુર્વિદ્વા શીખવવાને પક્ષીઓ પણ મોટે લાગે લાકડાનાં જ વપરાતાં; પરમ અહિસક જૈત્રે સાધુઓ, દુષ્કાળના સમયમાં હિંસા સુધી સમાટ અન્દ્રગુમસની સાથે જ લોજન લે છે; ચાણુકમના નામે ચડાવાયથી અર્થશાસ્ત્ર સિવાય હિંદ્તિના નગરીઓના વર્ણનપ્રમણે ક્યાંય કટવખાનાનો ચોક્કસ નિર્દેશ નથી-આ સર્વ જોતાં લાગે છે ક યવનોના સમાગમ પહેલાં, અને પરમ સૂત્રોના અર્થને પોતાના અંગત લાભને ખાતર અવળા દિશાએ હોરી અને એને અનુદૂળ નવાં સ્ક્રોન ગૂંધી પ્રજાને ખાડામાં ગમડાવી નાંખનાર વ્યક્તિઓના જન્મ પહેલાં હિંદ્તિની આર્થ પ્રજામાં ક્યાંય માંસાહાર ક પણ હિંસાનું. નામ નહોતું.

આ માન્યતા સ્ક્રમ પૂરવાયો સાથે સિદ્ધ કરી શકાય એમ છે. પણ તે માટે દૂંક નોંધમાં પૂરતો અવકાશ ન હોય આવતા અંક તે એક વિસ્તૃત લેખ રૂપે પ્રગટ કરવાની આશા રાખીએ છીએ.

લેખનોંથ : ‘વટપદ્રના ઐતિહાસિક ઉલ્લેખો’ ની લેખમાળાના બાકી એ હૃતા હુએ પછીના અંકોમાં.

સુધારો : આ અંકના પ્રીપમા પાના પર, પાંચમી લાધનિમાં, ‘સુહિંય ગુંજને’ને સ્થળ ‘સુહિંય તુજ ગુંજને’ એ રોતે સુધારીને વાંચવું.

શુજરાત સાહિત્ય સભા—

“ શુજરાત સાહિત્ય સભા, અભ્યાસવાદ” તરફથી ૧૯૩૮ના વર્ષના શુજરાતી સાહિત્યની સમીક્ષા કરવાનું કાર્ય શ્રી. પ્રે. વિષણુપ્રસાદ ર. ત્રિવેણી અને શ્રી. પ્રે. વજરાય સુદુરદોષ દેસાઈને સોંપવામાં આવેલ છે. તો આથી સૌ પ્રકાશકો અને લેખકોને વિતંતી કરવાની જે તેઓનાં પ્રકાશનો નીચેના સરનામે મોકલી આપી સરાને આ કામમાં સહકાર આપે:-

શ્રી. પ્રે. વિષણુપ્રસાદ ર. ત્રિવેણી,

એમ. ટી. બી. ડાલેજ,

આથવા લાધનિસ, સુરત.

લી. ધર્મશારામ હવે

માનદ્ર મંત્રી વતી.

નાન્ય પરિચય

શોગી કોણા ?—લેખક : શ્રી હિંયાનંદ; પ્રકાશક : નવચેતન સાહિત્યમંડિર. ૨૪૫૬,
અદ, અમદાવાદ; ડિમિન : ૧-૪-૦.

‘જળિની’ અને ‘પ્રીતમની ખાસ’ ના જાણીતા લેખકની આ ત્રોજ કૃતિ તેમની
પ્રથમની એ કૃતિઓએ વરી લાવેલ ક્રીતિમાં ઉમેરો કરે એવી છે.

એક અભ્યાસી અને નિશદ ભાવનાશીલ વિદ્ધાન પ્રે. દેવપ્રસાદની સુશીળ છતાં આશા-
ઘેલી પત્ની માલિની, પતિની ગેરહાજરીમાં, રનેલો ડો. ૨૩૦ રમાકાન્ત સાથે એક પ્રસ્તે ફ્લાઇંગ
જતાં, તેના યોગે, શરદ નામે પુત્રને જન્મ આપે છે. ડાઇટર તો માલિનીનો સહીવાસ સહૈવ
જાંખે છે પણ એ સુશીળ નારીના તીવ્ર ડિપકાથી તેની સાન ડેંકણે આવેછે અને તે આપધાતને
માર્ગ વળે છે; પણ એને જયવતીનાં સ્લ્યુક વેણુથી પતનના પ્રાયશ્રિત તરીકે તે રેચનો
માર્ગ સ્નીકારે છે. પ્રે. દેવપ્રસાદ માલિનીના એ પતનને ગુમ રીતે જણી જવા છ૊ના મૌન
સેવી પરાયા પુત્રને તે પોતાના તરીકે ઉંચે છે. પણ જ્યારે પ્રોફેસરનો એ પુત્ર ડો. ૨૩૦
રમાકાન્તની પુત્રી કુંજન સાથે રનેલ વાંચે છે ત્યારે, તે કારણે સંતાપ અનુભવની પત્નીને
સાન્ત્વન આપવા પ્રોફેસર ડો. ૨૩૦ રમાકાન્તને એ જો જો વચ્ચેના સ્નેદો અટકાવવા વાનવે છે.
તે પ્રસ્તેજ માલિની અને ડો. દેવપ્રસાદની સાચી મહાનુભાવતા અનુભવે છે પત્નીની પ્રેમદેવી
આશાઓ ન સંતોષવા મારે ડો. ૨૩૦ પ્રોફેસરને કંઈક ડપકા આપે છે પણ પછી તેની મહત્વાથી
અંજાર, પોતાની નાલેરીના લોગે પણ તે પુત્રી આગળ પટ ખાવવાની ભાવના દર્શાવે
છે. ને પરિણામે પુત્રીના મુખે શરદને લભતી ના કહેવારવી દધ તે માલિની અને તેના પુત્રની
વિશુદ્ધ સાચીની રાખે છે.

દેવપ્રસાદ, રમાકાન્ત, જયવતી, કુંજન, માલિની અને તેનો દાહો—એ બધાં બીજાના
સંતાપ, રનેલ ને વિશુદ્ધને ખાતર એવી શાંત અથા સહી લે છે કે તેમાંથી શોગી ક્રાને ન કઢી
શકાય એ વિચારણીય થધ પડે એવું છે. પ્રે. દેવપ્રસાદનું પાત્ર, કંઈક અંશે, શ્રી રવીન્દ્રનાથના
‘ધરે આહિરે’ના નિખિલની સમાંતર, ને માલિનીનું પાત્ર અદ્યાંશે ‘વિમદ્બા’ની સનેડમાં
ગુલું રહી શકે એમ છે.

પણ આ નાટકની ભાવના અને મહત્વા ‘ધરે આહિરે’ કરતાં ખૂબ નીચે જીતરી
નાય છે, પોતાનાંના પતનને સહી લેવું એ જેઠલું વિરલ છે એટલું જ તુકશાનકર્તા એ રીતે
સહ્ય કરી લેવાની વૃત્તિઓ ડેળવવી એ છે. જ્યાં અસલ છે ત્યાં પ્રસ્તે સલ્લ અનાવવું એ
શોભાસ્પદ છે, પણ અસલ સલ્લ તરીકે સ્વાભાવિક અની નાય એ નીતિધાત્રક છે.

અમુક ભાવનાનું પ્રતિપાદન કરવાનું હોએ નાટક કેટલેક સ્થળે ચર્ચાત્મક અની નાય છે છતાં
એનો વેગવંત પ્રવાહ વાંચકને જેંચી રાખે એવો છે. પાત્રનિર્ધિપણ કેટલેક અંગે સુરેખ રહી શકાય
છતાં શૈલી વાસ્તવિકતાની ભૂમિકા છાડી કદ્યનાના પ્રદેશમાં વધારે હોડી નાય છે. ભાવાનો
આંઝાર, અને જેઠણું અને વ્યાકરણની ભૂલો કંઈક વિશેષ પ્રમાણમાં છે. કલાત્મક નાટક તરીકે
મહાંશે સદ્ગુણ ન જણીએ તો પણ આ પુસ્તક આવકારપાત્ર સાહિત્યકૃતિ તો છેજ.

યુગાદર્શિન —લેખક અને પ્રકાશક : મૂલજીભાઈ પિતાંઅરદાસ શાહ, ‘સાહિત્ય ભૂષણ’;
રાવપુરા, વડોદરા, ડિમિન : ૧-૦-૦.

રંગભૂમિ મારે લખાવથ આ નાટકનું સાહિત્યકૃતિ તરીકું અવદોદન અસ્થાને લેખાય:
જેમ ના. મુનશીનાં નાટકો સાહિત્યકૃતિ તરીકે ગમેતેનાં વિરલ છતાં રંગભૂમિ પરથી

૫૫૮ .. સુવાસ : ઝાંશુન ૧૯૬૫

લગ્નાયતે એમનું અવદોડાન એ વિરલતાનું ચોખ્ય મૂલ્યાંકન ન કરી શકે એમ અહીં પણ કંઈક એવીજ તુટીની સંભવિતતા રહી ગય.

નાટકનું નામ કવિ શ્રી નહાનાલાલની પણ ડોઈક કૃતિને શોલાવે એવું છે. નાટકનું વરતુ અને તેની ગુંથણી પણ સામાન્ય અને મધ્યમ વર્ગનાં માણસેને ગમી જાય એવાં છે. સમાજનાં વિધવિધ ક્ષેત્રોનું દર્શન કરાવવાનું હોઢ નાટકનો પ્રવાહ વિવિધરંગી અની ગમો છે પણ રંગભૂમિ પર, સંબલિત છે કે, એ વિવિધનાજ વિરોધ પ્રમાણમાં દીપી ઊડતી હોય.

અરથાનતરતી દોષો કંઈક અંશે વિરોધ પ્રમાણમાં છતાં, વિનોદલરી શૈલીમાં, સમાજનાં જુદાં જુદાં થરોનું દર્શન, વાંચવું ગમી જાય એવી દેખે કરાવવામાં આવ્યું છે. વાતાવરણ કંઈક અંશે મા. મુનશીના ‘આસાંડિત’ને સમાંતર રહે છે.

અજ્ઞાતતત્ત્વાલોઓ (અધ્યાત્મતત્ત્વાલોક)—કર્તાઃ મુનિ શ્રી ન્યાયવિજયજી, પ્રકાશક : શ્વેતાંબર નૈન મુર્તિપૂજક સંઘ, જામનગર.

અધ્યાત્મતત્ત્વાલોક નામના પોતાના સુવિષ્યાત ગ્રંસ્કૃત અન્યનું મુનિશીએ પ્રાકૃતમાં કરેલું આ ભાષાંતર છે. પ્રાકૃતની સાથેસાથે અંગ્રેજ અનુવાદ પણ આપવામાં આવ્યો છે.

પુસ્તકની શરૂઆતમાં વિદાન મુનિશીએ પ્રાકૃત ભાષામાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે અને તે પછી અંગ્રેજ આસુખમાં શ્રી. નિરેદીએ મુનિશીના પ્રશંસાત્મક પરિચય સાથે અન્યનું પણ વિહુંગાવલેડાન કરાવ્યું છે.

આ અન્યમાં અધ્યાત્મમનું પ્રાથમિક દર્શન; ચોગ, તેનો ક્રમ અને તેનાં સ્વરૂપ; ધર્મિયજ્ય; અને ધ્યાન-વગેરે સ્વસ્થ વિષયોની મુનિશીએ સુંદર છણાવટ કરી છે. અંગ્રેજ અનુવાદ સુરેખ અને સુવાચ્ય બની શક્યો છે.

જીજા સંખ્ય—પ્રકાશક : ભની અહેન; શાન્તિકુંજ, અમદાવાદ.

સ્વ. ધીરજલાલ પાનાંચદ શ્રીકુના સંસ્થરણાર્થે એમનાં ધર્મપત્રની અહેન ભની તરફથી જુદા ભહાન નૈતાચાર્ગેને રચેવી ને નૈતાના ધાર્મિક ઉત્સવોમાં અતીવ ઉપગોળી એવી પૂજાએનો આ સંગ્રહ સુયોગ રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે. વ્યવર્સિતન ક્રમમાં ગોડાયેલી જરી એવી દરેક પૂજાએ અને તેમાં જગતાયદ શુદ્ધ અંને આવકારદાયક છે.

લલિત કાંચ સંખ્ય—કર્તાઃ સ્વ. કવિ લલિતાશંકર લાલશંકર વ્યાસ; સંમહકર્તાઓ : શ્રી પ્રસન્નરાવ લલિતાશંકર વ્યાસ અને વાસુદેવ વામનશંકર દીક્ષિત; પ્રકાશક : પ્રસન્નરાવ લલિતાશંકર વ્યાસ, નાગરફળીએ, સુરત. કિંમત : ૧-૪-૦.

કવિ લલિતાશંકર વ્યાસને પણ પોતાનો કુગ હતો. પચારોક વર્ષ પર શુજરાતમાં ભજવાતાં નાટકોના લેખક તરીકે કે અનેક પહો અને કવિતાઓના રચનાર તરીકે તો કદાચ તેઓ ભૂલી પણ જન્માય હોત. પણ શુજરાતી વાંચનમાળાની પાંચમી ચોપડીમાં ‘પરેશા વિશ્વેશા, અકલિત તહારી કૃતિ ગતિ’ની કવિતા વાંચતા અને ગોખતા પ્રત્યેક વિદ્યાર્થીને મન તેઓ હજ જીવન્ત છે.

આ સંગ્રહમાં તેમની સુંદર કવિતાઓએ, સારાં ભજનો અને એધભર્યાં પહો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. નરીન પ્રવાહમાં ખૂઅજ વિકસી ગયેવી આજની કવિતાસૃષ્ટિમાં આ સંગ્રહ કદાચ ચ્યામટકારિક ઉમેરો નહિ કરે પણ શુજરાતી કવિતાના વિકાસમાર્ગના એક પ્રાથમિક પગથિયા તરીકે અને પચારોક વર્ષ પૂર્વેના શિક્ષિત વર્ગની સુંદર ધાર્મિક લાવનાના સ્વરૂપર્દ્દાન તરીકે આ સંગ્રહ પ્રશંસનીય છે.

નવીન બાળપોથી (ભાગ અહેલો) —લેખકો અને પ્રકાશકો : શુજરાતાલ લ. પેટે અને જગળુંન ન એઝા; શુ. એ. વ. હાઠસંકુલ, ૨, વોન્ચાલ રોડ, રંગુન. કિંમત : ૦-૧-૦,



શિક્ષણ-સંસ્કૃતि-સાહિત્ય : મા. મુનશીના કહેવા પ્રમાણે મહાભારતનો ધર્તિદાસ ડાલપનિક છે; એથું કોઈ યુદ્ધ હિંડમાં થયું જ નથી. મુખ્ય યુનીવર્સિટીના વાઇસ ચેન્સેલર શ્રી. બંદાવરસર નિર્વાચયતાની તેમના પદે શ્રીયુતું મસાણી ચૂંટાયા છે. અમદાવાહમાં મહંત રામભદ્રીજીના પાંચ લાખના દાનથી બંધાનાર સંસ્કૃત-વિજ્ઞિત્વવિદ્યાવિદ્યા. ડલકતા—યુનીવર્સિટીની આ સાચાની મેટ્રોફાની પરીક્ષામાં ૪૪૯૦૦ વિદ્યાર્થીઓ બેસે છે. મુખ્યમાં સવા લાખના ખર્ચે લાગણગમાં બંધાયદ ભગ્ય જૈન ભાવિ. ગુજરાત સાહિત્યસભાએ આ સાલનો સુવર્ણચન્દ્રક શ્રી. કનુ હેસાઈને આપ્યો છે. કાપિ-જયતિ પ્રસાગે શ્રી. ઘૂમાઠેઠ, શ્રી. નવવરામ નિવેદી વગેરે સહિત્યકારોએ એ અયુદ્ધવિના ગાંધીજી ગુણગાળ, લાડીરાજીએ કવિ શ્રી. નહાનાલાલને કંઈક સમય પહેલાં શ. ૧૫૦૩નું વર્ષાસન બાધી આગેલું, આ સમગ્રે કવિ શ્રી. ખખરદારને શ. ૧૦૦૩નું વર્ષાસન બાધી આપવામાં આવ્યું છે: વિકભ અને ભોજ કરતાં આપણે તો આપણા યુગને વધારે પ્રગતિમાન માનીએ છીએ ને! કવિવર રવીન્દ્રનાથને જગવિયાત બનાવવામાં મહત્વનો ફોણો આપનાર અને ગીતાંજલિના આમુખદેખાય આયર્દેન્દ્રના મહાન કવિ વિટસનું અવસાન. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિને વેગલી બનાવનાર શ્રી. મોતિલાલ અમીનનું અવસાન.

ઉદ્ઘોગ-સમુદ્ધિ : ચિંદ્યને સોનાનું ધોરણું છોડયા પણ, એક મુખ્ય બંદરથીન, સરકારી આંકડા પ્રમાણે ત અધિક ૧૮ કરોડ ૫૬ લાખનું સોનાનું પહેલા સિદ્ધાંતું છે; હું ઇંજ સ્વીચ્છાને જરૂરી અવધારો અને મહિરો એ એ સ્થળે કંઈક સોનું રહી ગયું છે. તાતા સન્સ કાઢિયાવાડમાંથી કિમતી રસાયણો મેળવવાને પાંચ કરોડની મૂરીયી એક નવું જંગી કારખાનું જીજું કરવાની યોગનાસ્થો ધરે છે. શૃંગાર્યોજનની હિવાસણો રક્ષણું આપવાને વરીવારાસભાએ સરકારને એક કરોડની ભક્તામણ કરી છે. નવા બજેટમાં મુખ્યસરકારને દાખિયેધના કારણે આવતી હોટ કરોડની ચોટ જીજણી, શહેરી મિલકત, છાપાંયોની હરિકિંડા

બાલશિક્ષણને વિકસિત અને રસિક બનાવવાને જગતભરમાં અને ગુજરાતમાં પણ આને જુદા જુદા પ્રયોગો થઈ રહ્યા છે. તે માટે અવનવાં આર્ક્યુર્ક પાડ્ય પુસ્તકો રચાય છે. આ બાળપોથી એવાં પુસ્તકોમાં પ્રશાસનિય ઉમેરો કરે છે.

ચિંત્રો આર્ક્યુર્ક અને અક્ષરગોડવણી વિવિધરંગમાં હોંઘ આપડોને આ પોથી સહેલાધિથી ગમી જશે. પૂરું અને તેના પરનું ચિંત્ર જે વધારે આર્ક્યુર્ક રંગમાં હોન તો આપડો તેને વધારે ભાડેલાધિથી જડી લઈ શકત.

બાલપાડો (બાલ વાચનમાળા પુસ્તક ઉન્નતું) —લેખક અને પ્રકાશક : સોમાભાઈ શ્રીશોરલાલ પટેલ, સુણાવ. કિમત : ૦-૨-૦.

ઉપરના જેટલો જ આપકારાત આ પણ એક ઉમેરો છે. અંદરનો ભાગ સચિત્ર નહિ છતાં શાખગોડવણી આર્ક્યુર્ક અને સુવાચ્ય છે. બાલ રૂપરંગ પણ બાળકને આર્ક્યુર્ક દેના માટે પૂરતાં ગણ્યી શકાય એવાં છે.

રવીકાર -

પુસ્તકો : મહાલસા, ઉપહેશસાર.

નિવેદન : જામનસરનું સુર્યાંગ.

વિમાસિક : ઇર્ઝિસ વેમાસિક, કુસુમ, માધુરી : ગાન્ધુ-માર્ય; જૈન સિદ્ધાન્ત લાસ્કર, હેશી રાજ્ય : કોલ્ડે-ડિસે. માસિક : એતીવાહી વિજ્ઞાન, જૈન સત્યપ્રકાશ, ધ્યાયામ, શેરમ, બાલવાહી, સ્વીપ્યાથ, નવરચના, ગીતા : કેયુઆરી; પ્રસ્થાન : માગશર; આમસેવા, બાલમિત્ર, આમાનંદ પ્રકાશ, બાલજીવન, વૈદ્યકદ્વયતન, શિક્ષણ પનિકા, કલ્યાણ, અનાવિલ જગત, ગુજરાત શાળાપદ્ર કર્ચી દશા એસવાલ: માર્ય. પાકિક : એસવાલ નવયુવક, દુન્હુલિ; અડવાડિકા : પ્રજાભન્દુ, નવસૌરાંદ્ર, રાજસ્થાન, ગુજરાતી, સ્વીસકિત, જૈન જથેતા.

૫૬૦ .. સુવાસ : શાલગુન ૧૯૬૫

અને સુરતરાડ અને રેશમી ઢાપડ ઉપર કર નાંખીને પૂરી કરવામાં આવશે. નવા અજોઈમાં રેશેની ચોણું પંચાંશું કરોડાંની આવકની ગણુંની, પણ અર્થ વધવાથી પુરાંત એ જ કરોડાંની. હિંદી સરકારના નવા વર્ષના બજેટમાં ૮૨ કરોડ ૧૫ લાખની આવકે ૮૨ કરોડ ૬૬ લાખના અર્થનો અડસદ્ભો.

શ્રી-જીવન : મુંબદ્ધ પ્રાનીય મહિલા-પરિષદ્ધ ને પ્રદર્શનની શ્રીમતી સુનશીના હુંઘે થચેલી ઉદ્ઘાટનક્રિયા. દેશી સ્વીવનસનના પુર્વબંન્દ પ્રસંગે તેમના પુનેજ આપેલું માતાનું કન્યાદાન. દોર્ડ સેક્રેસબરીના કહેવા પ્રમાણે ઈંગ્લાંડને જાગ્રત્તી પ્રલના ડિલ માટે કુબામાંથી હાથે જ પાણી ઐચેટી મજબૂત ઓઝોની જરૂર છે. ગયા વર્ષની સર્વાંગે દશ ઇપસુંહીઓમાં ઇચેસ ઓફ વિડસરેનો બીજે અને બેગમ આગામાનો પાંચમો નંધર આગયો છે. એ દરો ઇપરાણીઓનો કાપડખર્ચ એ વર્ષમાં વગભગ ત્રીસ લાખ ઇપિયા થયેલો.

હેઠી રાજ્યો : જયપુરની પ્રેલક્ષય લડત સામે જરૂર પડે તો મશીનગન પણ વાપરવાનો ત્યાંના ગોરા પ્રધાનનો નિશ્ચય; શ્રી. જમનાલાલ જનજગની ધરપકડ; રાજકોટની ડથ બનેલી લડત. પૂ. કસ્તુરાના, મહીમહેન પટેલ, મુહુસા શેઠ વગેરેની ધરપકડ. સત્યાચહીણી પર અત્યાચાર; પૂ. મહાન્માજ તપાસ અંગે; શાંત સમાધાન માટે તેમના ઉપરાસ; ને છેવટે વાઇસરેચની દરમિયાનગીરીથી થયેલું સમાધાન. લીલાગામાં ગુંડાળીરી, પ્રલ-પરિષદ્ધને વિઘેરી નાખવાના પ્રયત્નો. જુનાગઢ, હૈદ્રાબાદ, કુતિયાણા, રાબેનપુર બગેરે રાજ્યામાં પ્રલ પર ચાલતું દર્દન. પરિદિપ જ્વાહરલાલના પ્રસુઅપહે લુચિયાનામાં મળેલી રાજ્યસ્થાન પ્રેલપરિષદ્ધની એક. ગાયક્વાડ નરેશ શ્રીમત સચાલરાવતું અવસાન. તેમના પૌત્ર શ્રીમત પ્રતાપસિંહરાવને વડાદરાના ગાયીપતિ તરીકે કરાયેલું રાજતિલક. શ્રીમત પ્રતાપસિંહરાવે સ્વ. નરેશ પાંચ વર્ષ માટે મહેસુલમાં કૃદીલા સવા એકનીસ લાખના ધરાડને કાયમીરૂપ આપેલું અને સ્વ. નરેશના સમારક માટે રૂ. એક કરોડ આપોયા. આવણુકારના પ્રિસ્ટિયો પ્રે. કડકાઈ દાખવવામાં આવે છે તે સામે મ. ગાંધીજીનો વિરોધ.

રાજ્ય : નિપુણી-મહાસભાના પ્રસુઅ તરીકે શ્રી સુભાષ જોગની વરણી. પ્રસુઅ તરીકે શ્રી સુભાષ યાંત્ર ચૂંટાવાના કારણે કારિયારાની તેર સલભાયે આપેલાં રાજ્ઞાનામાં. સુંઘદની મ્યુનિસિપલ ચૂંટણીમાં કાંચેસે મેળવેલા જીંકતો વિજય. વડીયારાસભામાં પસાર થયેલું સુસ્લીમ તહીંબ-ખીલ. ધંબુકામાં મળેલી રાબેનપુર પરિષદ્ધ સરદાર શ્રી. વહીભાઈ પટેલ અને કાંચેસની રાબેનપુરવિરોધી નીતિ સામે દર્શાવેલો વિરોધ. બર્મામાં રમભાણ, સરહદના પ્રધાનો અને તેમના અમલદારો વચ્ચે વધતો જતો મતબેદ. દેરા છીરમાઈલાખાનમાં લયકર ડોમી રમભાણના કારણે તારાજ થયેલો ૧૧૦ દુંગાનો. લાખનૌ અને કાનપુરમાં ડોમી હુલ્લોડો. એનિસ્ટર સાવરકરના મતે હિંદની પ્રેલક્ષી કરું રક્ષણાત્મક હોવી ધટે. સુંઘદની એક વખતના ગવર્નર, યોડાક સમય પરના હિંદના કામયાદ વાઇસરેચ અને બંગાળના ગવર્નર બોર્ડ એમાંનું, આંતરદાના સોલ પરંતુ આપરેશન નિષ્ઠળ જતાં, થયેલું અવસાન. શ્રી સુભાષચન્દ્ર જોગની માંદણી.

પરદેશ : જનપાને હૈનાન રાપુનો લીલોલ કબળો. ક્રાન્સે અમેરિકાને ૧૬૩૮માં ૧૦૦ અને ૧૬૩૯માં ૫૦૦ લશકી વિમાનો બાંધવાની આપેલ વરદી. હુર હીટલરે જાહેર કરેલી ધરદિ અને જર્મનીની અત્યર લશકી એકતા. ફેન્ચ વડાપ્રધાને ઈંગ્લાંડ અને ક્રાન્સ વચ્ચે એવીજ એકતા હશોંવા અને મી. ચેમ્બરલેની એ માન્યતાને ટેકો પણ આપ્યો. ફેસીસ્ટર થાન્ડ કાડનિસિલની જંગી સભામાં હીટલરના ભાષણું માટે સંતોષ દર્શાવવામાં આવ્યો. અને જર્મનીની સંસ્થાન વિષયક માગણીને વ્યાજણી ડેવલવામાં આવી, તેમજ છીટલિના સામાજિક કાયદાની પુરંદર્ણના સંબંધી વ્યવસ્થા કરવામાં આવી. છીટલિ અને જર્મનીની દોકસ્તાવાદી દેશને ડશ્કરેતી પ્રે. ઇચ્છેદેણી પરદેશનીતિ ક્રાન્સ માટે હુમલા. ઇચ્છેદેણે જાહેર કરેલી જગતના પ્રયોગ રાજ્યની સ્વતંત્રતાને વાંચી પોતાની પરદેશનીતિ. ધરદિ, જર્મની, જનપાન, ક્રાન્સ, ઈંગ્લાંડ ને અમેરિકાએ શાચ્ચસંજગતામાં આદરેલી વિનારાદ હસ્તિશીઠ. જનપાને આવતા વર્ષ માટે મંજુર કરેલું એકનીસ કરોડ પાઉન્ડનું આસ લશકી બજેટ-નેમાંથી સાડા સત્તાવીસ કરોડ પાઉન્ડ નીના સુઝી પાછા અર્થવાની ગણુંતરી. જનપાને બંધ કરેલો પર્લ નહીનો માર્ગ. એલેસ્ટરાઈન પરિષદ્ધનું ખરાખે ચઢેલું નવ. નેડસ્ટેમમાં કશ્યુ-એન્ડર. ચીનના પરદેશમંગીનું ખૂલ્લ. સ્પેનના આંતરિક યુઝમાં ક્રાન્સને બાસિયાના પર મળેલો વિજય, સમાજયાદી સરકારની નાસભાગ; અમેરિકા સિનાય જગતના લગભગ દરેક દેશ કરેલો. ક્રાન્સની સરકારનો સ્વીકાર. જુના પોપનું અવસાન. નવા પોપ તરીકે એક રાજ્યદારી રોમન કાર્ડિનલ ચૂંટાં ધરદિમાં ફેલાયેલી હર્ષની લાગણી.

Specimen-extracts from Ancient India Vol. II.

[For other particulars, see advertisement elsewhere in this number]

We do not know what his name must have been according to astrological position of constellations at the time of his birth. Jaina books state that his name was Samprati⁹. Sometimes it is written as Sampatti—possibly given to him due to his possessing a vast amount of riches. Aśoka had given him the name Priyadarśin¹⁰, which he got inscribed in the rock and pillar edicts due to his respect for his grandfather. The Purāṇas state that the name of the successor of Aśoka was Indrapālit, which may have been another name of Priyadarśin¹¹. Certain it is that the king who succeeded Aśoka on the throne was his grandson Samprati by name¹². Greek books have called him Amitrochades¹³; Jaina books have given him a similar name, Amitrāghāt¹⁴.

Some scholars say that one of his names was Daśarath.

(9) In Māgadhi language, the name is Samprati. (J. S. L. Sangraha, pp. 41).

(10) G. V. S. Aśoka, pp. 6:—"Priyadarśin" means, "One who looks (at others) with love" or "one who is dear to the sight". Cf. pp. 249. Some scholars think that "Priyadarśin" is a mere epithet. Really speaking it is a proper noun.

Smith, Aśoka, pp. 22, f. n. no. 2:—"I do not deny that the chronicles of Ceylon used Piyacasi and Piyadassan as quasi-proper names; but I affirm that, in the inscriptions the titles are not used.

(11) This name is discussed later on.

(12) Rāsamālā, vol. I. pp. 7, (London, 1856 edi.); "Samprati is a fabulous prince". The reader will see that this observation is quite false.

(13) I. C. C. (Hultzsch), Aśoka, pp. 35, and line 25 of 31; Bhilsā Topes, pp. 92; for further details read the next chapter.

(14) Scholars have ascribed this name to Bindusār on the theory that Sandrecottus was Chandragupta. This name belongs to Priyadarśin, while Bindusār's another name was Amitraketu. Pp. 204 f. n. no. 41 and 43.

Though this contention is questionable, yet we have to admit that there was a governor of Magadh, by name Daśarath¹⁵ and that he was the grandson of Aśoka¹⁶. Samprati's seat of capital was however, Ujjaini, and hence he was not the same individual as Daśarath. The Nāgārjuna cave inscription states the number of the year of the reign of Daśarath, in which he gave certain things in charity. The word "reign" may be taken to mean that Daśarath gave things in charity in the particular year of the reign of Priyadarśin under whose power he was the governor of Magadh, and that the things were given in charity by Priyadarśin's order.

On the other hand, we definitely know that one branch of the Maurya dynasty ruled over Bengal and Behar—the original Magadha province—in the 2nd and 3rd centuries A. D. This leads us to the conclusion that a separate and independent branch of the Maurya dynasty must have been established over Magadh during the rule of Priyadarśin and that this Daśarath must have been the first king of this branch. It was probably established in the same year in which Priyadarśin became full-fledged emperor and hence the number of the year of the giving of charities by Daśarath coincides with the number of the year of Priyadarśin's reign¹⁷.

This Daśarath was certainly the grandson of Aśoka; but what was his father's name? When Aśoka was the governor of Ujjain, he had two sons, Kuṇal and Mahendra. We know, however, that when, after Bindusār's death, Aśoka went to Pāṭliputra with his family, Kuṇal's mother—Kañchanmālā—could not accompany him because she was far advanced in pregnancy¹⁸ and that soon after giving birth to a child, she had died. If that child were male-child, Kuṇal must have had a younger brother¹⁹.

(15) See the chronological list on pp. 236 above.

(16) J. O. B. R. A. S. XX, pp. 367:—"The Viṣṇupurāṇ gives Daśarath as the name of Aśoka's grandson and immediate successor". For explanation and details about this, see the appendix at the end of the volume.

(17) This matter is already discussed once; for details read the appendix at the end of the book.

(18) Pp. 231, f. n. no. 28 above.

(19) Pp. 239 and pp. 231, f. n. no. 28.

Prince Mahendra had renounced the world and had entered the Buddhist order²⁰, while he was unmarried. So there is no question of his having had any children. After Kuṇāl's blindness, the next heir to the throne must have been either Kuṇāl's son, or in his absence another grandson, if there were any. We know that as long as Priyadarśin was not born, Aśoka had appointed his "grandson" Daśarath as his successor; and hence it is not unreasonable to come to the conclusion that this Daśarath was the son of the younger brother of Kuṇāl—the brother whose name we have yet to find out²¹. Daśarath must have been elder than Priyadarśin, who has born in A. M. 223=304 B. C.²², when Kuṇāl was 32 to 33 years old²³. This means that Kuṇāl had a son many years after his marriage²⁴. His younger brother, who was his junior by a couple of years only, must have had a son much earlier than that and this son must have been Daśarath, who was thus elder than Samprati²⁵. Aśoka must have declared

(20) Pp. 237 above.

(21) See the chronological list on pp. 236.

(22) The Christian New Year begins nearly two months and some days after the Hindu New Year (Vikram Era). Hence, when we want to give the date of any event that has taken place during these intervening days or immediately after that, we are required to state two years of the Christian Era, viz. 304–303. He was born during the ascendancy of the Puṣya constellation, i. e. in the bright half of Poṣa. There were no two Poṣas during that year, otherwise one of them must have been stated as Adhik. Such "Adhik"—(additional)—months could be included during two months only—Poṣa & Aśāḍh. (K. S. S. Com. pp. 131 and my article in the Chaitra Number of "Jaina Prakāś.") Taking all these things into consideration, his birth must have taken place on the 10th to 15th day of Poṣa. The full-moon day is given importance in the rock-edicts. It can be either due to that day being considered as important from the religious point of view or due to its being the birthday of Priyadarśin. Of these the latter cause is more probable.

(23) Because he was born in B. C. 337=A. M. 190. (Pp. 231 above).

(24) This was what grieved the heart of Aśoka. After Kuṇāl's losing his eyes on account of his carelessness, Aśoka had intended to atone for it by appointing Kuṇāl's son as the heir to the throne. Kuṇāl did not have any issue for a pretty long time. Aśoka was growing older; and hence, being anxious to appoint some one as his successor, he designated Daśarath as the next emperor. We know that this arrangement was provisional.

(25) Daśarath's father was born in 330 B. C. If we accept the hypothesis that he married at the age of 14, then the marriage must have taken place in

Daśarath as his successor in absence of having any direct descendant; but when Priyadarśin was born, he must have changed the arrangement and must have appointed Daśarath as the independent king of the province of Magadh; and Priyadarśin must have continued him in the same position, due to his respect for his grandfather²⁶. The separate branch, thus established, may have continued to rule Magadh upto 4th or 6th century A. D.

It might also be suggested that Priyadarśin must have added one more name to his already long list, by assuming the name Daśarath, after his accession to the throne, and thus Samprati, Priyadarśin and Daśarath may have been names of the same individual²⁷. But the fact that, when Daśarath died, Priyadarśin appointed his brother Śālisuk as the governor of Magadh²⁸, frustrates this theory. Śālisuk was the governor of Saurāṣṭra at the time of this appointment.

Thus we come to the conclusion that Priyadarśin was the eldest son of Kuṇal, that Daśarath was the son of the younger brother of Kuṇal and that Aśoka had appointed Daśarath as the next heir to the throne as long as Priyadarśin was not born.

Samprati was born in B. C. 304=A. M. 223. No sooner was Aśoka made aware of the happy fact that Kuṇal had a son than

316 B. C. The probable date of Daśarath's birth, therefore, must be 314 B.C. Samprati was born nearly 11 years later in 303 B. C.

(26) Pp. 239 above; M. S. I., pp. 654.—“Evidence to the effect that Samprati ruled over Magadh is not wanting. According to Mr. Smith—Aśoka, Smith, pp. 70—“The Mauryan empire was divided into two parts after the death of Aśoka. The capital of the eastern portion was Pāṭliputra, and it was ruled by Daśarath. Ujjaini was the capital of the western portion and Samprati ruled over it. The Purāṇas have included Samprati in their chronological list of the emperors of Magadh.”

(27) C. H. I. pp. 166:—The account of Daśarath, the governor of Magadh, contains the words, “Samprati, another grandson of Aśoka, who reigned probably at Ujjain.” The writer has stated these words on the authority of a Jaina book. The book, however, does not have the word “another” in it, which the writer seems to have added on his own account. But one thing becomes clear from this and that is, Samprati, like Daśarath, was a grandson of Aśoka. (We have yet to decide whether Daśarath and Samprati are names of different individuals or of the same; and who succeeded Aśoka on the throne. Read the appendix at the end of the book for this).

(28) Pp. 239 above.

he sent for him from Avanti²⁹ to Pāṭliputra and declared him as his successor to the throne. At this time Samprati was a babe of ten months³⁰. He was born in Posa, and **The duration of his rule and of his life** was proclaimed emperor probably on Vijayādaśmi. (P. 256 f. n. 5).

His coronation ceremony took place, as we have already stated, (P. 256), in A. M. 237=B. C. 290. This is independently supported by the fact that king Tissā of Ceylon died during the 26th year of the reign of Priyadarśin³¹ (P. 238 f. n. 71).

Buddhist books contain no information about him, or the tenure of his reign, because he was not a Buddhist³² but a Jain. The information supplied by the Jaina books is also misleading to a certain extent.³³. Pundit Tāranāth, a Tibetan writer, states in his account of Khotan, that Sambāti (Samprati) reigned for 54 years³⁴. Thus his reign lasted from 290 B. C. to 237 B. C. The chronological list of the kings who ruled over Ujjain, as given by the author of the Parīśīṭa-parva,³⁵ supports these dates³⁶. In

(29) For want of proper information, I have stated Avanti as the place of his birth. It is probable, however, that Kañchanmālā might have gone to her father's place, which was near the Bābhra-vairāṭa edict, during her pregnancy and the child may have been born there, and then, later on, brought to Avanti.

(30) Baroda Library, Samprati Kaṭhā—Manuscript—pp. 88:—The age of the child is stated to have been ten days in place of months. It seems improbable that a ten-day-old child could be safely brought from Avanti to Pāṭaliputra.

(31) Tissā died in (290–26), 264–3 B. C. (F. n. no. 71 for the chronological list of the kings of Ceylon). This king, queerly enough, came to the throne when Samprati was born, and died when Samprati got the rock-edicts erected.

(32) For details see the account of his rock-edicts.

(33) Vol. I. pp. 195 and f. n. about it.

(34) Smith, Aśoka, pp. 82:—“The accession of Aśoka apparently 48 or 49 years earlier in B. C. 301 or 302, assigning 54 years to his reign.”

Mr. Smith has borrowed this from Paṇḍit Tārānāth's account of prince Kusthan of Tibet. Only he has interpolated the word “apparently,” because he does not seem to have full faith in the Paṇḍit's account of Aśoka. Mr. Smith has erred into the belief that the person (Dharmāśoka) whose account is given by the Paṇḍit, was Aśoka. But Aśoka's reign lasted for 41 years, while that of Priyadarśin lasted for 54 years.

(35) F. n. no. 33 above.

short, he was born in 223–4 A. M., was anointed king in 237 A. M.= 290=B. C., and he died in A. M. 290 B. C. 237 at the age of 67.

His picture gives us the idea that his complexion was fair and awe-inspiring on account of broad forehead and chest. He was kind-hearted, brave and peace-loving. His height must have been between nine feet and ten.³⁷ The Stūpas built by him—Sañchī, Bhārhut and others—testify to the truth of this statement. The entrances to these Stūpās are not less than 9 ft. and 7·5 in, in height³⁸. It is a well-known custom among the Jains that their temple-doors are always of less height than the persons who enter it, so that every one who enters it, first bends his head, consciously or unconsciously, as a mark of respect. Priyadarśin's height, therefore, must have been somewhat more than 9 ft. and 7·5 inches; and his height gives us an idea of the average height of men during those times.

His rock-edicts tell us that he had a large family and that he had given shelter to all his relatives—far and near.

Jaina books state that the number of his queens was pretty large³⁹. Even after granting that scholars have committed the same kind of blunder as that of identifying Sandrecottus with

(36) In rock-edict no. 13, names of five contemporary Yavan kings have been given. They also support our theory. Pp. 232 above. The names are:—

(1) Antiyok—King of Syria, Antiochus II (B. C. 262 to 246). According to my conclusions, this king must have been Antiochus I. My opinion is supported by M. S. I. pp. 19. It is stated that Antiochus I was called "Sorter", while Antiochus II was called "Theos." His rule lasted from B. C. 280 to 262.

(2) Turumaya, king of Egypt, Ptolemy II, Philadelphus: B. C. 285 to 247.

(3) Muc—Megus of Syrin, B. C. 300 to 250.

(4) Antikini—Antigonus Gaunts of Macedonia; B. C. 276 to 239.

(5) Alexander—Alexander of Kārinth, B. C. 252–244.

He was not king of Kārinth but of Epirus. His reign lasted from 272 B. C. to 255; because Priyadarśin's coronation ceremony was performed in 289 B. C. and he finished his conquest tour in 282 B. C. Then there was a regular exchange of ambassadors between the two.

(37) No doubt, the reader will not readily believe this. Mahāvīr, however, who lived 200 years before him, was 10 ft. 6 ins. tall (Vol. I. pp. 29 f. n. no. 60).

(38) Bhilsā Topes; Bhārhut stūpa.

(39) Pp. 205 above, f. n. no. 48.

Chandragupta⁴⁰, it is quite possible that he had at least two queens. (1) The name of the queen consort is not known; probably the heir-apparent was not born of her⁴¹. (2) The second queen, Chāruvākī⁴² is mentioned by Priyadarśin himself in the Pillar at Allahbad. (3) Again, he seems to have married the sister of Sātkaraṇī II of the Āndhra dynasty of southern India. (Probably Chāruvākī was this sister. F. N. 42). Jaina books proclaim that during his conquest tour, he married numerous princesses of defeated kings⁴³ (the number is 16000). Looking to his prowess, the extent of his territory and the length of his reign, it is not unreasonable to conclude that his harem must have been crowded with a

(40) Pp. 205 above, f. n. no. 48.

(41) Smith, Aśoka, pp. 198, f. n. no. 3:—It is stated there about Kāruvākī (Chāruvākī), that the names are spelled Tibal and Kūluvakī in the dialect of Magadha. The second queen was evidently in high favour as the mother of a son, who might succeed to the throne; but he seems to have predeceased his father. This statement is based on the authority of the rock-edicts. Prince Tibal though he was born of Kūluvakī, who was not the queen-consort, must have been the heir-apparent; but we know that the name of the heir-apparent was Viṣasen, who was the governor of Afghānistān during the rule of Priyadarśin. Had his name been Tival, it would have been mentioned in the rock-edicts, just as the names Daśarath, Śālisuk and others are mentioned. This divergence can be explained as follows:—(1) Either Viṣasen was next in age to Tibal and might have been appointed successor after the latter's death, (2) or, Viṣasen might have been junior in age, but must have been declared heir-apparent because he was born of the queen-consort. The first theory is the more reasonable of the two, because generally the eldest son is appointed as the heir-apparent, irrespective of the queen of whom he is born. Thus Mr. Smith's conclusions are in keeping with my own.

(42) Smith, Aśoka, pp. 198, f. n. no. 3:—“Kūluvakī is a family or gotra name, meaning—of the Karuvākī race”. If this is so, she was probably the daughter of the king of Āndhra (read above, no. 3.) Cf. f. n. no. 41 above, and 43 below.

(43) Sudarśan lake inscription, Epi. Ind. vol. 8, pp. 41 and further in this vol. on the Āndhra dynasty. Chāruvākī might have been the sister of Sātkaraṇī. Read further, this chapter.

pretty large number of queens⁴⁴. (4) Kalhaṇ has stated in his Rājatarāṅgiṇī that Dharmāśoka had conquered Kaśmir and that after him his son Jālauk occupied the throne of Kaśmir. Jainism was prevalent in Kaśmir even before its conquest by Dharmāśoka, who was himself a Jain. Mr. T. W. Thomes has supported this. The name of the queen of this conqueror of Kaśmir, was Isāndevī⁴⁵. I have already proved that this Dharmāśoka is none else but Priyadarśin⁴⁶ (Appendix at the end of this volume) and he had appointed his son Jālauk as the governor of Kaśmir. This leads us to the conclusion that Isāndevī must have been one of the queens of Priyadarśin⁴⁷ and the mother of Jālauk. The name of the son of Chāruvākī was Tivar. These two names-Jālauk and Tivar-do not seem to have been based on astrological rules, but they must have been names given to them by writers in keeping with their habit of giving suggestive names. The different names connote different individuals with different mothers. (5) It is certain that none of these two was the heir-apparent, which means that still another queen must have been the mother of the heir-apparent. If either Isāndevī or Chāruvākī had been the mother of the heir-apparent, either of them would have been raised to the position of queen consort. Again, the name of either of them, must have been connected with the name of the heir-apparent, just as their names are connected with the names of their own sons. Thus, considering all things, at least five queens must have been the inmates of his harem. Hence it is no exaggeration to say that he had many queens⁴⁸.

(44) Pp. 205 f. n. no. 48, and appendix A, at the end of the book, specially pertaining to No. 5.

(45) Bhāratīya Prāchīn Rājvamīśa, vol. II, pp. 133-34: In Rājatarāṅgini the name given is Isvarādevī.

(46) Dharmāśoka is considered by them as an exploded myth, because they thought that he lived during the 6th century, A.D. But their calculation is wrong.

(47) In Taranga I, verse 122, of Rājatarāṅgini she is introduced as the wife of Jālauk; but this statement is only one of the many inaccuracies that are found in the first and the second part of the book.

(48) P. 205 above, f. n. no. 48.

હિન્દુસ્તાનની સૌથી મોટી વીમા કંપની

— ધી —

ન્યુ ઇન્ડિયા

ના જિલ્હગીના ખાતાની અદ્વિતીય પ્રગતિઃ—

વર્ષ	નવું અમકાજ ડૉ.	ગ્રભિયમની આવક ડૉ.	ખર્ચનું પ્રમાણું
૧૯૨૬-૩૦	૩૮,૬૭,૫૦૦	૧,૫૭,૫૭૯	૮૪.૬૯
૧૯૩૦-૩૧	૭૧,૮૮,૫૦૦	૪,૦૭,૦૭૦	૬૭.૩૫
૧૯૩૨-૩૩	૧,૦૫,૨૭,૭૦૦	૧૦,૮૧,૨૩૧	૪૮.૨૫
૧૯૩૪-૩૫	૧,૪૧,૦૨,૪૫૦	૨૦,૫૨,૮૬૫	૩૮.૭૨
૧૯૩૬-૩૭	૧,૬૭,૦૦,૨૫૦	૩૧,૧૮,૮૭૬	૩૩.૦૯

વીમા અગર એજન્સી માટે લખો યા મળો:—

એન. એમ. ફોજદારની કું.

તારે:— 'BENEFIT'

ટેલીફોન } એપ્રિલ-૨૨૨૫
ઘર-૭૦૨૩

થીએ એન્ટસ : ગુજરાત

કુવારા સામે, ગાંધીરોડ

અમદાવાદ

આંખના ફાડતર અહુ ત્યારે ચશમાનો નેથર કાઢી આપશે પણ પછી તમે શું કરશો ?

- (1) પેઅલ, ફ્લીન્ટ, ફાઉન કીસ્ટલ ફુક્સ, બ્લુ, સ્મોક, એન્ટેક્ટિન, ક્લોરોફીલ, ફ્લુઝલ, એંબર,
પુંક્ટાલ, ઉરી, ઉમ્ભાલ, ફુક્સાઈટ, વીટ્રોક્સ, ક્રેચ ફ્લાયફાકારક ?
- (2) ઓવલ, રાઉન્ડ, ડી, ૪૦, ૪૨ પેન્ટાસ (લોંગ, નીયર) ફુલબ્યુ, ઓક્ટેગોનલ, હેગાજોનલમાં
ક્રેચ પ્સેંટ કરવા ચોણ્ય ?
- (3) ફ્લેટ, પેરીસ્ક્રોપીક, ટારીક, સીલીન્ડર, સ્ફેરીક્લલ, સેન્ટેરિસીલીન્ડર, આધ્રિફ્લસ, સ્પ્લીટ, સુન,
કર્વડ (અપર કે લોઅર) સીમેન્ટેડ, ક્રીટ્ટાક, ફુઝી, એટેચેંટ ઈંગ્લમાં ક્રેચ સગવડવાળો ?
આ બધું જાણવું હોય અને ચશ્મો ખરીદતાં છેતરાનવાળી ભીડમાંથી બચી જવું હોય તો

આં ખ અને ચ શ્રમા

તું પુરતક ને અમે ત્રીસ વર્ષના અસુખન ઉપરથી અહાર પાડ્યું છે તે તુરત મંગાતી લ્યો.
મુંખઈ સરકારના ડેળવણી આતાએ લાધબેરી, પ્રાથમિક ડેળવણી, ધનામ વિગેરે માટે
પણ મંજૂર કર્યું છે.

પાંચ પૂર્ણ, ૪૦ ચિત્રો, ૧૪૦ પૃષ્ઠો છતાં કિંમત માત્ર ૦-૧૦-૦.

શશિકાન્ત એન્ડ કું. : રાવપુરા : વડોદરા

શ્રી સમર્થ-બુક બાઇન્ડિંગ શોપ

દાંડિયા બજાર—વડોદરા

અમારે ત્યાં દરેક જાતનું બાઇન્ડિંગનું કામ થાય છે, અને દરેક જાતના લો
સ્ટિપાર્ટનું પણ કામ સોનેરી નામ સાથે કરી આપવામાં આવે છે.
એક વસ્તુ કામ આપી ખાત્રી કરશો.

પ્રોપ્રાયટરઃ—બોરાટે બ્રથર્સ.

‘સુવાસ’નું ધોરણું આમ વધુ વ્યાપક અનતું જય છે તે નોઈ આનંદ થાય છે ... તેના
સંચાલણાને ધન્યવાદ છે. આ પદ્ધતિનો બધાં સામયિકીયાળા સ્વીકાર કરે તો ? અત્યારે
કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે નજ થવા પામે.

—શુજરાતી
તેમાં પીરસાયલી વિવિધજલતની વાનગીઓ સાહિત્ય-પ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે.

—ક્ષણિય ભિન્ન
સામગ્રી સંતોષપ્રદ છે.

—પુરતકાલ્ય
જીવન, કલા, સાહિત્ય વિગેરે વિષયો પરના લેખાથી ભરપૂર છે.

—સયાજુવિન્યા

સ્ત્રી ઉપયોગી પુસ્તકો

સ્ત્રીશક્તિ અંધમાળા

૧ વંધ્યા	૦-૪	૩૬ માતૃપ્રેમ	૦-૪
૨ કાકી	૦-૩	૩૭ પારસી લગ્નગીતો	૦-૫
૩ કાયદામાં ખીતું સ્થાન	૦-૩	૩૮ સતતિનિયમન	૦-૮
૪ અર્થાગના (વાતી)	૦-૩	૩૯ વહેણી પતિ	૦-૩
૫ ગુહઘ્રવસ્થાની વાતો	૦-૬	૪૦ આરોગ્ય અને સુખ	૦-૬
૬ ખાંધણું (લોકગીત)	૦-૫	૪૧ સામાજિક વાતો	૦-૫
૭ બલદાન (મેરક ગીતો)	૦-૫	૪૨ રમુજુ વાતો	૦-૪
૮ જવાટણી	૦-૪	૪૩ લલી ભાબી	૦-૧
૯ મા (વાતી)	૦-૪	૪૪ પતિ પ્રભુ છે	૦-૧
૧૦ જ્યાના પત્રો (કસોટીમય લગ્ન)	૦-૬	૪૪ માંદગી અને માવજત	૦-૪
૧૧ પતિનો પસેંદગી	૦-૪	૪૬ વાતનું વસેંસર	૦-૧
૧૨ લીલીની આત્મકથા	૦-૩	૪૭ ધરેણુંની રોાખ	૦-૧
૧૩ ઝાઈ	૦-૪	૪૮ પારસી સતીએ	૦-૬
૧૪ પારસી વાનીએ	૦-૬	૪૯ એકાદશી	૦-૧૧
૧૫ વિધવા (વાતી)	૦-૫	૫૦ રાણુંહેણી	૦-૧૨
૧૬ ડાને પરણું ? (વાતી)	૧-૪	૫૧ શિવાળી આ	૦-૧૦
૧૭ સુધડતા અને સુહરતા	૦-૮	૫૨ સાસુની શિખામણુ	૦-૧
૧૮ હાસ્યનો કુવારો	૦-૮	૫૩ કાયમનું અગ્રાન	૦-૧
૧૯ ભૂતના લડકા (વાતી)	૧-૧૨	૫૪ નામ વગરની નવલકથા	૧-૮
૨૦ વિષવૃક્ષ (વાતી)	૧-૮	૫૫ નારી અલિંગેક	૦-૪
૨૧ હાસ્યકલાપ (રમુજુ)	૧-૮	૫૬ માસિક ધર્મ	૦-૮
૨૨ દેવી ચૌધરાણી	૧-૮	૫૭ નવા સાધથા	૦-૧
૨૩ વીર રોડા (કાળું શુલાખ)	૧-૦	૫૮-૫૯ વીર તારા (એ લાગ)	૨-૪
૨૪ હાસ્ય અરણ્યા (રમુજુ)	૧-૮	૬૦ ગોરમાનાં ગીતો	૦-૧
૨૫ "નંદા ચીહે મુક્કો"	૧-૦	૬૧ મેઝાં તેમીંડા	૦-૧૨
૨૬ ગરખાવળી (રાષ્ટ્રીય)	૦-૪	૭૨ સામાજિક વાતો	૦-૩
૨૭ જીવનપલટો (વાતી)	૦-૪	૬૩ ગુણ્ણોયલ ગ્રાહણી	૦-૧
૨૮ સુખી ધર (ભોડક)	૦-૩	૬૪ ખી સ્વેતંગ્ય	૦-૧
૨૯ અરત ગુંધથુ	૦-૧૦	૬૫ દક્ષિણી રાંધ્રણી	૦-૩
૩૦ ચોર્યાસીનું ચક્કર	૦-૫	૬૬ સતી જસ્મા	૦-૬
૩૧ રતીયા ઘેગમ્	૦-૩	૬૭ સંસારદર્શન	૦-૬
૩૨ ગૃહ વિવેક	૦-૬	૬૮ ભૂખિમાત્રાં આનંદમદ	૧-૦
૩૩ સુખીના પત્રો	૦-૮	૬૯ બાળવિધવા	૦-૨
૩૪ સ્ટવનું શાસ્ત્ર	૦-૩	૭૦ સાચાં સહોદર	૧-૮
૩૫ ખી છદ્ય	૦-૩		

સ્ત્રીશક્તિ અંધમાળાનો આખો સેટ આજેજ વસાવો. કુલ ૭૦ પુસ્તકો
ખાલી પડ્યાં છે. તે રીતે ૨૨ અંધમાં મળે છે. પુસ્તકો છુંયાં પણ મળી શકશે. નુર જૂદુ.

લખો: સ્ત્રીશક્તિ, કેળાંધીઠ, સુરત

“કારખાનાવાળાને અમુલ્ય તક”

અમારી પાસે દરેક જાતની મર્શિનરી (ઓફિસ એન્જિન તથા કુડ ઓફિસ એન્જિન) આટાની ચક્કો, તેલની મીલ, લાડડાં કાપવાની કરવત, ચોખાની મીલ, રાઈસ હલર, તેમજ તેના દરેક ભાગો તથા લેથ, ડ્રીલીંગ મર્શિન તથા ઓફિસ એક્સપેલરના લાગો, કુવામાંથી પાણી કાઠવાના હાથથી તથા પાવરથી ચાલી શકે તેવા પર્સો, દરેક જાતના એલ્ટોઝ (હેર, લેધર તથા રઘ્યર) લોઅંડની તેમજ બીડની મુલીઓ, શાફ્ટોંગ ડોલર, પેડીસ્ટલસ, કપલીંગ, બોક્સ એરીંગ, નટ તથા એલ્ટસ તથા હુથીકેટીંગ ઓફિસ તથા ઓઝ વિગેરે છૂટક તેમજ જથ્થામાં ડિફાયન આવે મળશે. એક વખત દ્વારાં ઓર્ડર આપી ખાતી કરવા લલામણ છે.

હૃદ્દ મળો યા કામો:-

ગુજરાત મશીનરી સ્ટોર્સ
તારકેશ્વર મહાદેવ, વડોદરા

સદ્ગુર

રવદેશી

ધી

જ્યુપીટર જનરલ ઇન્સ્યુરન્સ કુંપની લીમિટેડ

હેડ ઓફિસ : સુખાર્દી

હિંદની આગેવાન

દરેક જાતના વિમા ઉતારનારી વીમા કુંપની

રૂ. ૩૧, ૬૫,૦૦૦,૦૦ થી વધુ

લંદગીના વીમા

આતાના ચીંડ

એજન્ટસ

આર. સી. શેઠની કું.

ટ. ખાડીઆ-અમદાવાદ.

તા. ક.—એજન્ટનાને મારે ઉદાર શરતો તથા કાપમી રીન્યુઅલ